

શ્રી સુધર્માસ્વામી

દાદાસાહેબ, લાયનગર,
કોન : ૦૨૭૮-૨૪૩૫૩૩૨૨

૩૦૦૮૮૮૮

શ્રી કલ્યાણુચંદ્રજી
નૈત અંથમાળા
પુષ્પ ર જી.

૨૮૧૪

પૂજય ૧૦૦૮ શ્રી કલ્યાણુચંદ્રજી
મહારાજ સાહેખનું

લવનયારિત્રિ



સંપાદક,

યતિશિષ્ય રતિલાલજ

શ્રી કલ્યાણુચંદ્રજી જૈન અંથમાળા પુષ્પ ૨ જુ.

પૂજયશ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણુચંદ્રજી
મહારાજ સાહેભનું

જવનાચરિત્ર



સંપાદક,

યતિશિષ્ય રત્નલાક્ષ્મિ



પ્રકાશક,

શ્રી કલ્યાણુચંદ્રજી જૈન અંથમાળા
ગાંડલ


—o—

પ્રથમાવૃત્તિ

::

સંવત ૧૯૬૪

મુદ્રકઃ—શાહ ગુલાખચંદ લલુલાધ,
શ્રી મહોદ્ય પ્રીન્ટિંગ પ્રેસ, દાણાપીઠ-ભાવનગર.



યત્તિવર્ય પૂજયશ્રી ૧૦૦૮ શ્રી સ્વરૂપગંડળ



પૂજય ગુરૂદેવ મહર્ષિ સ્વરૂપચંદ્રજી,

બચપણુમાં જ્ઞાન મેળવી પછી વિચારકપણુધી
ઉત્પજ્ઞ થએલ અસાંપ્રદાયીકતા વિગેરે જે કાંઈ આ
શિષ્યમાં વિકાસ થયો છે તે આપનો કૃપાનું જ
કુળ છે.

તે લાર વશ થઇ આ ચરિત્ર મારી અદ્ય
બુદ્ધિએ તૈયાર કરેલ તે આપના કરકમળમાં
અર્પણ કરી છું.

આપનો શિષ્ય
રતિલાલ

સંપાદકની નોંધ

પશ્ચિમની જડ સંસ્કૃતિમાંથી ભારતવર્ષને ખડાર કાઢવા આત્મવાદના રસાયણુની અધિક ઉપરોગિતા છે એમ આદ્યાત્મ અનુભવિએઓએ સિદ્ધ કર્યું છે.

ભારતવર્ષ ઉજ્જ્વળિની ટોચ ઉપર નથી આવી શકતો તેના અનેક કારણોની સાથે સંયમની નિર્ભળતા પણ પ્રાધાન્યપણું હેઠાય છે. આવા સમયમાં ધર્મ ઉપરોગિતાએ કુચિયાકંડને ગૌણ રાખી સમાજને ચારિત્રવાન બનાવવાની પ્રવૃત્તિને પ્રાધાન્ય આપવું જોઈએ. કારણ પ્રાચીન ભારતના સંસ્કૃતિસર્જાએ અને ધર્મસંસ્થાપકોમાં ચારિત્રની જ સુવાસ હતી અને તે મહાપુરુષોની પ્રવૃત્તિ જ ચારિત્ર ધડવાની હતી. આર્ય અને જૈન સંસ્કૃતિનો પાયો પણ ચારિત્ર ઉપર છે. સંસ્કૃતિસર્જાએ જ્યારે હતા ત્યારે તેઓના ચારિત્રખળથી અનેકોને મુંગા આશિર્વાદદ્રિપ નીવડતા. તેઓ મૌન સેવે ધ્યાનસ્થ સ્થીતિમાં રહે છતાં તેમને જોતાં જ પ્રણામાં

નવીન ચીનગારીયો પ્રગટતી, નવીન ઉત્સાહ ફેલાતો, અને ચરિત્રવાન મહર્ષિઓની છાયા તળે સમાજ સેવકો, અનેક આંહોલનો હૃદયમાં ઉત્પન્ન કરી સમાજની મુંગી સેવા ખણવતા. જે મહાપુરુષોની હૃદાતી અનેક આંહોલનો ઉત્પન્ન કરે છે, તે મહાપુરુષોની હૃદાતી ખાઈ તેઓશ્રીના જીવન ચરિત્રો પણ પ્રણને આશીર્વાદ રૂપ નીવડે છે અને સમાજના જીવનને ઉજ્જ્વલ બનાવવા મહદુગાર નીવડે છે.

આજકાલ અનેક પ્રકારના ચરિત્રો પ્રકાશમાં આવે છે. જેના વાંચનથી જીવનમાં અજ્ઞાનતા અને અંધશ્રુતી ન પરેશો તેજ ચરિત્ર આત્માને વિકાસ કરવા મહદુરૂપ બની શકે. ચરિત્રોના વાંચનથી ચરિત્રનાયકનું જે ધૈર્ય હોય તેની વાંચકગણું ઉપર અજ્ઞન છાપ પડે છે. આત્મજ્ઞાની પુરુષોના જીવન વાંચનથી આત્મજ્ઞાનનો ખ્યાલ આવે. અલ્લાયારી પુરુષોના વાંચનથી અલ્લાયર્ના ગુણું અને રસનો ખ્યાલ આવે, ટેકવાન પુરુષોના જીવન વાંચનથી પ્રતિજ્ઞાની મહત્ત્વાની સમજય છે અને રાષ્ટ્રપ્રેમી મનુષ્યોના જીવન વાંચનથી દેશપ્રેમનો ખ્યાલ આવે છે. આથી મહાપુરુષોના જીવન ચરિત્રો આપણાં જીવનનો માર્ગ સરળ બનાવવા એક ચંત્ર જેવું કામ કરે છે. જે જ્ઞાન અને અનુભવ બીજા ન આપી શકે તે મહાપુરુષોના જીવન ચરિત્રો આપો શકે છે.

મહાપુરુષોના જીવન એકાંતે આપણાં જીવનને ધડવા બહુ મહત્વનો લાગ લજવે છે. તે જીવન ચરિત્રથી સત્યાસત્યનો નિર્ણય થાય છે. આ સિવાય ચરિત્રો પ્રકાશ કરવાનો બીજો હેતુ હોતો જ નથી. જીવન ઈતિહાસો લખવાની પ્રથા બહુ પ્રાચીન છે, સમય બદલાતા તેનું સ્વરૂપ બદલાય છે. પહેલાના ઈતિહાસો તાડપત્રો ઉપર લખાતા જ્યારે કાગ-જોની ઉત્પત્તિ થઈ ર્યારે તેના પાના ઉપર લખાવા માંડ્યા અને સમય કુરતા પુસ્તકરૂપે પ્રગટ થવા લાગ્યા. લગભગ દરેક દર્શનોમાં ચરિત્રો પ્રકાશ કરવાની પ્રથા છે. જૈન ધર્મમાં તો કથાનુચોગ, ચરિતાનુચોગનો આપો વર્ગ જ જુદ્ધો છે. વેદાંત વિગેરમાં પણ અનેક ચરિત્રાથી ભરેલા અંથો છે. જીવન ચરિત્ર એટલે એક મહાન વિભૂતિના જીવનમાં બનેલા બનાવો અને તેનો સંબંધ. જીવન ઈતિહાસો તેના જ લખાય કે જેઓએ આત્મવિકાસ કરવા જીવન સમર્પણ કર્યું હોય. વિશ્વાપિ સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતાર્યો હોય તેજ મહાપુરુષોના આદર્શ રૂપ જીવન ચરિત્રો લખાઈ હુનિયામાં પ્રકાશ થાય છે. જેઓ હુનિયામાં સ્વાર્થિંદ્ધ હોય. જીવન કલહમાં જીવન-સમર્પિત કર્યું હોય. ક્ષણિક મોજશોખ પાછળ આત્મશક્તિનું લીલામ કરનારા હોય. વિષયો પાછળ લટકી ગુલામી મનોદીશાનું સર્જન કરતા હોય. બંત્રવત કમાણી કરી કુદુંબ બંધનમાં જ

જીવન ખલાસ કરતા હોય. તેવા પુરુષોના જીવન ચરિત્રો કહિ લખાતાં નથી.

અધોાર સંયમ, અડગ મનોવૃત્તિ, અટલ આત્મ સાધના અને અપાર સહનશિલતા ઈત્યાદિ અનેક સંઘર્ષણો જીવનમાં આદર્શિક્રિપે જરૂરી જનતા ઉપર અસાધારણું અસર ઉપજીવનાર, અનેક આત્માઓને અહિંસા ધર્મના પૂજાક બનાવનાર, અનેકોને સંસારના કીચડમાંથી બહાર કાઢવા સહાધ્યાઈ બનાવનાર પૂજય ગુરુહેવશ્રી ૧૦૦૮ શ્રી કુલયાળુચંદ્રજીના જીવન પ્રસંગો અને તે આદર્શ પુરુષની જીવન ઘટનાઓ જેટલા પ્રમાણુમાં મારી સન્મુખ આવી અને સપ્રમાણુ મને મળી શકી, તે પ્રમાણુ મૂળ રૂપરૂપમાં આ નાના પુસ્તકમાં નોંધી છે.

જગતમાં અનેક વિભૂતિઓ જન્મે છે અને આદર્શિક્રિપ બોધ લેવા લાયક જીવન જીવી સ્થુળ દેહને છાડી ચાલ્યા જાય છે. પરંતુ તેમનું આદર્શ ક્રિપ શરીર કાયમ રહે છે.

જે ગુરુહેવનો પ્રથમં લખવા હું તૈયાર થયો છું તે પૂજયશ્રી સામાન્ય એસવાળ કુટુંબમાં જન્મી શ્રીમંતોની સગવડથી રહિત ઉછરી વૈરાગ્યના વેગમાં આવ્યા. ચારિત્રાવસ્થામાં આવ્યા પછી તેઓશ્રીના દેહને અનેકો નમન કરી કૃતાર્થ થાતા. એ કર્મજીવિ

કર્મના ક્ષેત્રમાં આત્મસિદ્ધિ પછવાડે અહરિંશા ધ્યાનસ્થ સ્થીતિમાં રાત્રીના ઉલાગરા કરી સિદ્ધિને સાઈ બનાવતા. તેઓશ્રીનાં અપૂર્વ જીવનથી જૈન સમાજ પૂર્ણ પરિચીત છે.

તેઓશ્રીના આત્માને સંપૂર્ણપણે ઓળખવાની આપણામાં શક્તિ નથી. તેમના તપની સામે ઉલા રહેવાની આપણામાં પવિત્રતા નથી. તેમના ધ્યાનની આપણને પરવા નથી. ગામડે ગામડે વિહાર કરી આત્મ ગૌરવ વધારી ધર્મનું સ્વરૂપ જનતાને સમજવવા અને તેની અંદરથી અજ્ઞાનતા, જડતા, અંધશ્રીદ્વા, સંકુચિતતા વિગેરેનો નાશ કરવામાં કાયરતાને હૃઠાવી શૂરાતન પ્રગટાવવામાં પૂજ્ય ગુરુદેવે બાકી રાખી નથી. એ મહાત્માના જીવન પ્રસંગો જનતા સમક્ષ પ્રકાશ કરવા માટે મને શુલ ધડી પ્રાપ્ત થથ છે, તે મારા ણાદ્ય આત્મા માટે મહા લાગ્યની પણ છે અને જાંદગીનું પરમ કર્તાંય છે, એમ માનું છું.


ચરિત્રની સત્ય હક્કિકત મેળવવા મેં જાતે પ્રયાસ કરી ગુરુવર્ય પૂજ્યશ્રી સ્વરૂપચંદ્રજી આગળથી સાંભળી કેટલુંક ટાંચન કરી તેના ઉપરથી અને ધીજ રામજ હેવજ મડીઆ ણગસરાવાળાએ પ્રસિદ્ધ કરેલા જીવન ચરિત્રમાંથી સત્ય હક્કિકતો મેળવી સત્ય ઇતિહાસના આધારે મેં તૈયાર કરેલ છે.

કટિપત વસ્તુ કે અસત્ય ઘટનાઓથી હુર રહેવા દરેક વખતે કાળજી રખાઈ છે. વાંચ્યું, જાણ્યું અને સાંલજ્યું. તે દરેકનો આમાં સંબ્રહ છે. સુજા વાંચ્યો હંસવૃત્તિએ નીરિક્ષણ કરે.

આ ચરિત્રમાં તુટિએ રહે તે સંભવિત છે. કારણું મહાન् પુરુષનું જીવન ચરિત્ર લખવાનું ગણ ઉપરાંતનું સાહસ મારા બાલ્યવયમાં સ્વીકાર્યું. ખામી ન રહે તેને માટે ઘણી જ તૈયારી રાખો અને પક્ષપાતથી હુર રહી સત્ય સિદ્ધાંતને જગત્વી રાખી કોઈની પણ લાગણી ન હુઃખાય તે ધ્યેય સન્મુખ રાખી સત્ય ઈતિહાસ પ્રગટ કરો છે.

પૂજ્યશ્રીના એ ત્રણ જીવન પ્રસંગો એવા આલેખાયા છે કે જેથી સાંપ્રદાયિક દૃષ્ટિએ ઘણુને પક્ષપાત લાગે પણ સત્ય ઈતિહાસ પ્રગટ કરતાં મારી કલમ બંધ ન રહી. તેમ છતાં સત્ય રજી કરતાં કોઈને પણ મન હુઃખ થાય તો દિલગીર.

માનવભવની વિશાળતા ખતાવનાર સત્ય પ્રગટ કરતાં વંદ્નીય આત્માઓના વચનામૃતો લેગા કરી જે વિચારો પ્રગટ કર્યા છે તે કોઈ પણ વ્યક્તિ કે સાંપ્રદાય ઉપર કાંઈપણ સમજી લેવાની સંકુચિત માનસ ન રાખતાં વિશાળ દૃષ્ટિ વાંચન કરવા નાખ અરજ છે.



સુધર્માસ્વામી : અતિશ્યાય રત્નલાલ

જીવન ચરિત્રની અસલ નકલને સુધારવા
 વડીલ બંધુ શ્રી ભીખાલાલજીએ યોગ્ય પ્રયત્નો
 કર્યા છે. ઉપરાંત અમારા વિદ્ધાન મિત્રો એચ. એસ.
 માસ્ટર તથા લાવનગર નિવાસી વડીલ વૃજલાલ
 ણકોરદાસલાઈએ પોતાના કિંમતી વળતે આખું
 જીવન ચરિત્ર વાંચી અદ્યપાંશે રહેલા ભાષા ફોષને
 સુધારી મારા પ્રયાસને સફળ કરવા મદદ કરી છે.

| | | |
|---|---|---|
| ગોંડલ. ફાગણું શુદ્ધ ૧૫ ૧૯૯૪. | { | યતિશિષ્ય રતિલાલજી. લોંકાગંધી ઉપાદ્રય. |
|---|---|---|

ખૂબ હું હું

પ્રસ્તાવના

હું હું

જ્યારે બાધ્યવય હતું ત્યારે યતિમુનીરાજેની અનેક વાતો સાંભળી હતી. તેમની કીર્તિ મેં વિરોધ પ્રમાણમાં મંત્ર અને ચમત્કારીકપણામાં શ્રવણ કરેલી. ૧૯૪૨ માં પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજી ગોંડલ મુકામે પથારેલા અને કંદ્ઘક ધાંધલ થચેલ તે પણ મેં ખીજ મનુષ્યો પાસેથી સાંભળેલું પણ તે બાળુ રસવૃતી નહોંતી. મારી ઉમર મોટી થઈ અને મુંખ-છમાં વસવાટ થયો તેથી ગોંડલમાં આવતા યતિ મુનીરાજેનો પરિયય ન ડેળવી શક્યો અને તેથી તેઓશ્રી પરત્વે આકર્ષણું ન થયું. ત્યાર પછી કાળાંતરે ગોંડલમાં યતિ મુનીરાજેનો પગરવ ઓછો થવા લાગ્યો એટલે સમાજનો થોડો વર્ગ પણ જેની યતિ મુનીરાજે ઉપર રસવૃતી હતી તે પણ નરમ પડી ગયો. ૧૯૭૪ માં સ્વ. પૂજ્યાચાર્યશ્રી ખુખ્યચંદ્રજી મહારાજ સાહેબ પથારેલા ત્યારપછી ગોંડલમાં ડોઢ ન આવ્યું. ૧૩ વરસના વાણું વાદ્ય ચુક્કયા. ૧૩ વરસ પછી પૂજ્ય આચાર્યશ્રી ન્યાયચંદ્રજી વેરાવળથી વડોદરા જતા હતા. સંધને જણું થઈ. રટેશન ઉપર શ્રીસંધે વિનાંતિ કરી કે અમારો દોષ કયો? કે અમારે ત્યાં યતિ મુનીરાજને ચાતુર્માસ ન મોકલો. તે વરસે તો કોઢ ન આવ્યું. ચાર વરસ સુધી વિનાંતિપત્રો મોકલ્યા પણ તે યતિ મુનીરાજેની

કુંક સંખ્યાને લીધે નિરર્થક ગયા. ૧૯૬૨ ની સાલમાં પણ દર વર્ષ પ્રમાણે ચાતુર્માસ માટે વિનંતિપત્ર આચાર્યશ્રી ઉપર લખ્યો અને જવાઅમાં યતિશિષ્ય રતીલાલજીનું ચાતુર્માસ ગોંડલ સુકામે નિમવામાં આવ્યું છે એમ આચાર્યશ્રીએ લખી મોકલ્યું. શ્રી સંધમાં જાણ થઈ. ૧૮ વરસ પછી લેંકાગંધી ઉપાશ્રેચ ચાતુર્માસ નિમાયું છતાં શરૂઆતમાં શ્રી સંધનો ઉત્સાહ જોઈએ તેવો નહોતો. કારણમાં રતીલાલજીથી અજાણુપણું અને તેમની અદિક્ષિત અવસ્થા આદ હિવસમાં તો તેમની વિદ્વતાની સાને જાણ થઈ. સૌનું આકૃષ્ણ થવા લાગ્યું. વ્યાખ્યાનની શરૂઆત થઈ અને સેંકડોની સંખ્યામાં સ્વીપુરુષો આવવા લાગ્યા. આવણ વદ ૧૦ આવી. પૂજયશ્રી કલ્યાણચંદ્રજી મહારાજ સાહેબની નિર્વાણ તિથિ ઉજવવા રતીલાલજીએ વાત કરી. કોઈ હિવસ ગોંડલના જૈન ધતિહાસમાં બન્યું નથી અને નવિન વરસુ આવે એટલે તે પસાર થાય તે પણ કરીન. પણ શ્રીસંધે જ્યાંતીના સરધસ કાઢવા અંધ્યારી ઠરાવ પસાર કર્યો. ૧૦ ને હિવસે લભ્ય સમુહમાં ચારે સંધની હાજરીમાં સરધસ નીકળ્યું. ગોંડલના જૈન ધતિહાસમાં તે દેખાવ પહેલેનું હતો અને તે જ્યાંતીના કાર્યક્રમમાં જ સાહીત્ય પ્રકાશન માટે શ્રી કલ્યાણચંદ્રજી જૈન અંથમાળા સ્થાપન કરવામાં આવી અને તેના પ્રથમ પુષ્પ તરીકે પંચ પ્રતિક્રમણ અર્થ અને ભાવાર્થ સહીત યતિશિષ્ય રતીલાલજીએ તૈયાર કરેલ ૧૯૬૩ ના માગશર શુદ્ધ પુનમે પ્રકાશિત કર્યું. માસ પસાર થયા. સુલાગણે યતિશિષ્ય રતીલાલજીનું ખીજ્ઞ ચાતુર્માસ પણ ગોંડલ શ્રી સંધના આગ્રહી નિમાયું. પ્રથમ વર્ષની જેમ જ્યાંતી ઉજવાણી. ખીજ પ્રકાશન રૂપે પૂજયશ્રી કલ્યા-

એચયંડલ્ઝનું જીવન ચરિત્ર અંથમાળા તરફથી અહાર પાડવા રતીલાલલ્જએ તૈયાર કર્યું. વાંચ્યું અને તેની પ્રસ્તાવના લખવાની ઇરજ મહારા ઉપર આવી.

પાકડ ! પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજી લોંકાગંછના આચાર્ય હતા. લોંકાશાહની સેવા દીગંતભાપી રાખવા પૂર્વાચાર્યેને લોંકાગંછ નામ રાખ્યું હતું. લોંકાશાહે માર્ટ્ઝિન લ્યુથરની જેમ પોકાર કરી શાસ્કોક્તા રીતે મુત્તીપુલ્ઝનું ખંડન કરી શીથીલાચારી સાધુઓના વૃત્ત સંયમ દફ કર્યા. લોંકાશાહને લ્યુથરમાં ફેર એટલો જ કે માર્ટ્ઝિન લ્યુથર પાદરી હતા અને લોંકાશાહ આદર્શ ગૃહરથાશમી હતા. તે જ લોંકાગંછની પરંપરામાં પૂજ્યશ્રી કલ્યાણચંદ્રજી થયા જેમનું દ્રષ્ટ જેતાં જ નૈન સંસ્કૃતિની છાયા દેખાઈ આવે. જેમની ધ્યાન અને સાધકવૃતી સંબળતાં સાચા નૈનલિક્ષ્ણનું રમરણ થાય. તેએ આધ્યાત્મીક હતા એટલે સંયમી હતા. બાલ્ય અને અભ્યંતર બન્ને સંયમમાં એકલીન હતા. તેમની આત્મશક્તી અદ્વીતીય હતી. તેમની વિદ્ધતા પણ અસત્યનું ઉન્મુલન કરનારી હતી. પૂજ્યશ્રીની વ્યાખ્યાન લાષા ગુજરાતી અને મારવાડી અન્ને મિશ્રણ હતી અને તેથી તેમની મીડી ભાષાના પ્રતાપે શ્રાવકો અને ઓનાઓ ઉપર અકથ્ય છાપ પડી હતી. પૂજ્ય શ્રી કંદ્ચ ધશ્યર નહોતા તેમ ધર્મસર્જન પણ નહોતા પણ એક આધ્યાત્મપંથના પથિક હતા. સંયમી હતા. સંયમ પાળતા અને પળાવતાં. પૂજ્ય શ્રી કલ્યાણચંદ્રજી મારવાડના જોધપુર રટેમાં આવેલા પાલીમાં જન્મ્યા. કુદરતના વાતાવરણમાં ઉછ્રી યૌવનવયમાં આવ્યા. લગ્નની વાતો વખતમાં તેમની વીચારક શક્તીએ જગતના દુઃખ તરફ દૃષ્ટી કરી. જગત જણે પોકાર કરી કહેતું હોય કે અમારા દુઃખ કાઢવા

તમે આવો અને દ્યાનો જરો વહેવરાવવા જગતને માર્ગ
ખતાવો તેમ ૧૯૦૮ માં તેમની વિચારક શક્તિ આ ચારિત્ર
લેખકે યોજેલા દ્વિક્ષાની લાવના એ નાનકડાં ચોથાં પ્રકર-
ણુમાં પૂજયશ્રીની વિચારક શક્તિ અર્વાચીન ભારતમાં શોધી
જડે નહિ. તેમની સાધક દશા તો આજે મોંદી બની છે.
આજના માનવ સમુહમાં તેમના જેટલી સાધક દશા ક્યાં
સંતની છે તે કદ્દપતા પણ બુદ્ધિને કસવી પડે. બાલ્યવયમાંથી
પસાર થીએ ગુરુના મંયોગે વિચારોમાં વૈરાગ્યનું મોજું
આએયું. અને માતપિતાને સમજવી લાગવૃત્તમાં અલંકૃત
થયા ત્યારપણી તેમનું શાનદળ સંયમની આરાધના અલ-
ચર્યના તપોવનમાં તેમનો વિહાર તત્વજ્ઞાનની ઉચ્ચતમ શૈખીમાં
દ્વિસે દ્વિસે આગળ વધતા તેમની આત્મસાધક વૃતીની
અડગતાનો ઘ્યાલ પાડકગણુને સુરતના ગામડાના બનાવ
ઉપરથી જ અનુભવ થાય તેવો છે. અને આચાર્યપદ ઉપર
આબ્યા પણી હજરો મનુષ્યોને મંત્રમુગ્ધ બનાવે તેવી વાક-
પદૃતા પણ અનેક વિદ્ધાનોને શરમાવે તેવી હતી. તેમ
ચારિત્રભળનો પ્રભાવ તો તેમના જીવનમાં નણું પ્રસંગો
એવા છે કે વાંચકને રહેજે તેમના ચારિત્ર ઉપર પૂજય
ભાવ પ્રગટે અને તે ચારિત્રભળને અંગે તેમની નિર્બંધ
વૃતી પણ દેખાઈ આવે. કર્તાબ્યને માટે લોકાપવાદનો ભય
પણ તેમણે જીવનમાંથી દુર કર્યો હતો. તેમનો વિહાર પ્રદેશ
પણ અત્યારના મુનિવરોની જેમ સંકુચિત નહોતો પણ
વીશાળ હતો તે સર્વ માહીતી તેમના અદ્ભુત જીવનનો
પરિચય તેમના જીવનના સંપૂર્ણ વાંચનથી પાડક વર્ગના
ઘ્યાલમાં આવશે.

૧૭

સુરૂ પાઠક સંસારની મુસાફરી ગણ છે તેમાંથી સહી સલામત પસાર થવું તેથી પણ વિકટ છે. માટે તેમાંથી પસાર થવા મહાપુરુષોના આદર્શ જીવન તરફ દશ્ટી કર અને મહાપુરુષોના આદર્શો અદ્વિતીય ગુણો નિષ્કામ વૃત્તી વગેરે તહારામાં ઉતરે તે રસ્તે જીવનને લઈ જઈ જીવન સાકલ્ય કર.


લીઠ સેવક,
અનુલાલ બાળાચંદ.

મંત્રી શ્રી કવ્યાણુચંદ્રલી જૈન અંથમાગા.
મોટી બજર.
ગાંડલ (કાડીઆવાડ.)

જીવન ચરિત્રમાં આવતા ઝાટાઓનું સુચીપત્ર.



| | |
|--|-----|
| ૧ પૂજય સ્વરૂપચંદળ. | ૫૪. |
| ૨ સંપાદક: યતિશિષ્ય રત્નલાલજી | |
| ૩ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણચંદળ. ... ,, | ૧ |
| ૪ પૂજયશ્રીના શિષ્ય સ્વ. આચાર્યશ્રી ખુઅચંદળ... ,, | ૧૬ |
| ૫ સ્વ. યતિવર્ય મહારાજ શ્રી મનોરચંદળ. ... ,, | ૩૨ |
| ૬ દીક્ષા સમયે નાગ નાગણ્યિતું લટકવું. ... ,, | ૪૫ |
| ૭ વર્તમાન આચાર્ય શ્રી ન્યાયચંદળ સુરીખરજી ... ,, | ૪૮ |
| ૮ યતિશિષ્ય ભીખાલાલજી ,, | ૫૪ |
| ૯ શિકંદરખાન તરફથી મળેલો પરવાનો. ... ,, | ૮૦ |
| ૧૦ સ્વ. શેઠ રામજીભાઈ માધવજી. ,, | ૬૩ |
| ૧૧ સાદ્ગી તોઝાન ,, | ૧૦૨ |
| ૧૨ જોધપુર સ્ટેટ તરફથી મળેલો પરવાનો નં-૧ ... ,, | ૧૧૨ |
| ૧૩ „ „ „ „ „ , નં-૨ ... ,, | ૧૨૮ |
| ૧૪ શિરોધી સ્ટેટ તરફથી મળેલો પરવાનો ... ,, | ૧૪૪ |
| ૧૫ શ્રી સમાધી મંદીર. ,, | ૧૬૨ |
| ૧૬ દીલ્હીના ખાદશાહ તરફથી મળેલો પરવાનો ... ,, | ૧૬૪ |
| ૧૭ Stamp of Nine Coins ,, | ૧૬૭ |




નોંધ: ખંભાતમાં ભાવસાર ઝાતિની સાથે દોંકાગચ્છમાં વિશા-
શ્રીમાળીની પણ મોટા પ્રમાણમાં સંખ્યા છે.

જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી લોંકાગંધાધિપતિ



સ્વ. પુનઃચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી સૂરીશરણ



શ્રી ૧૦૦૮ પુજ્ય આચાર્ય
શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું

જવન ચરિત્ર



પાલીમાં જનમ.

પ્રભાત કાળની ઉષા ચારે તરફ પ્રસરેલી હતી.
આકાશમાં ચંદ્ર છેદ્વી અવસ્થામાં આવવાની
તૈયારી કરી રહ્યો હતો. પુર્વ દીશા તરફથી ઉદ્ઘયમાન
થતો સુર્ય ધીરે ધીરે આકાશમાં સ્વયં તપિ પૃથ્વીને
તપાવી રહ્યો હતો. ઉષણુતાને અંગે જન સમાજ
ઉષણુતાથી બચવા વિવિધ પ્રકારના ઉપચાર કરી રહ્યા
હતા. ગુજરાત તેમજ કાઠિયાવાડની ભૂમીમાં ઉષણુ-
કાળના વખતમાં મર્દ ભૂમીના હીસાબે ગરમી ઓછી
તે કથનની સાક્ષીરૂપ ચૈત્ર માસ અને તેમાં મર્દ ભૂમી
એટલે તાપની અવધી. રહેઠાણ કરી રહેલા મનુષ્યોજ
તે ગરમી સહન કરી શકે પણ બહારને માણુસ

તો ત્યાં આવવાના વિચાર કરતાં પણ ડરે. આવી ઉણું ગરમી ને પ્રહેશમાં છે એવા મારવાડના સુપ્રસીદ્ધ પાલી શહેરમાં કે ને શહેર ઐતિહાસીક છે, અને ઈતિહાસની સાક્ષી રૂપે અનેક ખંડરો સ્તુપો અસલી ઈતિહાસની સાક્ષી રૂપ જ્યાં ઉલા છે. જેના રાજ્યકર્તાઓ, સૂર્યવંશી રાડોડની રૂડી જાતથી એળખાય છે ત્યાંના કુશળ અને બુદ્ધિચતુર સાહસીક વ્યાપારીઓ. હેશ પરહેશથી ધન ઉપાઈન કરી હેશમાં આવી પોતાનો વ્યવહાર સુખચૈન પૂર્વક નિર્ગમન કરે છે. તેમજ આ ઉણું અને ઐતિહાસીક શહેરમાં જૈન ધર્મના પ્રાચીન લંડારો જોવામાં આવે છે. ધર્મ અનુયાધારીથી તે શહેર ઉજવળ હેણાય છે. શ્રદ્ધાવાન આત્માઓ જ્યાં જ્યતપ નિયમ વગેરે કરી દરરોજ પ્રાતઃકાળે ધર્મ શ્રવણ કરી એમાં જ કર્તવ્યની ઈતીશ્રી માની રહ્યા છે. અને ધર્મ ઉપહેશક વર્ગ પણ દરરોજ ધર્મનું વાંચન જનતા સમક્ષ વાંચી ૨૪ કલાકમાં જાણું આ એકજ ઝરજ છે એમ સમજી દીવસો નિર્ગમન કરે છે એવા પાલી શહેરમાં જ્યાં અનેક જાતીનો નીવાસ છે. ભીજાભીજ પ્રકૃતિનો જ્યાં શાંભુમેળો છે. છતાં ત્યાં હજુ પશ્ચીમનો પવન અન્ય શહેરોના જેટલો આંદોલાની એટલે ખીલ મોટા શહેરોની અપેક્ષાએ પાલી શહેર જરા પાછળ પડતું

હતું. જે સુધારો પશ્ચિમના દેશોમાં જરૂરી હીંદના મુખ્ય મુખ્ય શહેરોમાં થયો હતો તેવો સુધારો પાલીમાં નહોંતો. વાંચક! જગત સુધારો કેને કહે છે અને વાસ્તવીક તે સુધારો છે કે નહીં તેનો વિચાર કરીએ હાલના વખતમાં તાર ટેલીઝ્ઝાન, વિજળી, આગઝોટ, રેફ્વે, મોટર, લાયબ્રેરી, હોટલ વગેરે અનેક પ્રકારના સાધનો ઉમજ થયા છે. તેનાથી કેટલીક સગવડો વધી છે અને તેને લોકો સુધારો કહે છે કે અમારા ગામમાં હવે સુધારો થઈ ગામ પ્રગતિને પંથે પડયું છે અને જ્યાં ઉપર લખેલ સુધારો નહોય ત્યાં તે ગામ જમાનાની સાથે નથી, એમ કહેવામાં આવે છે એટલે વાસ્તવીક રીતે તે ગામના માણુસોમાં જમાનાને અનુકૂળ બુદ્ધિ નથી. એમ જે ગામમાં ઉપર લખેલ સુધારો થયો હોય તે માની લીએ છે. પણ વાંચક! તેમાં સુધારો નથી. એ સગવડોમાં માણુસ પોતે પરોવાઈ પોતાનું ભાન ભુલી જય છે. ખરો સુધારો ત્યારેજ કહેવાય કે જ્યારે જન સમાજમાં નીતી વધે પરસ્પર ભાતુભાવ વધે. સંયમ પ્રત્યે પ્રેમ જાગે અને ચારિત્ર ઉચ્ચુ કેળવાય. વર્તમાન સુધારાથી અને વર્તમાન કેળવણીથી બુદ્ધિ અને તર્ક વધ્યા છે પણ તેના પ્રમાણમાં હુદય સુધર્યા નથી તેથી જ આધ્યાત્મીક પ્રકાશનો અનુભવ કરનારાઓ કહે છે કે આત્માને

આચાર્ય શ્રી કલ્યાણુચંદ્રજી મહારાજનું જીવનચરિત.

જાણ્યા વગરનું જીવન ગાળવું તે સમુદ્રના જ્ઞાન વગર
વહ્નાણુ હુંકારવા જેવું છે. જેમ શરીરની રક્ષા માટે
અને પોષણુ માટે અન્ન અને પાણીની જરૂરીયાત
છે તેમ આત્મોનની માટે મુદ્દ્યમાં પવીત્ર અને
નીર્મણ લાગણીઓની પણ જરૂર છે. ઉચ્ચ કોટીનું
જીવન ગાળવામાં ક્ષણે ક્ષણે પોતાની જવાણદારી
સમજવા પડે છે અને કેટલીયે વાર સ્વાર્થ ત્યાગની
જરૂર પડે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય તો હરેક
કામ વખતે શું કરવું શું ન કરવું તેની યથાર્થ
ખળર પડે છે. એટલે સત્યાસત્યનો નિર્ણય થાય
છે. તેજ સાચો સુધારો છે. અત્યારે તો જગતની
ક્રિયે પાછળ રહેલા પાલી શહેરમાં આત્મજ્ઞાનીઓ
જે સુધારો કહે છે તેવા સુધારામાં પોતાનું
જીવન લઈ જઈ જગતને તે માર્ગ લઈ જનારા
મહાપુરુષો જગતમાં અનેક જન્મયા હતા. તેમાં
વાંચક પાલીમાં જન્મેલા એક મહાપુરુષને બાપણે
ઓળખવા છે. તે મહાપુરુષનો જન્મ સુપ્રસિદ્ધ
ઓશવાળની જ્ઞાતિમાં દોલાળ નામના વણીકને લાં
થયો હતો. દોલાળ પરાપુર્વથી જૈન ધર્મની હતા.
તેમના વડીલોાની દાન ધર્મ કરવાની રીત ધાણીજ
ખ્યાતિમાં હતી. અને દોલાળ પણ તેજ વિચાર
શ્રેણીમાં ઉછરી ભોટા થયા હતા. લાંખા કાળથી

તેમના ધરની સ્થીતિ મધ્યમપણે ચાલ્યા કરતી હતી. નાનીશી કાપડની ફુકાન ઉપર તેમનો જીવનનિર્વાહ હતો. છતાં મધ્યમ સ્થીતિમાં પણ ગરીઓને સંતોષ-વામાં જ પોતે આનંદ માનતા હતા. ફુરના સગાઓ પ્રત્યે પણ અતુલ સ્નેહ રાખવા સ્વલાવ ટેવાઈ ગયો હતો. આતિથ્યસત્કાર તો તેઓ બહુ જ પ્રેમથી કરતા. તેમની પત્ની નોળુણાઈ પણ પવિત્ર અને સરળ સ્વલાવી હતા. આર્ય પત્નીને હીપે તેવા જ તેમના કાર્યો હતા. આખા હીવસમાં ભાગ્યે જ તેમને નવરાશ મળતી. સવારે ઉઠે કે તરત જ ધાર્મિક સંસ્કારની પ્રણાણ છાપે સામાયક કરે. દરરોજ એક સામાયક કરવી તેવો તેમને નિયમ હતો. અને ત્યાર પછીજ સંસારના ધરકાર્યમાં પડતા. નવરાશ મળે એટલે આદર્શ પુસ્તકો વાંચી કાળ વ્યતિત કરે. આમ બંને હંપતિ હીવસો નિર્ગમન કરતા હતા. મર્યાદા અને વિવેક જેમના હુથીયાર હતા. અને તે હુથીયારથી જ સમાજમાં નાનાથી મોટા દરેક મનુષ્યોને વશ કરવામાં વિજયી નિવજ્યા હતા. શાતિમાં પણ તેઓ અગ્રેસર ગણુંતા છતાં અગ્રેસર તરીકે આપ ખુદીનો જરા પણ અંશ નહોંતો. શાતિમાં અગ્રેસર હોય તેણે શાતિ સેવા કરવી જોઈએ એમ માની શાતી સેવા કરતા અને પોતાના એ મહુદ ભાગ્ય

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત.

માટે ધન્ય માનતા. કમાણીનો દશમો ભાગ અનાથોને બહેંચતા. સાક્ષાત સાદાઈની મૂર્તિસ્વરૂપ એવા હંપતિ પોતાની ઝેરજને યથાર્થ સમજતા હતા. સાંજના વખતમાં પોતાના સંતાનો પાસે શીયળવાન આત્માઓના જીવન પ્રસંગો વંચાવી પોતે સાંલળે. પોતાના સંતાનોને પણ આડકતરી રીતે પૂર્વના શીયળપ્રાણ્યાન આત્માઓના જીવન વંચાવે તેની અંદર તેજ છાપ પાડવા માટે અને એવા જ પુસ્તકો વંચાવવામાં તેઓ પુત્રનું હીત સમજતા હતા. વાંચક સંતાનોનું જીવન સુધારવા માટે દરેક માતા પીતા જો આવો અખતરો કરે તો જરૂર નૈતિક નિર્ણયાન જે આજના સંતાનોમાં હેખાય છે તે ન હેખાય. બન્ને હંપતિને સુદર્શન અને વીજય શેડની કથાઓ બહુ ગમતી, ધરમાં મોટા તરીકે પણ તેઓ હતા એટલે બન્ને સ્વતંત્ર હતા છતાં પણ સ્વતંત્રતાનો ગેરઉપયોગ નહોતો. તેમના મુખ ઉપર કોઈ અનોખુ તેજ હતું. વર્તમાન પતિ પત્નીથી તેમની વિચારણાં જુહી હતી. હુનિયાના લોગવિલાસમાં તેઓ સંલીધન ન હતા. વાંચક સંસારીક તેમજ આધ્યાત્મિક પુરુષો ઘડવાનું કાર્ય માતા અને પિતાનું છે. જ્યારે સ્ત્રી પુરુષો કેવળ પોતાનો સખાંધ લોગવિલાસ માટેજ ચોણયેલ છે એમ જ્યારે માને છે ત્યારે

એહિક સુખો પછવાડે જીવનનું લીલામ કરી નાંખી મહાપુરુષોને જન્મ આપવાની પવિત્ર ફરજથી પતિત થાય છે. જગતના તમામ ઈતિહાસના અપવાદ સિવાય મહાપુરુષોના જીવન ચરિત્રો જોતા મુખ્ય તેઓના માતાપિતાઓના સંયમનીજ પ્રાધ્યાનતા દેખાય છે, અને તેથી બાળકો પણ સંયમિ બની મહાપુરુષ તરીકે જગતમાં બહાર આવે છે. જ્યારે વર્તમાન સ્થાતિમાં તો બાળકોના વાતાવરણુમાં વિકાર રમતો નજરે પડે છે. આજે મોટા શહેરોમાંથી વિકાર આડે વાડ જેવી મર્યાદા લોપ થતાં મનુષ્ય જીવન અવ્યવસ્થિત બની ગયું છે. આજે જે અવસ્થામાં અખ્રાચર્યનો ખ્યાલ પણ ન આવવો જોઈએ ત્યાં બાળકોને હોમાતા જોઈએ છે. આજે સમજણું બાળકોને ઘરમાં રાખી એમના રહેઠાણુમાં જ વાસનામય માતા પિતાની અમર્યાદિત વર્તણુંકથી જ સંતતીને વિષયો બનાવવામાં આવે છે ત્યાં મહાપુરુષની આશા કયાંથી રાખી શકાય. આજે વ્યલિચાર શિખાતો નથી પણ ગળથુંથીમાં આવે છે અને પારણામાં પોષાય છે. અદ્યાભાયુ, માયકાંગલા પણું, અશક્તિ, ફુર્ણિંગતા તે પામના જ ઝોંગો છે. જ્યાં સુધી વાતાવરણ શુદ્ધ નહીં થાય, જ્યાં સુધી આંખ આગળ રમાતી વિકારની રમતો બંધ નહીં

આચાર્ય શ્રી કલ્યાણુચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

થાય, ત્યાં સુધી સંતતી ઉપર પડતા વિકારના રજકણો નહીં અટકાવાય. અને આજે તેથી જ અહંગ આત્મશર્દ્રા કયાંય દેખાતી નથી. દિષ્ટિપા-તથી ભસ્મ કરી નાંખનાર્દું સતીત્વ આજે કયાં છે? પવિત્રતાથી શૂળી ફેરી સિહાસન અનાવનાર સુદર્શન કયાં છે? આવા મહાપુરુષોનો જન્મ આજના વખતના સ્ત્રી પુરુષોએ લેગા થઇને જ અટકાવ્યો છે. વાંચક દોલાજી તથા નોળખાઈમાં પવિત્રતા હતી. સત્યતા હતી, સંયમ હતું અને તેને જ અંગે સર્વ સ્થળોથી અનુકૂળતા પ્રાપ્ત થતી હતી. એક હીવસે પ્રલાતના ટાઈમે નોળખાઈ દોલાજી આગળ આવી, નભ્રતાપૂર્વક વાત કરવા માંડી. આજે પ્રલાતમાં સ્વર્ણ દેખાયું અને તેમાં મેં એક મોટા કેસરી સિંહને પુંછકું હલાવતો જોયો. અને ત્યાં મારી નિંદ્રા ખલાસ થતાં આંખ ઉઘડી ગઈ અને છોડી થઈ. વાંચક! તેજ રાત્રીએ નોળખાઈએ મોટી ઉમરે સ્વર્ણના પ્રલાવથી ગર્ભ ધારણું કર્યો. દોલાજીએ કદ્યું કે મહાન લાલ આપણુંને મળશે. અને આ સ્વર્ણનું કૃળ અદૌાકિક મળાવું જોઈએ એમ વાત કરી સૌ પોતપોતાને કામે વળાયા.

∴ C ∴

ધર કામમાં નોળુભાઈ રોકાયા અને દોલાળ સવારનું નિત્યકર્મ કરી હુકાને ગયા. અનુકૂળે ગર્ભ વૃદ્ધિ પામતો ગયો. નવમાસ પૂર્વ થયા પછી સંવત ૧૮૬૦ ના ચૈત્ર શુદ્ધ ૧૩ ની રમણીય પ્રભાતે નોળુભાઈએ ખાળકનો જન્મ આપ્યો. કુંટુંગમાં આનંદ ફેલાઈ ગયો. દોલાળના તો આનંદનો પાર રહ્યો નહીં. વાંચક! અતે જણાવવાની જરૂર છે કે આ ખાળકના જન્મ થયા પહેલા એક પુત્ર અને એક પુત્રી જન્મ્યા હતા.



આદ્ય કાળી.

બાળક જ્યારે જન્મે છે ત્યારે તેને પોતાની અને જગતની ખુખર હોતી નથી. પોતે જન્મયો એવું શાન પણ તેને હોતું નથી અને જગત એટલે શું તે વિષે પણ તે કંઈ જાણુતો નથી. તેજ પ્રમાણે નોળ-આઈએ જન્મેલો. બાળક પણ પોતાથી અને જગતથી અજાણું હતો. અવિષ્યમાં આ ડોઈ મહાપુરુષ થાશો એમ તેના મુખ ઉપરના તેજ અને રેખાઓ ઉપરથી જણુાતું હતું. ગર્ભ કાળથીજ ઉત્તમ હોહદ વડે અને જન્મયા પછી પ્રભાવીક પણુના ચીનહો વડે બાળકનું નામ કાળીદાસ પાડ્યું. જન્મથી જ તેના શરીરનો ખાંધો સુદ્રદ હતો સુશોભીત વહન કમળ, અષ્ટમિના ચંદ્ર જેવું લલાટ, દીર્ઘ ભુજાઓ કુર્મેજીત ચરણ,

સુકોમળ આંગળીઓ, વિશાળ હૃદય, ઉજ્જવળ વર્ણ
મનરંજન ગતિ, અને દેખતાંજ પ્રિતી ઉપજાવે એવો
તેમનો દેખાવ હતો. સામુદ્રીક લાવ સ્થળને જોતાંજ
આ કોઈ મહા પુરુષ થશે એમ જયોતીષીએ પણ કહેતા.

માતાપીતા અને વડીલ લાઈ બહેનનું વાતસ-
દ્વય સ્વભાવીક રીતે વિશેષ હતું. અનુકૂમે વય વધતાં
પાંચ વરસનો જ્યારે થવા આવ્યો. ત્યારે બાળકની
હુંકી બુદ્ધિ અનુસાર પોતાના પરિવારને ઓળખવા
મંજ્યો, જ્યારે બાળક ચાલતાં શીખે છે ત્યારે તેને લાગે
છે કે પોતે ચાલે છે. પોતાનું શરીર ચાલે છે તે હું
અને તે સિવાયનું બીજું બધું તે હું નહી એમ
તેને લાગે છે. જે હું નહી તેને તે જગત કહે
છે તે જગતમાં રહેલા બીજા માણુસોની સાથે
તેને ધીરે ધીરે સંબંધ થાય છે. સામાન્ય
આદ્યવયથી કાળીદાસની બાદ્યકીડા જુદીજ દેખાતી
હતી. કાળીદાસ જ્યારે રમતો ત્યારે પોતે યતિ બને
બીજા પોતાના સોખતીએને શ્રાવકો બનાવે માટીના
પાત્રા બનાવી તેમના કદ્યોત માનેલા ધરોમાં છોરવા
નાય. અને સાંજે પ્રતીકુમણુ કરે. સવારમાં વ્યાખ્યાન
વાંચે છોકરાંએ સાંલળવા એસે. જુહું બોલવું નહી,
માણાપની સેવા કરવી, ચોકખા રહેવું. આમ બાદ્ય-

વયમાં રમત રમતાં પણ પુર્વના સંસ્કાર વડે આત્મામાં ધર્મને વીકસાવતો હતો. તેમ વળી કોઈવાર રમતા રમતા પોતાના સહેદર ભિત્રોમાં જે તકરાર પડી હોય તો તેનો ન્યાય કરી તકરારને ફર કરતો. અને બાળકો પણ તકરાર થાય કે તરતજ કાળીદાસ પાસે આવી ન્યાય કરાવે. બાહ્યવયમાંજ કાળીદાસની તીવ્રભૂષિ જેઠ માતાપીતા ખુશી થતાં. જગતમાં પુત્ર જેવો પ્રેમ માતાપીતાનો ખીળ કોઈ પણ ઉપર નથી હોતો. સંસારીક નિયમ મુજબ બાળક જેમ જેમ મોઢું થતું જાય છે તેમ તેમ માયાના ક્ષેત્રમાં આવતું જાય છે. સગાઓમાં જે કાકો હોય તો પોતે તેનો ભત્રીજે થાય છે. તેને મામો હોય તો તે પોતે ભાણેજ થાય છે, આવિ દરેક સગાઈ ઓળખતા શીખી સંબંધમાં અતિગાઠ બને છે. અનુકૂમે બાળ ચેષ્ટાઓ કરતા વય વધતાની સાથે ગુણુ રૂપી વૃક્ષ પણ પ્રકુલ્લીત થતાં કાળીદાસની ઉમર આડ વર્ષની થઈ. એક દિવસે કોઈ અમલદારની ગાડી દોલાળુના ઘરે આવી ઉલ્લી રહી તેમાંથી ખહાર નીકળી આવેલ અમલદારે દોલાળુને કંધું કે તમો કાપડ લઈ બંગલે આવજે. થાડુંક કાપડ લૈવું છે એમ દોલાળુને કહી અમલદાર ઘર તરફ જવા માટે ગાડીમાં એઠો તેજ વખતે કાળીદાસે આવી

પીતાને ગાડીમાં એસવાની પોતે ઈચ્છા ભતાવી.
 દોલાજુએ કહું કે આ ગાડી આપણી નથી ગાડીમાં
 એસવા માટે તો કંઈક કાળા ધોળા કરવા પડશે
 પીતાના કહેવાથી કાળીદાસે જણયું કે આ જગતની
 દ્રષ્ટિમાન વસ્તુઓમાં કેટલીક આપણી નથી. અજ્ઞાન
 ખાલ્યદશામાં મારું તારું હેતું જ નથી. અપવાદ સિવાય
 ખાણક જો કંઈ પણ વસ્તુ અથવા ખાવાનો પદાર્થ
 કેશે એટલે પોતાના સોણતીઓને થોડું થોડું આપશે.
 વય વધવાની સાથે સંસારમાં સ્વાર્થભાવના પણ
 વધતી જય છે. પીતાનો જવાણ સાંલભ્યા પછી
 કાળીદાસ પોતાના આત્માજ વીચાર કરવા માંડયો
 કે ત્યારે આપણું શું? ગાડીમાં એસવા માટે કંઈક
 કાળા ધોળા કરવા પડશે એ પીતાના શણદનો ગુંજરવ
 કાનમાં આવવા લાગ્યો. ત્યારે શું ગાડીમાં એસનાર
 દરેક પાપ અને કાળા ધોળા કરીનેજ એસતા હુશે?
 પાપ કર્યા વગર ગાડીમાં એસાતું નહી હોય વિગેરે
 ઘણુંય વિચારો આડ વર્ષની ઉમરના કાળીદાસને
 આવ્યા. બાધ્યવયમાંથી પણુ હુવે રસવૃતી ઉડી જતાં
 ખાલ્ય રમતો પણુ બંધ કરવા લાગ્યો. જે ગંભીરાઈ
 મોટી ઉમરે આવવી જેઠાએ તેને બદલે અત્યારથીજ
 થોડી ઘણું હેખાવા લાગી. દોલાજુએ આડ વર્ષના
 કાળીદાસને નિશાળમાં એસાડવા મુહૂર્ત જોવરાવી

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત.


ગામડી શાળામાં કાળીદાસને મુક્યેા. દરરોજ અન્ય ખાળકોની સાથે ગામડી શાળામાં લણુવા જાય અને ત્યાંથી સીઢો ધરે આવે. હવે એ સિવાય કાળીદાસને ખીંબું કાર્યક્ષેત્ર નહોતું. અલ્યાસમાં હુમેશ નિયમ સર રહેતો. કાળીદાસનો વિનય જોઈ માસ્તર પણ ખડુજ તેના પર પ્રેમથી જોતા. ખીંબ છોકરાઓની સાથે સંપથી રહી શિક્ષણુમાં ઉચ્ચ નંબરના વિદ્યાર્થી તરીકે હરેકની પ્રસંશા મેળવી.

ઉમરના વરસનો આંકડો વધતો ગયો અને શિક્ષણુમાં વૃદ્ધી થતી ગઈ. પુસ્તકો તેજ તેના રમકડાં હતા. વરસ ઉપર વરસ ચાહ્યાં અને કાળીદાસની ઉમર પંદર વર્ષની થદ તીવ્રખુદ્ધિના પ્રતાપે વ્યવહારીક ધોરણો પસાર કર્યા. હવે સંસારીક કેળવણી ઉપરથી મન ઉઠી ગયું અને હીવસે હીવસે તેના પર અણુગમો આવવા લાગ્યો. એક હીવસે નિશાળમાં રજ હતી. તેથી અલ્યાસથી નિવૃત્ત થઈ ધરમાંથી નીકળી જાપોરના ટાઇમે પિતાની પાસે હુકાને આવી એકો. પિતા તો ધરાકોની સાથે ભાથાકુટમાં હતા. ધરાકને કાપડ ઓછી કીંમતે જોઈતું હતું અને પિતાશ્રીને ઓછી કીંમતે આપવું નહોતું અન્તે ધરાક ગયો. તેના ગયા પછી કાળીદાસસે હોલાળને કાપડની કીંમત પુછી

ધરાક ગયા પછી પીતાએ સાચી કીંમત કહી ત્યારે કાળીદાસે ધરાકને કહેલી કીંમત સાથે સરળાવતાં પિતાએ કહેલી કીંમત વિશેષ હતી. એમ જણું પિતાને કંઈ ન કહી શક્યા પણ ત્યારથીજ કાળીદાસમાં વ્યવહાર અને તેનો કેળવણી પ્રત્યે ઉદાશીન લાવ આવતો ગયો. વિચારવા લાગ્યા કે આ જ્ઞાન અને આ કેળવણી લઈને મારે તો પાપજ કરવાનું અને તેથી કાંતો પિતાને માર્ગ ચાલી હુકાન સંભાળું અને આ રીતે પિતા કરે છે તેમ સાચા જુડા કરી વ્યવહાર ચલાવું અગર તો નોકરીમાં જોડાઈ અનેક રીતે પરતંત્રતા લોગવી જીવનની પરિપૂર્ણતા કરું. આવી રીતે વિચાર મનુષ દશામાં લીન બની કાલીદાસ વ્યવહારીક કેળવણી તરફ અણુગમો ઉત્પન્ન કરતો ગયો. તેમનો આત્મા જ્યાં અપાર શાંતિ હોય લ્યાં અને અત્યંત આત્મ આનંદને કેળવણીથી મળે અને કેળવણી મેળાયા પછી જ્યાં આત્મા કેળવાય અને જે કેળવણીથી સાચી શાંતિ પ્રાપ્ત થાય એવી કેળવણીનો માર્ગ કાલીદાસને લેવો હતો તેથી એમને વ્યવહાર ગુલાભી લર્ડો લાગવા માંડ્યો. સંસારના લેદથી તેમને અલીમ રહેવાની વિચારણા આવવા લાગી. કેળવણી લઈ એમને સ્વતંત્ર બનનું હતું અને તેથીજ વ્યવહારીક કેળવણીમાં તો કેવળ

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત.

પરતંત્ર લુંદગી જોતાજ ઉદાસીન ભાવ પ્રગટ્યો
હતો. વ્યવહારીક કેળવણી લીધેલા અનેક માણુસોને
કુઃખી જોતા હતાં. કલ્યાણના માત્રમાં આંખ આગળ
જગતનું તમામ દૃષ્ટિ નક્કી કર્યું. સુખી થવું હોય
તો તેને માટે કંદંક જુદીજ રૂચના હોવી જોઈએ
એમ મનમાં નક્કી થયું. સાચા સુખની બુખ જાગી.
આમ અનેક વિચારના મહાસાગરમાં દુણકી મારતાં
આલ્યવય પુરું કર્યું અને ચૈવનમાં આવ્યા.



પૂજયશ્રીના વિક્રાન શિષ્ય



સ્વ. આચાર્યશ્રી ૧૦૦૮ શ્રી ખુણદાલ સૂરીશ્વરજી

ગુરૂનો સંચોાગ.

માણુસ જ્યારે યુવાન થાય છે ત્યારે અનેક ઉપાધીમાં આવી જીવનને કંઈક ચોક્કસ હીશામાં લઈ જવું પડે છે. વાંચ્યક ! વીચારકોએ યૌવનના એ કીનારા ખતાંયા છે. એક ઉગતો અને બીજો આથ-મતો. આ બન્નેની વચ્ચમાં યૌવનનો પ્રવાહ વહે જાય છે. સામાન્ય સ્ક્રી પુરુષો તેમાં અંધ ણની અંપલાવે છે. કુળકી ખાય છે. કીચડમાં ફૂસાય છે અને યૌવનનો આથમતો કીનારો જલહી લાવી મુકે છે. આમ જીવનના મહાસાગરમાં યૌવનનો વંટોલ લયંકર ઉથલ પાથલ કરી મુકે છે. યુવાનીના મહદમાં આવેલ મનુષ્યો અંતર મંથનમાંથી નવરા ન થાય અને વ્યવહારીક ઉપાધિ તો વળગેલી જ હોય છે. અને ધાર્યું કરીને દરેકને એ નીચુમ લાગુ

પડે છે. પુત્ર ચુવાન થાય એટલે પિતાના મનમાં શાંતિ થાય અને પોતાના ઉપરથી લાર એછો થશે એમ માની સંતાનને વ્યવહારીક કાર્યમાં નાખે. ચુવાન માણુસને નાતના કાયદા, રાજ્યના કાયદા, ધર્મના કાયદા, સાચા માની તેનું યથાર્થ પાલન કરવું પડે છે અને તેથીજ ચુવાનની ભૂમિ-કાની શરૂઆત પરતંત્રતામય જ શરૂ થાય છે. તેથી ખાળ માનસ કે ચુવાન માનસ બાંધાએલી માન્યતાની અસર નીચે મોઢુ થાય છે. એટલે તે સ્વતંત્ર વિચાર કરી શકવા સમર્થ થતું નથી. ત્યારે જે આત્મા વિચારક નથી તે ગમે તેથું મોઢુ પણ સાચુ માની લે છે અને તે ઘણુાનો શિષ્ય બની જાય છે. તેને કેટલીક માન્યતાઓ માણાપ તરફથી મળેલી હોય છે. કેટલીક મીત્રો તરફથી અને કેટલીક નીશાળના શીક્ષક તરફથી પણ મળેલી હોય છે. અને કેટલીક તો નાટક અને જીનેમામાંથી પણ મળે છે. અને પછી ખોટી માન્યતાઓ પણ વિચારકપણુના અલાવને અંગે સાચી મનાય છે. સામાન્ય માણુસો વ્યવહારને સાચો માની હ્યે છે. અને તત્ત્વ દૃષ્ટીએ ઘણ્ણો વ્યવહાર કલ્પીત હોય છે અને કલ્પીત વ્યવહારને તાણે થઈનેજ વિચારક ખુદ્ધિનો ધ્વંસ કરાય છે. ચરિત્ર નાયક ૧૫ વરસની

ઉંમરમાં અનેક વિચાર કરી સત્યનો નિર્ણય કરવા મથી રહ્યા હતા. સ્વતંત્ર વિચારક તરીકે પોતે વિચાર કરતા હતા, સત્યની જાંખોમાં આત્માની તલ પાપડતાની સાથે તીવૃતા હતી; તેજ વખતમાં ગુજરાત અને કાઠિયાવાડની ભૂમીમાં વિચરી ભવ્ય આત્માએને સત્ય માર્ગ સમજાવતાં હુદય સ્વર્ગી ઉપહેશ આપતા વિચરતા વિચરતા મારવાડના પાલી શહેરમાં આચાર્ય શ્રી પુજ્ય જ્યયચંદ્રજી પધાર્યાં, દરરોજ સવારમાં વ્યાખ્યાનની શરૂઆત થઈ હજારોની સંખ્યામાં ધર્મ શ્રવણ કરવા ધર્મ પ્રેમિ આત્માએ આવવા લાગ્યા પુજ્ય શ્રી જ્યયચંદ્રજીના આગમન અને વ્યાખ્યાનની કાળીદાસને ખણર પડી કે તેઓ પણ ધર્મ બોધ સાંભળવા ઉત્સુક થયા એક દીવસે તે પણ સાંભળતા આંધ્યા. પુજ્યશ્રીનો અસરકારક ઉપહેશ સાંભળી હવે દરરોજ સાંભળવા આવવાનો નિશ્ચય કર્યો અને નિત્ય કુમ હોય તે પ્રમાણે સવારના સાત વાગે આવી જતા.

૧૫ દીવસના અણંડ વ્યાખ્યાન શ્રવણથી કાળીદાસ ઉપર ઉડી અસર થઈ જૈન ધર્મના ઉચ્ચ તત્વો અદ્ભુત પ્રીતસુષ્પ્રી અમોધ તત્ત્વજ્ઞાન વિગેરે જાણુવા છન્તેજનરી વધી હું જૈન ધર્મી છું અને મહારાજ ધર્મનું રહુસ્ય ન જાણું તો જૈન

ધર્મી શેનો એ વિચારે ધર્મના સિદ્ધાન્તો સમજવા એમ કાળીદાસે નક્કી કર્યું તે શીવાય ધર્મ પાલન સુયોગ્ય રીતે નહીં થઈ શકે માટે કોઈપણ ઉપાયે ધર્મના સિદ્ધાન્તો જાણું મનુષ્ય જીવનમાં કેટલાક એવા પરીયયો થાય છે કે જેને અંગે આખી જીવન નાવ સુધરે છે તે સિદ્ધાન્ત પ્રમાણે કાળીદાસ જ્યારથી પુન્ય શ્રી જ્યયચંદ્રજીના પરીયયમાં આવ્યા ત્યારથીજ તેમના સમાગમમાં રહી જ્ઞાન પ્રાપ્ત કરવું તે શીવાય આખું જીવન સત્ત્વ વગરનું છે તેવો વિચાર નક્કી કર્યો. વાચક ! પૂર્વકાળથી ચાહ્યા આવતા રીવાજ પ્રમાણે પુન્યશ્રી જ્યયચંદ્રજી મહારાજ સાહેબ આગળ શ્રાવકોનાં સંતાનો જ્ઞાનાલ્યાસ કરવા માટે ગામો ગામથી આવતા અને સાથે રહી જ્ઞાનાલ્યાસ કરતા તે પ્રમાણે કાળીદાસે પણ માતા પિતા આગળ જઈ પોતાની છૂભિંડા પ્રગટ કરી યોગ્ય માર્ગ ઉપર જનારા પુત્રને ન રૈકતા તેમ માતા પિતાની પણ ધાર્મિક અલ્યાસ કરાવવાની છૂભિંડા હોવાથી પુત્રને તેમાં સહાનુભૂતિ આપી પુન્ય શ્રી જ્યયચંદ્રજી આગળ લણુનાની રજા આપી ત્યારથીજ કાળીદાસ દીવસનો મોટો ભાગ પુન્યશ્રી આગળ કાઢવા લાગ્યા. થોડા દીવસ રહી પુન્યશ્રીની સાથે કાળીદાસ પણ પાલીથી ખીજે ગામ ગયા. અનુફર્મે કાળીદાસ કુંક મુદ્દતમાં

ધર્મ તત્વના જાણુ થવા માટે હૃદયની ઉત્સાહી દ્વારા પ્રતીકરણ નવતત્વ કર્મઅંથ વીળેરે કંઠસ્થ કર્યો. ત્યાં પણ ખીજાએ કરતાં કાળીદાસનો નંબર ઉંચ્યો હતો. પુન્યશ્રી પણ કાળીયા એવા ટુંકા પણ વાતસલ્ય ભર્યા સ્નેહથી જોલાવતા. જ્યારે દરેકની પરીક્ષા લેવાનો ટાઇમ આવ્યો ત્યારે કોણું હોશી-યાર છે તે જાણુવા પુન્યશ્રી પરીક્ષા લેવા આવ્યા. જેટલો અભ્યાસ કરું હતો તેમાંથી થાડા સવાલો પુછ્યા. પછી બુદ્ધિની તિવૃત્તા જાણુવા બધા વિદ્યા-ર્થિંયો. આગળ નિયેનો પ્રશ્ન કર્યો.

પ્રોનઃ—એક ગામમાં એક વણીક વિધવા જી રહેતી હતી. દર વર્ષે ધણુંય સાધુ સંતોને જમાડતી. એકવાર તે બાઈએ ચાર સંન્યાસીને પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપી ધરે આવી. તેજ હીવસે ભરનાડણ બાઈને ખીજે હીવસે દુધ લાવવા કહ્યું કે સારે દુધ લાવજે મારે દુધપાક બનાવવો છે. ખીજે હીવસે સવારે તે દુધવાળી ચોખું દુધ પોતાના ડામમાં લઈ ચાલી. આવતી હતી. રસ્તામાં આકાશમાં ઉડતી એક સમડી મોઢામાં સર્પ લઈ જતી હતી. તે સર્પના મોઢામાંથી જેર નીકળ્યું અને

તે હુધવાળીના હુધમાં પડ્યું અને તમામ હુધ જેર થઈ ગયું. હુધવાળી પાસેથી વણીક બાઈએ હુધ લીધું અને હોંશથી તને હુધપાક ખનાવ્યો. ટાઈમ પ્રમાણે સંન્યાસીએ જમવા આવ્યા જમ્યા અને ત્યારપછી થોડા કલાકમાં તે સંન્યાસીએ ભરણું પામ્યા. આથી તં વણીક બાઈ ઘણું લય પામી પણ હીને ઉપાયનહોતો. આ ખનાવ ખન્યા પછી થોડા દીવસ રહીને તેજ વણીક બાઈને ત્યાં હીને કોઈ સંન્યાસી ભીક્ષા માગવા આવ્યો. તે જાણી પાસે રહેનાર એક નીંદાખોર પાડોશણું ખડાર નીકળી અને પેલા સંન્યાસીને કહેવા લાગી કે અરે મહારાજ તમારે જીવનું હોય તો અહીંથી ચાલ્યા જવ, કારણું થોડા દીવસ પહેલા ચાર સાંધુને હુધપાકમાં જેર નાખી આ બાઈએ મારી નાખેલ છે. માટે તમો પણ તેના ઘરનું ખાશો નહીં, અને જમશો તો તમારી પણ તે ચાર સાંધુના જેવી દશા થશે. આ વચન સાંલળી તે સાંધુ ચાલ્યો ગયો. પાડોશણું બાઈ ખુશી થતી અંદર ગઈ. મનમાં બોલવા લાગી આજ

ગુરૂનો સંયોગ.

ઠીક લાગ આવી ગયો. કે બોલવાનું એલી ચુકી હવે આ પ્રજ્ઞનનો હે શીખ્યો ફૂક્તા એટલોજ જવાબ આપવાનો કે આ ચાર સાધુ મરણ પામ્યા તેનું પાપ કેને ? ” પુન્ય મહારાજશ્રીનો આ પ્રજ્ઞ સાંલદી બધા શિષ્યો વિચારમાં પડી ગયા કે આમા હોષ કેને આપવો સમણી નિર્દેશ, ભરવાડણ નિર્દેખ, અને વણ્ણીક બાઈ પણ નિર્દેખ છે. બધા શિષ્યો વિચાર કરે છે પણ કોઈ જવાબ આપતું નથી એટલે કાળીદાસે જવાબ આપ્યો કે પડોશણું બાઈ હોષને પાત્ર છે. કારણુંકે કેનો વાંક છે એ નહી જાણવા છતાં વણ્ણીક બાઈનો હોષ કાઢ્યો જેથી આ પાપ પાડોશણું ઉપર છે. આવી રીતે કાળીદાસનો જવાબ સાંલળી પુન્ય મહારાજશ્રીએ શાખારી આપી કર્યું કે ખરેખર મોટા ધર્મ ગુરૂ થવાને તું ભાગ્યશાળી થા અને મારી મહેનત સફળ કર. ભાવિના સુચક શબ્દો પુન્યશ્રી એલ્યા. આવી રીતે એ વરસ્ત સુધી કાળીદાસ ગુરૂના સંયોગમાં રહ્યા.

હિક્ષાની ભાવના.

મારવાડ પ્રદેશની ભૂમીમાં વિચરી ધર્મનું
સીંચન કરી પાછા ઝરતા અનુકૂળે ઝરી પાલી શહે-
રમાં પૂજય શ્રી જ્યયચંદ્રજી પધાર્યા. તેજ વખતે
પોતાના પુત્રને લેવા દોલાજી ગુરુ વર્ય આગળ
આવીને પુત્રને ધરે આવવા સુચના કરી. મન કખુલ
નહોતું કરતું. છતાં પણ પિતાજીની આજાનું ઉલં-
ઘન પણ થઈ શકે એમ નહોતું એટલે કાળીદાસ
ઉદાસીન ભાવથી પિતાની સાથે તૈયાર થયા.
પૂજયશ્રીને નમન કરી ત્રીજી વંદના કરતા ગુરુનેા
સાથ છોડવો નથી એવા વિચારવાળા કાળીદાસ
જતા જતા રડી પડ્યા. વાંચક ! ગુરુથી હવે અલગ
રહેવું પડશે એ વિચારે ખૂબ રડાવ્યા છતાં પિતાની
સાથે જવા ઝરજ પડી. મસ્તક ઉપર હાથ ઝેરવી

૦ ૨૪ ૦

દિક્ષાની ભાવના.

પૂજયશ્રીએ કહ્યું કાળીયા કરી આવજે. પૂજયશ્રીના વચન સાંભળી અશ્રુ સહીત દેહ પિતાની સાથે ધર તરફ આંદોલા. પણ આત્મા તો શુરૂ પાસેજ રહ્યો. અને આંદોલા પછી ધરમાં ન ગમ્યું. દિવસ અને રાત શુરૂની શિક્ષણુ પદ્ધતિ વાણીવિલાસ, બીજા શિષ્યોની સાથે જ્ઞાન ગોઠિ વીગેડે યાદ આવવા મંજ્યા. એક હીવસ એક માસ જેવો લાગવા મંજ્યો. માતા પિતા, પુત્ર હવે યુવાન વયમા આંદોલા છે માટે તેનો વિવાહ કરવો જોઈએ તેના વિચારમાં પડ્યા અને કાળીદાસે આ વાત જાણી. હુનીયામાં એવા પ્રસંગો ઉત્પન્ન થાય છે કે જે પ્રસંગથી માણુસ વૈરાગ્યવાન બને છે. તફઅનુસાર જ્યારે કાળીદાસે પોતાના વિવાહની વાત સાંભળી ત્યારે વિચાર કરતા સ્વગત મનમાં ઓદવા લાગ્યા શું પરણ્યા વગર માણુસથી ન રહેવાય ? શું યૌવન એટલેજ પરણું ? ચૌવનની પરિપૂર્ણતા એમાંજ લાવવાની ? શું પરણુવામાં સુખ છે ? હુન્યવી આત્માએ તેમાંજ સુખ માને છે ? અનેક પરણુલાએની જુંદગીમાં આગ સળ્યો છે. અનેક પરણુલાએને સંસાર કેમ ચલાવવો એ મુશ્કેલ બને છે. જ્યારે આ પ્રમાણે છે તો મારા આત્માને શા માટે હુઃખમાં નાખું ? માનવ જીવનના ઉત્તીતિનો

આચાર્ય શ્રી કલ્યાણુચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

પાયો જે સંયમમાં હોય તો અવનતિના માર્ગમાં હું શા માટે જાઉં ? જેને સાધારણું જીવન બનાવવું હોય તે ઉચ્ચ માર્ગ અહૃણું કરી ન શકે. હવે તો હું શુરૂના સંસર્ગમાં એ વર્ષ રહી સત્ય માર્ગ સમજ્યો. છું. હુનિયામાં જીવો પોતે પરણી પરતંત્રતા મેળવી ખીંચ્યોને પરતંત્ર બનાવવામાં રાજી હોય છે, તે હું કયાં નથી સમજ્યો ? વાંચક ! શુરૂના સંચોગમાં કાળીદાસને સમજાઈ ગયું હતું કે આત્માની નિર્મિતા જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી મુદ્દિત મળેજ નહીં. આ મઙ્ગમ વિચારેજ સંસારની અસારતા દેખાડી હતી. પોતાની નજરે ઉદર પોષણ અથે અનેક મનુષ્યોને છળ પ્રપંચ વિગેરે કરતા જોઇનેજ ફૂદ્ય વૈરાગ્યવાન બનયું હતું. પ્રત્યેક ઘરે તથા સંસારિક કુદુંખીઓમાં ભાઈ ભાઈઓમાં ઈર્ષિ વેર ઝેર અને અદેખાઈનો જન્મ થતો જોતા હતા. દેહના સુખ માટે આત્મભાન ભૂલી ધર્મની જૌારવતાને ફૂર કરીને વ્યવહારનું પોષણ કરતા અનેક કુદુંખોને જોયા હતા. કાળીદાસને ભાઈ ભાઈમાં લેદ જણ્યાયો. માતા પિતામાં લેદ જણ્યાયો. તમામનો સંખંધ સ્વાર્થમય છે એમ નષ્ઠી કર્યું. તે સ્વાર્થમાં આખું જગત અંધાયું છે. મારે નથી બંધાવું એમ સ્વગત બખજ્યા

દિક્ષાની ભાવના.

વાંચક ! કાળીદાસને સ્વાર્થ જળમાં બંધાવું નહોતું તેથીજ સંખંધ સ્વાર્થમય દેખાતો હતો. કાળીદાસે નિશ્ચય કર્યો કે માતા પિતા દળાણુ કરે તો પણ મારે લગ્ન ચક્કોમાં જોડાઈને તે ચક્કીમા પીસાવું નથી. હુનિયામાં અનેક આત્માએ લગ્ન કરી જીવન પરવશ બનાવી મૂકે છે. અને તેની લયંકર ચક્કીમાં પીસાઇ જીવનની ખાના ખરાખી કરી ચાર હીવાલમાં જન્મી તેજ ચાર હીવાલમાં જીવન સમાસ કરે છે તેમ મારા જીવનની એવી તુચ્છ રીતે પરિપૂર્ણતા લાવવી નથી. મારે તો મારા આત્માના દ્વાર ખુલ્લાં કરવાં છે. અને તેનો માર્ગ જગતને બતાવવો છે. સત્યના માર્ગ ઉપર વિચરી હુનિયાના આત્માએને સત્યની આંખી કરાવવી છે. અને તેથીજ કુદુંઘની જળ તોડી લોગ વિલાસને ઉઝેડી દેવા પડશે. ચારે તરફ અજ્ઞાનતા પ્રસરી રહી છે. અને તે અજ્ઞાનતાના પ્રતાપે વિમુઠ આત્માએ કર્તવ્ય કરી શકતા નથી. ગરીખ મનુષ્યોને આત્મ કલ્યાણુ કરવાની કુરસદ ન મળે ઉપરાંત તેજ ગરીખાઈના જેરે અનેક માણુસો પાપમાં રક્ત ધને છે. જીવનમાં અનેક ભૂખ છે. તે ટાળવા સંતોષવા ગરીએ. તેમજ શ્રીમંતો સૌ પ્રયત્નો કરે છે અને શ્રીમંતો તેમને ધર્મની જરૂરીયાત હોય તેમ લાગતું નથી. તેએ પોતાના વિલાસ

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

વૈલવથી અને નિર્દેષ ગરીયો ઉપર અને મળુરે ઉપર ત્રાસ વર્તાવવામાંથી નવરાજ થતા નથી. કે ધર્મ કરે. ગરીયોના લોહીનું પાણી કરાવીને પોતાની શ્રીમંતાધ ટકાવવાની મનોભાવના ક્યાં સુધી ફેણે ? અરે એક મનુષ્યની રોજ ઉપર તાગડધીના કરવાનો બીજને હક શો ? અનીતિથી પેદા કરેલી લક્ષ્મી તેનો લોગવટો કરનારનું નખોદ કેમ ન કાઢે ? પણ પૈસાની પાટ ઉપર બેસનારાઓને ક્યાંથી ખખર હોય કે પૈસો કમાતા કેટલો શ્રમ પડે છે ? હુધ ચોખા ખાનારા મનુષ્યને ક્યાંથી ખખર હોય કે એક રોટલીના ટુકડા માટે કેટલો પસીનો વહાવવો પડે છે. પૈસાના ૬૦ વળતા હોય એવા શ્રીમંતોને પાઈ પાઈ ઉત્પન્ન કરી પેટ ભરનારા ગરીયોની હડ મારીનો ક્યાંથી ખ્યાલ આવે ? વાંચક ! આવા પાષાણુ હૃદયના શ્રીમંતોમાં કે જેમની લક્ષ્મી ગરીયોના લોહીથી ખરડાઈ અપવિત્ર બની છે. ગરીયોના લોહીનું પાણી થઈ જય એવી કાળી મળુરી કરાવી જે માલેતુલ્લર બન્યા છે. જેમની હુવેલીઓના પથરે પથરે ગરીયોના ઉના આંસુઓ લર્યા છે. એવા હૃદયહિન શ્રીમંતોમાં કાળીદાસને ધર્મ ભાવના ઉત્પન્ન કરાવવી છે. ગરીયોનું સ્થાન શ્રીમંતોમાં સ્થાપન કરાવવું છે. તેથીજ ઉપરના વિચારમાં ચરિત્ર

દિક્ષાતી આવના.

નાયક નિમગ્ન બન્યા છે. એક દિવસ વિચાર કર્યા કર્યો. માતા પિતા તેનું અલાન મુખ જોઈ તે પણ વિચાર કરવા લાગ્યા. બીજા દિવસની રાત્રે પણ તેજ વિચારેની અથડામણું. ત્રીજો દિવસ થયો. રાત્રી પડી રાત્રીની કાળી ચાહરથી આખું શહેર ઢંકાઈ ગયું. આખું શહેર નિદ્રામાં પરવશ થયું લારે કાલીદાસ અગારીમાં ફરે છે. ફરી વિચારેનું તુસુલ ચુદ્ધ શરૂ થયું. ત્રીજા દિવસની રાત્રીએ અનેક વિચાર આવવા લાગ્યા. રાત્રીનો અંધકાર અને એકાંત વિચારેને બળવાન બનાવે છે. અને એક નિશ્ચય પર આવતા લાગણીએને પણ ઉશ્કેરી મુકે છે. સૂર્યના પ્રકાશમાં અશક્ય લાગતા કાર્યેને રાત્રીનો અંધકાર અને એકાંત શક્ય બનાવે છે. ચોર પૂની અને દ્યલિચારી પણ પોતાનો વિચાર રાત્રીના ઘાઠ એકાંતમાં મઝ્કેમ કરે છે. અને વૈરાગ્યવાન આત્માએ પણ પોતાનો વિચાર એકાંતમાં નષ્ટી કરે છે. એજ એકાંતમાં કાળીદાસ વિચારના તરંગમાં ઉડી રહ્યાં છે. તેમણે અગારીમાં ફરતા ફરતા અનેક નિશ્ચયો કરી નાખ્યાં. તેમાં એક વિચાર આવતા જરા થંદ્યા. પૂર્વના ઘણા પુરુષો આવી જ કુદુંણ અથડામણીથી ત્રાસી જંગલમાં ચાલ્યા ગયા છે. તે માર્ગ કેવો? સ્વગત વિચારવા લાગ્યા તેને માટે આખું કુદુંખ

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

છોડતાં જરા કંપારી આવી એક તરફ આત્માનો પોકાર ખીલુ તરફ આખુ કુદુંણ કેને માટે જીવન સમર્પણ કરું આ વિચારે અંતરમાં જળર ચુંદ મચાંયું. અંતે એક નિશ્ચય પર આવી ગયા. આંખોમાં તેજ આંયું. લાગણીઓમાં તિવ્રતા આવી અને આખા શરીરમાં ન અનુભવેલું બણ આવતાં જુસ્સાથી બોધ્યા જેઈ લીધું જગત અને તેના સુખ-હુઃખો એમ કહી ગુરૂવર્ય શ્રી જયચંદ્રજી આગળ જવાનો જેમનો નિશ્ચય છે તે કાળીદાસ કપડાં પહેરી છાની રીતે રાત્રે બાર વાગે ઉપાશ્રયે આવી ખારણું ખખડાંયાં. ઉપાશ્રયનું દ્વાર ખુલ્યું ઉપર ગયા ગુરૂવર્યને નમન કર્યું.

પૂજયશ્રીએ કહ્યું “કાળીયા અત્યારે તું કયાંથી કેમ આંયો ? ”

પ્રશ્નનો જવાણ આપતા પહેલાં આંખમાંથી આંસુ પડ્યાં.

કાળીદાસ—“જુંદગી વેડશ્રી નાખવાં કુદુંણીએ તૈયાર થયા છે જીવન નાવને દુખાડવા સગાએ મારી પછવાડે પડ્યાં છે. માટે આપને શરણું આવેલ છું. મારે સંયમી બનવું છે. તે સીવાય હવે જીવન ટકે તેમ નથી.”

આશ્વાસન આપતા પૂજ્યશ્રીએ કહ્યું.

“ કાળીયા રાતના ઉંઘ લે. સવારમાં ઝોડ સારા વાના થશો.”

પૂજ્યશ્રીનો જવાખ સાંભળી આજા પ્રમાણે કાળીદાસ સુવા ગયા ડેકાણે જઈ સુતા કાળીદાસને ઉપાક્રમે નિંદ્રા આવી ગઈ.

પ્રભાત થયું. ગુરુજીએ ધરે જવા કહ્યું કારણ તારી માતા ફુઃખી થયા હશે માટે જલ્દી ધરે જા. દિક્ષા લેવી હોય તો માતા પિતાનો સંતોષ મેળવી તેમની આજા લઈ આવ. વાંચક ! અત્યારના શિષ્ય લોભી ધર્મગુરુએની માઝે પૂજ્યશ્રી જ્યયદ્રગુજરાતની મનોદશા હોત તો આવો જવાખ આપી શકત ? અરે જરા પણ વિચારવાની તક આપ્યા વગર જ દિક્ષા આપત શિષ્યલોભી ધર્મગુરુએ ણાહ્ય છુંચા-એને આધીન થઈ શિષ્યો માટે જેવા ધમપણાડા કરે છે વૈમનસ્ય ઉત્પન્ન કરે છે તેવા જ ભાવો પૂજ્યશ્રો જ્યયદ્રગુજરાત પણ ઉત્પન્ન કરત પણ તેઓશ્રી આવી પવિત્ર લાગવતી દિક્ષાને વગોવવાની છુંચા ધરાવતા નહોતા આજકાલની લેવાતી દિક્ષામાં કાયરતા સીવાય કાંઈ જેવામાં આવતું નથી. અને તેથી જ સાધુએ પણ તેજસ્વીને બદલે નિસ્તેજ


આચાર્ય શ્રી કલ્યાણુચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

અને તેમનામાં સંસારી જેટલી પણ આત્મશ્રદ્ધા રહેતી નથી. અને આ પ્રમાણે દિક્ષાના અમાનુષિ ભર્યા સાધુઓના વર્તનથી ધર્માખરો વર્ગ સારા કે જોટા તમામ સાધુઓ પ્રત્યે અર્દચીવાળો થયો છે. વસ્તુ સ્વરૂપે સ્વાર્થ હોય એટલે પરમાર્થ તરફ દૃષ્ટિ ન જાય. તદ્દાનુસાર શિષ્યોના લેખે સિદ્ધાંતનું પણ ઉન્મુલન થાય. વાસ્તવિક રીતે જેને તેને ગમે તે રીતે દિક્ષા આપવાની પ્રથાએ અનેક મનુષ્યો દિક્ષા લઈ પૈસા મેળવી લાગી ગયાના અનેક દાખલાએ. બન્યા છે. છતાં સમાજના પૂજનીય તરીકે લેખાતા ધર્મગુરુઓના માનસમાંથી તે વાત નીકળતી નથી. અને તેથી જ શાસનની હુર્દશા પણ અટકવાની નથી.

અસ્તુ અત્યારે તો પુત્રની ઝરણ માતા પિતાને સંતોષી દિક્ષા લેવી એમ કહી કાળીદાસને જવા આહેશ આપ્યો.

ગુરુદેવની આજા સંભળી સત્ત્વર માતા પિતા આગળ રજા લેવા ગુરુવર્ય આગળથી રવાના થયા. રસ્તામાં માતા પિતાને સમજાવવાની વિચારણા નક્કી કરી લીધી, તેજ વખતમાં પ્રભાત થઈ ગયું પછી કાળીદાસને ન જોતાં માતા પિતાના હૃદયમાં

આચાર્ય શ્રી ખુણચંદ્રના વિકાન શિષ્ય



સ્વ. યત્તિવર્ય મહારાજાશ્રી મનોરચંદ્ર

દિક્ષાની ભાવના.

ચિત્તા થઈ. ચારે તરફ શોધ કરાવી ત્યાં અચાનક કહુને (માતા કહુ કહીને બોલાવતી) આવતો જોઈ માતાએ તેને છાતી સરસો ચાંઘ્યો.

માતાએ પૂછ્યું કયાં ગયો હતો ?

દિક્ષા લેવાની વાત કરીશ તો માતાને હુઃખ થશો એ વિચારે તે વાત હળાવીને સવારના ફરવા ગયો હતો એમ કહી માતાને સમજાવી હીધી. જેમ તેમ દિવસ પસાર કર્યો. રાત પડી અંધકાર શરૂ થયો. ચારે તરફ શૂન્યકાર થઈ ગયો. પાછી એજ વિચારણા હૃદયમંથન કર્યા પછી દિક્ષા લેવી તેનો નિશ્ચય કર્યો. પણ દિક્ષા લેતા એક મહાન વ્યક્તિ આડે આવશો તેનું શું અને તે માતા. ફરી વિચારે શરૂ થયા. ગુંચ ન ઉકેલાણી. જનનિ અને જન્મભૂમિ સ્વર્ગથી પણ અધિક છે. એમ જગત માની રહ્યું છે, તો મારે શું કરવું. ઘણા વિચારે કર્યા પછી અમુક ચોક્કસ નિશ્ચય કરી રાત્રે સુધી ગયા. સવારે ઉઠી નિત્યકર્મથી પરવારી માતાની આગળ જઈ પોતાનો ભાવ વ્યક્ત કર્યો. ગુરુદેવની આજા છે કે માત પિતાની અનુમતિ લઈ આવ એટલે હું દિક્ષા આપીશ તેથી આપની અનુમતિ માગું છું. કૃપા કરી આજા આપો. એટલે મહત

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

પંથે વિચરણ. વાંચક ! માતા અને પિતાના વાત્સલ્યની જગતમાં જોડી જ નથી. તેમના હૃદયોનું માપ પણ અમાપ છે.

પ્રેમમાં અદેખાઈ છે પણ વાત્સલ્યમાં અદેખાઈ નથી. પ્રેમી હૃદય માથું કાપે છે. અને આપે છે. જ્યારે વાત્સલ્ય ભરપુર હૃદય માથું આપે છે પણ તેને માથું કાપવાનો અવકાશ નથી. તોકાની સંતાનો, હોષવાન પુત્રીએ અને અનીતિ માન પૌત્રોને માતા પિતાનું વાત્સલ્યજ આશ્રય આપે છે. તોકાની માણુસ કે લુટારો જેલમાંથી ખડ્ધાર નીકળતા જગતં તેને તિરસ્કારશે. બુઝે મારશે પરંતુ તેનીજ બુખ ટાળવા વૃદ્ધ માતા ભારેમાં ભારે ઘંટી ફેરવી તે તેબું હુઠકર કામ કરી અરે પોતે બુઝે રહી પુત્રનું પેટ ભરવા પોતાનું જીવન અર્પણે. એજ માતા આર્જવતા ભરી દલીલ કરી રહી છે.

માતાઃ—કલું હું બેઠી છું ત્યાંસુધી સંસાર ચલાવ
મારી હૃયાતી બાદ દિક્ષા લેવી હોય
તો લેજે.

કલું— માતા જીવન કચાંસુધી ટકશે. આયુષ્ય
કચાંસુધી ચાલશે એજ જો ખણર હોત

દિક્ષાની ભાવના.

તો તેમ કરત. પણ સમયનો પણ પ્રમાદ કરવો હિતકારી નથી એમ શાસ્ત્રો કહે છે.

માતાઃ— પણ ભાઈ એક પળ પણ તારે વિરહ નહી સહુન કરનારી એવી હું રહારા ગયા પછી મારી કર્ય દશા થશે તેનો તો વિચાર કર.

માતાની આંખમાં અશુંચો પડે છે.

કલું:— માતા એકજ સંતાન હોય કુદુંબનો આધાર હોય છતાં દૈવતેને ઉપાડી લેછે. એ આપણી નજરે જેઠાએ છીએ ત્યારે હું તો ઇક્તા ઘરનોજ ત્યાગ કર્ય છું. કંઈ જીવનનો ત્યાગ કરતો નથી. માટે આજા આપો એટલે દિક્ષા લઉં.

વાંચનાર સામે પિત્રુ હૃદય અને માત્રુ હૃદય હતું. પોતાનો પુત્ર આવી રીતે આજા ભાગશે એવો સ્વર્ણે પણ ખ્યાલ નહોંતો. થોડા વખત પહેલાં તો લગ્નની વાતોમાં રસ લેતા માતા પિતા પુત્રની વાત સાંભળી આશ્ર્ય પામ્યા. જવાબ આપવાની વિચાર શક્તિ દિક્ષા લેવાની વાતથી ઉડી ગઈ. હૃદય વગરની દશા જેવી સ્થિતિ થઈ. ચૈતન નીકળી જતા જડ જેવી સ્થિતિ તેના માત પિતાની

થધ. મોહની આધીનતાએ આંખમાંથી અશ્વ પડ્યાં.
 પુત્રના મોહે દૃદ્ધન કરાંયું ને પુત્રને કહેવા લાગ્યા
 કે કુદુંખમાં તો તારા વીવાહની વાત ચાલે છે.
 અને અમારી આગળ આ શું વાત કરી રહ્યો છે ?
 લોગ વયમાં તો ત્યાગની વાત ન શોલે. મોહ
 લિફ્ટિંગની અનેક દલીલ ભાતપિતાએ કરી પણ
 ત્યાગ પ્રધાન જેની મનોદશા છે એહવા પુત્રે
 જવાબ આપ્યો કે જેને તમો લોગવય કહો છો
 એનેજ હું ત્યાગ વય કહું છું. અને માનવ જીવ-
 નજ ત્યાગ માટે છે. અને ધર્મોપદેશકો ત્યાગમય
 જીવનજ સર્વોત્કૃષ્ટ કહે છે. લોગના રમકડાંની સાથે
 રમનારની કીંમત નથી માટે હવે મારા આત્માને
 લોગની ઉંડી ખાઈમાં ધકેલવાની આજા ન કરશો.
 લોગની વાતોએજ મારા જીવનમાં વૈરાગ્ય પ્રગ-
 ટાંયો છે. કાંટાની પથારીમાં સુધ રહેનાર માનવીને
 જે પીડા થાય છે તેવીજ પીડા લોગની વાતો શ્રવણ
 કરવામાં મને થાય છે. માટે હવે જે મારા ઉપર
 સાચી ભમતા હોય, પુત્ર વાતસદ્ય સાચું હોય તો
 કૃપા કરીને આજા આપો કે હું ચારિત્ર દિક્ષા લઈ
 આત્મધર્મમાં લીન બનું. હે પિતાશ્રી જે હું ન
 હત, મારો આ હેઠ હૃત્યાતીમાં ન હોત કે હું
 જન્મયો ન હોત તો કોના ઉપર ભમતાનો હોર

દિક્ષાની ભાવના.

ખાંધત. માટે તે ભમતાનું વહેણુ આત્માના કલ્યાણુમાં વાપરી મને આત્મકલ્યાણુ કરવા ધો અને જો આપ હઠપૂર્વક મારી વાતને અવગણી વિવાહના કાર્યમાં મને જોડશો તો જાણુશો કે તમારો આ પુત્ર હુની-ચામાં નથી. સર્વ પ્રકારે વૈરાગ્ય વાસીત હૃદય જાણી કુદુંખીઓને પણ આવા સમાચાર મળતા હોલાળને અને નૌજીબાઈને સમજાવ્યાં. કે કેાઈ પણ રીતે હવે તમારો પુત્ર નહીં રહે માટે હવે તમો રાજ્યભૂષણીથી રજ આપો. સર્વે કુદુંખીઓના કહેવાથી હોલાળ પોતાના પુત્રની સાથે ઉપાશ્રયે આવ્યા. પૂજ્યશ્રી જયચંદ્રજી આગળ આવી વિધિ સહિત વંદના કરી અને નમ્રતાથી કહેવા લાગ્યા કે હુ મોક્ષ દાતા ભવોદ્ધી તારણુહાર તીર્થ સમાન, આત્મ સ્વરૂપ, આપને વિનંતિ કરી કહું છું કે આપને ગામે ગામ સર્વ શ્રાવકો અચેત વસ્તુ વહેરાવે છે જ્યારે હું આ મારે પુત્ર કે જેને આપના સમાગમથી સંસારની અસારતા સમજાઈ ગઈ છે અને આપના ધર્મોપહેશથી તેનું પુણ્ય જગૃત થયું છે આપશ્રીના સમાગમના પ્રતાપે સર્વ જીવને અભયદાન સ્વરૂપ અને વિશ્વની મૈત્રીરૂપ દિક્ષા લેવાની તીવ્ર જ્ઞાસા ઉત્પજ્ઞ થઈ છે અને તે જ્ઞાસા વિજળીની પેઠે રોમેરોમમાં વ્યાસ થતાં

∴ ૩૭ ∴

આચાર્ય શ્રી કલ્યાણુચંદ્રજી મહારાજનું જીવનચરિત.

કુમતીઓનો સંગ છોડી આત્મામાં ચારિત્ર બુધ જગૃત કરી છે જેથી આ મારા પુત્રને પૌછગલીક સુખો તૃણુવત લાગવા માંડયા, આત્મામાં સત્ય હીપક પ્રકાશવા લાગ્યો. સંવેગ રંગમાં આત્મા રંગાયો જગત સંસાર બધું અનિત્ય અને સંખાંધી સૌં સ્વાર્થતત્ત્વર જાળ્યાયા. સંસારીક સુખ વીજ-ળીના ચમકારા જેવું ચલીત અને ક્ષણુવીનારી લાગ્યું, જેથી આ મારા પુત્રને સંસારના લોગવટામાં માનવ જીવન નીરર્થક ન ગુમાવતાં સંચભ વડે સાર્થક કરવાની ઈચ્છા દ્વદ્ધ થઈ છે જેથી હે ગુરુદેવ આપની સન્મુખ મારા પુત્રને લાવ્યો છું. માટે આપ ઈચ્છા અનુસાર ચારિત્ર આપી તેના આત્માનું કલ્યાણ કરો અને તેના આત્માને નોંઠો. દોલાળુના વચન સાંભળી પૂજય શુરુદેવે કહ્યું કે અમારાં આચારને જાણીતો થશે ત્યારેજ હું એને ચારિત્ર આપીશા. આ પ્રમાણે જવાખ સાંભળી પુત્રને શુરુ આગળ સુકી પોતે પોતાને ધરે ગયા. વિચારોના મંથન પછી દિક્ષાની ભાવના કાળીદાસે સફળ કરી.



જુનાગઢમાં દિક્ષા.

વાંચક ! અનુહુમે પૂજય શ્રી જ્યયચંદ્રલુ પાલી
માંથી વિહૃાર કરી, અન્ય ગામો તરફ કરવા ગયા.
કાળીહાસ પણ પૂજય શ્રી સાથે રહી આત્મજ્ઞાન
મેળવવા માટે લીન બન્યા ખીજ શિષ્ય વર્ગની
સંગાથે રહી જ્ઞાન અભ્યાસ કરવા લાગ્યા. દ્યવહારિક
જ્ઞાન મેળવવામાં જેટલી ઉદ્દાસીનતા પૂર્વે સેવતા
હતા તેટલોજ આનંદ અત્યારે અભ્યાસ કરવા વગેરેમાં
મેળવતા હતા. વાંચક ! કાળીહાસ સાચું જ્ઞાન સાચું
તત્ત્વ અને સાચી શ્રદ્ધાનાં રસીયા હતા. જ્ઞાન અભ્યાસ
કરી તત્ત્વનું દોહન કરવાનું હતું. તમામ વિચારણા-
ઓને દેશવટો આપી જ્ઞાન એજ ધન અને તેજ
ધન મેળવવા જીવનચર્ચાને વાપરી રહ્યાં હતાં. પૂજય

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

શ્રી સાથે શાનાલ્યાસ કરતાં તમામ શિષ્યોમાં કાળીદાસનો અથમ નંખર હતો. અને વિધાર્થી તરીકે પહેલા આંદ્રા હતા તે કરતા અત્યારે ગુરુવર્ય આગળ હિક્ષિત મનોભાવનાએ આંદ્રા પછી ઝુદ્ધિ પણ તીવ્ર બની હતી. જાણે સરસ્વતી જીબ ઉપર એઠી હોય તે પ્રમાણે શાસ્ત્ર અધ્યયનના દરરોજ 300 ક્ષેત્રાક કંઠસ્થ કરતાં અને ગુરુજીની અપાર કૃપા મેળવતાં તમામ શિષ્યોમાં પણ પૂજ્ય ગુરુવર્યની અમીદાદિ ભીજન શિષ્યોનો અપેક્ષાએ કાળીદાસ ઉપર વધારે હતી. કાળીદાસ પણ ગુરુની કૃપામાંજ પોતાનું સર્વસ્વ સમજતાં પોતે જાણુતાં કે હુર્ગતિમાં પડતાં જીવાને ઉદ્ધાર કરવામાં ગુરુ મદદ ડ્રેપ છે. સત્ય માર્ગનો રસ્તો બતાવનારા કેવળ ગુરુજ છે. તેના અવલંખન વગર મુક્તિનો માર્ગ પામવો આત્માને માટે હુર્લાલ છે. આત્માને સન્માર્ગો ચઢાવનાર પણ ગુરુ છે. આવી માન્યતા કાળીદાસમાં હતી, અને તેથી કોઈ અપેક્ષાએ હેવ કરતા પણ ગુરુને અધિક ગણુતા, કારણું સર્વ વસ્તુના જાણુ કરનાર ગુરુ છે. હેવના સ્વરૂપને સમજાવનાર પણ ગુરુ છે. તેથી કાળીદાસના મનમાં જેટલો લક્ષ્ણ ભાવ ગુરુ તરફ હતો તેટલો અન્ય કોઈ ઉપર ન હતો. આવી મનોદશા બાંધનાર કાળીદાસ રાત્રી દિવસ ગુરુભક્તિમાં તહ્વીન ણનવા

સાથે તીવ્ર બુદ્ધિથી અભ્યાસ કુમ વધારવા લાગ્યા. પૂર્વે થાડુંક તો જ્ઞાન સંપાદન કર્યું હતું. તેમાં અત્યારે શિદ્ધ વૃત્તિથી આગળ વધતાં ન્યાય, તર્ક, અલંકાર, છંદ વગેરે શાસ્ત્રોમાં પારાંગત ધન્યા. સમાજના ઉદ્દ્ય માટે લક્ષ્ણ અને જ્ઞાન અતિ આવશ્યક છે એવી તેઓની ફઠ માન્યતા હતી અને તેથીજ પોતાનું સંયમી જીવન જ્ઞાનમય બનાવવા પ્રયત્નો કરી રહ્યાં હતા પૂર્વથી વૈરાગ્ય તો હતોજ. તેમાં જ્ઞાન અને ચારિત્ર ભાવનાની વૃદ્ધિ થઈ. વૈરાગ્ય વાસિત ભૂમીકામાં આનંદ માની અભ્યાસકુમમાં વિચરતા તમામ પોતાના ગુરુભંધુઓને કહેતા કે ભાઈઓ ! સંસારનો ખ્યાલ મને પૂર્ણ રીતે આવ્યો છે. સંસારનું સ્વરૂપ ઇંદ્રની જળ અને વિઘુતના ચમકારા જેવું છે. સંસારી આત્માઓની સ્થિતી પણ તેવીજ છે. એક સરખી સ્થિતી રહેતી નથી. પ્રત્યેક વસ્તુનો ખ્યાલ કરે. સંસારના ચોગાનમાં કોણું સુખી છે ? કોઈને કોણો સંબંધી તો કોઈને પુત્ર સંબંધી કોઈને દ્રોધ સંબંધી તો કોઈને ધર સંબંધી તો કોઈને ભિત્રાદિકના વિચોગ સંબંધી એમ કોઈને કંઈ હુઃખ તો રહ્યાજ કરે છે. કર્મને વશ પડેલા પ્રાણીઓ પ્રાયે સુખી હોતાજ નથી. પ્રત્યેક મનુષ્યો પોતાથી વધારે સગવડતા જેને પ્રાસ થઈ હોય તેને સુખી માને

છે અને તે ખીજને સુખી માને છે પણ પ્રત્યેકના હૃદયને પૂછશો તો કહેશો કે અમને આ હુઃખ છે. જ્યાં સંસાર છે ત્યાં હુઃખજ છે. અને હુઃખનો સંબંધ સંસાર સાથે છે. જ્યાં જ્યાં સંસારની ઉત્પત્તિ ત્યાં ત્યાં હુઃખની ઉત્પત્તિ છે જ. એ હુઃખની ઉત્પત્તિનો નાશ કરી આત્મસુખમાં રમણુથવું એજ આ મનુષ્ય જન્મની પ્રાપ્તીનું ફળ છે. મનુષ્ય જન્મની સ્થિતિ લોગોમાં જોડાય. ઉદર પુર્તિની પછવાડે આત્મિક શક્તિએ ખરચી લોગોને ઉત્પન્ન કરીએ તો મનુષ્ય જીવન અને પશુ જીવનમાં બહુ તદ્દીવત નથી. જેમ પશુએ ઉદરવૃત્તિ કરી લોગમાં જીવનને જોડી વિવેક વગર જીવનને સમાસ કરે છે અને કુતરાએ. જેમ ઘર ઘર ભટકી લાકડીના પ્રહાર સહુન કરી જીવનની પુર્ણાંહુતી કરે છે તેમ માનવ દેશ દેશ ભટકી લોગની પરંપરા ઉત્પન્ન કરવામાં સેંકડો કર્મના પ્રહારો જો સહુન કરે તો મનુષ્ય જીવનની ખરબાદી કરી તેને હારી જય છે. ક્ષુદ્ર માણુસો મોહની જાળમાં સપાડાઈ લવને ગુમાવી હે છે. સહાધ્યાધ્યાને સારી રીતે કાળોદાસ નવરાશના ટાઇમમાં સંસારની અસારતા સમજવતા વિશ્વની પ્રત્યેક વસ્તુએ નાશવંત છે. અને સ્થિતી તો ખદલાતી જ રહે છે.

જુનાગઢમાં દિક્ષા.

લાઇચ્યો દષ્ટાંતર્થી વિચાર કરેં. ભૂમીમાં ધીજ
રોપાય છે. ફણુગો કુટે છે. છોડ થાય છે. રૂતુ
આવતા કુલ આવે છે. ફળ લાગે છે. પાકે છે. પદ્ધી
આપોઆપ સુકાવા માંડે છે. તે દષ્ટાંત યુક્ત પશુ
હો યા પક્ષી, રંક હો યા રાણ, શેઠ હો યા નેાકર
દરેક માટે ઉપર સુજખને કમ છે. દષ્ટિ કરેં જીવ
ગર્ભમાં આવ્યો નવ માસ સુધી માતાના પેટમાં રહ્યો.
તે પણ ઉંઘા માથે અનંતા ફુઃખને સહન કરતો
કાળ પૂર્ણ થતા જ બાળક તરીકે જન્મ થયો. જરા
માટો થયો. બોલતા અને ચાલતા રીત્યો. વ્યવહા-
રિક જ્ઞાન મેળળી વ્યવહારમા બંધાયો. યૌવનમાં
પ્રવેશ થયો. લગ્ન થયા પાપને પોષતા પાપના ફળ
ઝપ સંતતી જન્મી ત્યાં તો વૃદ્ધાવસ્થા આવી.
શરીર જીર્ણ બન્યું. આત્માની શક્તિ ન રહી. અને
જેતા વારમા જ જીવન કાળપાશમા ઘેરાયું. અને
જીવન સમાસ થંયું. આવી રીતે અનેક કાળચકો
આવાજ કુમમાં આપણું આત્માએ પસાર કર્યો માટે
હવે કર્મની સત્તાને તોડવા આ સંયમની ભૂમીમાં
આત્માને લાવો. નવરાશના વખતમા જ્યારે શિષ્યો
લેગા થાય એટલે કાળીદાસ આવી રીતે પોતાના
સંગાથીએને વચનામૃતોથી સંસારની અસારતા સીદ્ધ
કરતાં કોઈ કોઈ વાર પૂજય શ્રી જ્યયચંદ્રજી પણ છાના

આચાર્ય શ્રી કલ્યાણુચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

રહીને કાળીદાસની સમજાવટને સાંભળી તેની અસરકારક સમજાવટથી તેઓ પણ ખુશી થતાં. ત્યારથી જ તેમણે પણ નષ્ઠી કર્યું હતું કે શાસનમાં રહારી પાટ ઉપર આવી વિજય ડંકો વગાડવાની લાયકાત કાળીદાસમાં આવી ચુકી છે. રહારા કરતાં પણ શાસનમાં યશ કીર્તિ વધુ સંપાદન કરે એવી શક્તિએ અત્યારથી જ દેખાઈ આવે છે. પુજયશ્રી અનુકૂમે મારવાડમાંથી નીકળી કાઢિયાવાડની ભૂમિ ઉપર પગલા માંડવા લાગ્યા. ત્રણું વરસ સુધી અલ્યાસ કરાવી ૨૦ વરસની ઉમર જ્યારે કાળીદાસની થઈ ત્યારે હવે દીક્ષાકાળ થયો એમ જાણી વિહાર કરતા અનુકૂમે સંવત ૧૯૧૦ માં જુનાગઢ મુકામે પધાર્યો. સમસ્ત પરિવાર સહિત જુનાગઢ આવી શેષકાળ વિચરતા લ્યાંના શ્રી સંઘની દુર્ઘાથી વૈશાખ શુદ્ધ ઉના શુલ્ષ મુહુર્તે રહેઠા મહેતસવ સહીત ૨૦ વરસની ઉંમરે કાળીદાસને દિક્ષા આપી. કલ્યાણુચંદ્રજી નામ પાડવામાં આંદું. પરીના તળાવ આગળ વડના જાડની નીચે પંચ મુદ્દી લોચ કર્યો. દિક્ષા મહેતસવમાં જુનાગઢ શ્રી સંઘે તન મન અને ધનથી અપૂર્વ સેવા કરી. જે ટાઈમે દિક્ષાનો લોચ થયો તેજ ટાઈમે પૂજય કલ્યાણુચંદ્રજી વડના જાડની નીચે કાઉસગ્ગ ધ્યાનમાં પ્રવત્તર્યો. સમાજ વિખેરાયો. ધ્યાન



ધ્યાનસ્� સ્થિતિમાં રહેતા મૂજયશ્રી ઉપર નાગ અને નાગણીના
નેડાએ લઈકવા માંડયું.

જુનાગઢમાં દિક્ષા.

સ્થિતિમાં રહેલા પૂજયશ્રી કલ્યાણુચંદ્રજીના મસ્તક
ઉપર નાગ અને નાગણીના જોડાએ પૂજયશ્રી કલ્યા-
ણુચંદ્રજી ઉપર લટકવા માંડ્યું. છતાં બીક ન લાગી.
થોડાક માણુસોએ આ દ્રષ્ટ્ય જોયું. પૂજયશ્રી જ્ય-
ચંદ્રજીને વાત કરવા ગયા. વાંચક! હવે સ્વ મને
વિચાર કે તાર્ણણ વયમાં જ પ્રાથમિક ભૂમિકા જ કેવી
અધ્યાત્મિક શક્તિથી શરૂ થઈ છે. ધ્યાનના જેરે
નાગનું જોડું મસ્તક ઉપર હોવા છતાં કાંધજ કરી
શકતું નથી એ જેવી તેવી વાત છે? અનુકૂમે પૂજય
કલ્યાણુચંદ્રજી જુનાગઢમાં આગર તળ અણગાર થયા.
મહાવૃત્તને ધારણ કરી અવીરત ભાવનું નીકંદન કા-
દ્યું. ઐહિક, પौર્ણાલીક, વાસના અથવા ઈચ્છાની
તૃસી થવાથી સંસારી આત્માએ જેમ હુખ્ખ પામતા
થાય તેમ ચારિત્ર નાયક પણ જુનાગઢમાં દિક્ષીત
થયા પછી આનંદીત થતા હતા.

ઉથ તપસ્યા અને સાધના

વાંચક ! જેણે પોતાની રિદ્ધિ એક વૈરાગ્યવૃત્તિને
પોષવા માટે છોડી, કુદુંબ છોડ્યું, ધરણાર છોડ્યા,
માત પીતા છોડ્યા. એમની વૈરાગ્યવૃત્તી કેવી હશે ?
હું તેઓની તપશ્ચર્યા કેવી છે તે ઉપર નજર કર-
વાની છે. દિક્ષાના ખીલ જ દિવસથી રાત્રીના ધ્યાન
ધરવા ગામનું કોઈ ખંદેર હોય ત્યાં જતા. આખી
રાત ધ્યાનસ્થ સ્થિતિમાં ગાળી સવારના પાંચ વાગે
ઉપાશ્રેય આવતા. ત્રણે રત્નમાં એક કામળી ઉપર
સુવાનો જેને નિશ્ચય હતો દિવસ અને રાત્રી મળી
ચાર કલાકની નીંદ્રા લેતા અને ખાકીના ટાઈમમાં
આત્મ સ્વરૂપમાં લીન બનતા. પૂજ્ય શુરૂવર્યની સાથે
ગામેગામ વિહાર કરી પોતાના નિત્યક્રમ પ્રમાણે

∴ ૪૬ ∴


રાત્રીના કોઈ અરણ્ય ભૂમીમાં એક પગે ઉલા રહી ધ્યાન કરતા. હું આત્મા છું અનંત શક્તીવાન છું અનંત વિર્યવાન છું. ધ્યાનના પ્રભાવથી ત્રણે લોકને ધુનાવવા સમર્થ છું. ધ્યાનસ્થ સ્થિતિમાં શાસ્ત્રો મને છેદી શક્શો નહીં. અમ્રિ મને ગાળી શક્શો નહીં. પાણી મને બુડાડી શક્શો નહીં. પહાડોની આરપાર જવાની આત્મામાં શક્તી હોય છે. આવી રીતે કેવળ આત્મા અને તેની શક્તિનો જ ચારિત્રનાયક વિચાર કરતા અને આત્મીક આત્માઓ જેણે સત્ય સ્વર્ગ પ્રગટ કર્યું છે તેનો વિચાર કરી પોતાની સ્થિતિ કયારે તેના જેવી થશે આત્માની અપૂર્વ સ્થિતિ કયારે પ્રાપ્ત થશે તે વિચાર આવતા ધ્યાનસ્થ સ્થિતિમાં રોતા. કલાકોના કલાકો રોવામાં ગાળી વિચારણામાં ચઢતા વળી એક ચિત્ત થાતા ધ્યાનસ્થ અવસ્થામાં પણ અનેક ઉપસર્ગો તેઓશ્રીને આવતા અને તેમાં અડગ રહેતા. દિક્ષા લીધા પછી અનુકૂમે ૬ વરસ પૂજયશ્રી સાથે રહી ધ્યાનના દોર પર ચઢતા એકવાર પૂજયશ્રી જ્યયચંદ્રજ ગુજરાતમાં વિચારતા હતા એવામાં ગુજરાતના સુરત પરગણામાં કોઈ : ગામે : આંદ્રા ૨૬ વરસની યુવાનવય પૂજય શ્રીની હતી તેમાં નિત્ય કુમ પ્રમાણે રાત્રી પરી એટલે ગામની બહાર ધ્યાનસ્થ સ્થિતિમાં રહેવા ગયા. ત્યાં

આચાર્ય શ્રી કલ્યાણુચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

આગળ રાત્રીના ખાર વાગે કોઈ સ્ત્રી આવી. વાંચક ! જાણો અધ્યાર્થની કસોટી કરવા આવી હોય તે પ્રમાણે કલ્યાણુચંદ્રજીને કહેવા લાગી કે તમો મારા પૂર્વ લવના પતિ છો માટે મારી સાથે વિલાસ સુખનું સેવન કરી મને સંતોષ પમાડો. એકાંત અરણ્ય અને રાત્રી તેમાં પણ ચુવાન વય તે અવસ્થામાં વિષયના જેરને આત્માથી હુર કરવો એ રમત નથી.

સ્ત્રીનું વચન ગણુકાયું નહીં એટલે તે માયાવી વિભૂતિ કલ્યાણુચંદ્રજીના પહેરેલાં વસ્ત્રોને એંચવા મંડી, હાથ એંચવા મંડી, અંગોની એંચતાણુ કરી સુકી. મારું કહેવું જો નહીં માને તો અગિનમાં ખાળી મૂકીશ. નજીક અગિન ખળતો પૂજયશ્રીને દૃઘાચો પણ જરાચે હૃદયમાં ફેર પડ્યો નહીં. અને તે માયાવી વિભૂતિ ચાલી ગઈ. ધ્યાનસ્થની ઉંચ ભૂમિકામાં જનારા આત્માઓને અનેક નીતિના ઉપસર્ગો આવે છે. જેમાં આ એક કસોટી રૂપ ઉપસર્ગમાં પુસાર થયા પછી બીજે દીવસે રાત્રી પડી અને તેણે જગ્યાએ ધ્યાન કરવા આઠ્યા તે વખતે તો શરીરમાં એક જાતનો હાહ ઉપડ્યો. જયારે જયારે ઉંચ શ્રેષ્ઠી ઉપર આત્મા જય છે ત્યારે શરીરમાં રહેલાં વીકારો ખળીને ખાખ થઈ જાય છે. તેજ પ્રમાણે પૂજયશ્રીના શરીરમાં અગિનના ઉપદ્વષ્ટી વિકારમાં અગિન ઉપજ

વर्तमान आचार्य



Shree Sudarshan દોષાગ્રહાભિપત્રિ શ્રી નાયયંડલલસુરીખરણ

ઉત્ત્ર તપસ્યા અને સાધના.

થઈ છે એમ તેઓ સમજવતા. વાંચક ! આ રીતે સાધનામાં લીન બનવા સાથે દરરોજ કંઈક ને કંઈક તપશ્ચિર્યા તો ચાલુજ હતી. કોઈ દિવસ બે વાર તો ચારિત્રમાં આવ્યા પણી જમ્યા જ નથી. હવે ખાદ્ય પ્રવૃત્તિમાં આગળ વધે છે. સ્થળે સ્થળે ગુરુવર્ય સાથે જતા કષ્ટ એવી કિયાઓથી આત્માને દમતા જ્ઞાન અને ફીયા બનનેના સમાગમથી દેહની શોલામાં વૃદ્ધિ કરતા. પૂર્વના જ્ઞાનથી વિશાળ સમાજને સત્યનો એકધારે ઉપદેશ ગુરુવર્યની આજ્ઞાનુસાર આપતા વાંચક ! તે વળતે યતિ સમાજ જેટલી પ્રખણતા સાધુ સમાજમાં ન હતી છતાં સાધુ સમાજનું જેર વધારે થાય તેમ હેખાતું હતું છતાં યતિ સમાજનો મુકાણલો કરી શકે એવા તે વળતે સાધુ સમાજમાં ન હતા. પ્રત્યેક સ્થળે લોકાંગચ્છના યતિવર્યો થાણું જમાવીને એડા હતા કે જે મહારથીઓની ચારે તરફ હાંક વાગતી. છતાં ચરીત્રનાયક સમજતા કે વિદ્વાનોનું બળ હવે વધતું જય છે માટે મારે પણ ચોભ્યતાસર તૈયાર રહેવું જોઈએ. ગુરુજીના ટાઇમની જેમ મારે પણ સત્યના સમર્થનમાં ઉત્તરવું પડે. ગુરુવર્યના મુખેથી પોતે ૧૮૪૫ થી : લગભગ તે અરસામાં ૧૨ વરસ સુધી એટલે ૧૮૫૭ સુધી એ પક્ષોનો મૂર્ત્તિપુન સંબંધમાં સાણું હ

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત.

મુકામે વાદ થયો હતો, તે સાંભળ્યો હતો. સિદ્ધાંતિક વાતોમાંથી અંગત વાતોમાં ઉત્તરતા કળ્યાએ મોટું સ્વરૂપ પકડયું અને વાત વધી પડતાં કોરટે કળ્યો ગયો. પૂજ્ય શ્રી જ્યયચંદ્રજી સામેલ હતા. સિદ્ધાંતિક વાત બાન્ધુએ રહી અને જુહા સ્વરૂપમાં વાત આવતા કોરટમાં કેસ ચાલ્યો. અને પૂજ્ય શ્રી જ્યયચંદ્રજીના લાલમાં પરીણામ આંદ્રું. આ વાત બંને સમાજના મગજમાં હજુ તાજી હતી તેને અંગે વિક્રાન વર્ગ કે જેણે વાડાના બંધનોમાં પોતાના આત્માને બાંધ્યો છે, તેવા વિક્રાનો પણ પૂજ્ય શ્રી કલ્યાણચંદ્રજીની તેજસ્વી પ્રતીલા, ગંભીર મુખમુદ્રા અને અમોદ વ્યાખ્યાન શૈલીથી ગલરાતા. વાંચક પૂજ્યશ્રી મારવાડી હેહ, મનોરમ્ય પ્રલા, હિંય કાંતી અને નીડર વ્યાખ્યાન શૈલીના પ્રતાપે અનેકોના મન આકર્ષ્ય. કોઈની ઘુશામતખોરી નહીં; કોઈની દાક્ષીણ્યતા નહીં, અને મોટા વિક્રાનોના ગર્વ ધડીમાં ગાળી નાખે એવી એમની વાક્યધારાથી સ્થળે સ્થળે જનતા હર્ષથી પાગલ બનતી. જ્યાં જ્યાં પૂજ્ય કલ્યાણચંદ્રજી ગુરુવર્યની સાથે વિહારમાં જતા લ્યાં લ્યાં સામાન્ય જનતા, જ્ઞાન પીપાસુ આત્માએ, પછી જૈન અથવા જૈનેતર સર્વે હંજરેની સંખ્યામાં પૂજ્યશ્રીને ઉપરેશ સાંભળવા ઉત્તરી

ઉત્ત્ર તપસ્યા અને સાધના.

પડતા અને ધર્મ શ્રવણુ કરતા. વાંચક ! આટલો ણથો
કેનો પ્રભાવ ? કહેવુંજ પડશો કે એમના ચારિત્ર
અને ધ્યાનભળથી જથ્થત થએલી આત્મશક્તિનો
પૂજ્યશ્રી પાંચે દ્વાનિદ્રાયોના સંયમમાં અહનિશા તત્પર
બનતા પાંચે દ્વાનિદ્રાયો જ્યારે કણજે થાય છે ત્યારે
જ આત્મશક્તિ જથ્થત થાય છે. તેમ તેઓ સમજતા
અને જનતાને સમજવતા અને તેથીજ પાંચે દ્વાનિદ્ર-
યોમાંથી ઉત્પજ્ઞ થતા વિકારનો નાશ કરવા જ્યારથી
દિક્ષા અંગિકાર કરી ત્યારથીજ રસનો ત્યાગ કર્યો
હતો. માહક વસ્તુઓને જીવનમાંથી દેશવટો આગ્યો
હતો. દિક્ષિતોને દ્વાનિદ્રય નિથહ માટે દરેક પ્રયત્ન
કરવા જોઈએ તેમ તેઓ માનતા. અને તદસિદ્ધાંત
અનુસાર જ્યારથી દિક્ષા પર્યાયમાં આવ્યા ત્યારથી
અડદની દાળ અને ખાજરાનો રોટલો તે સીવાય
અન્ય જેમનો ખોરાક નહોતો. વાંચક ! આજે સાધુ
દિક્ષામાં યા યતિ દિક્ષામાં આવનાર બ્યક્ટિની કેવી
દશા જોવાય છે તેનો ખ્યાલ પણ અસ્થાને નહીંજ
ગણ્યાય. અત્યારના દિક્ષિતોને ઉપરનો સંયમ તો
હુર રહ્યો પરંતુ ગૃહસ્થોની જેમ નાશકારી બ્યસનો પણ
દિક્ષિતોથી છોડતા નથી. મોટા સ્ટેટ કરતાં પણ ચાનું
સામ્રાજ્ય વધી પડ્યું છે રાય રંક શોઠ નોકર ત્યાગી
અને રાગી સૈા કોઈ એના સામ્રાજ્ય નીચે આવી ગયા

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

છે. એટલે ત્યાગી વર્ગ પણ એનાથી બંધે તે કાળની દૃષ્ટિએ ચોંધ્ય ન હોય તે આધારે ચાના સપાઠાથી પણ ત્યાગી વર્ગ બચ્યો નથી. તે ઉપરાંત ખોરાકમાં પણ શ્રીમંતોથી અધીક ભાવ્ય પદાર્થીની લોગ સામચીથી ત્યાગી વર્ગ વંચીત હેણાતો નથી. આવા વ્યસનોની પામરતાથી દિક્ષિતો ચલાયમાન થાય અને વ્યસનોને નાખુફ કરવાની શક્તિ જે દિક્ષિતોમાં ન આવે તો જનસમાજ ઉપર ધર્મ ઉપદેશની સાચી અસર ઉત્પન્ન કરાવવા તેવો શક્તિમાન નહીં બને. અને તેને અંગે જ્યાં જ્યાં પોતાના વ્યસનો પોષાતા હોય ત્યાંજ દિક્ષિતો પૂર્વના મઠ ધારી સન્યાસીઓની જેમ રહેડાણ જમાવે છે. અને તે મર્યાદા બાંધેલ ગામો સિવાય ખીજે વિહાર નથી કરી શકતા. એનાથી આગળ વધીએ તો તેજ મુનીવરો દિક્ષિતો પ્રાતઃકાળે વ્યાખ્યાન પીઠ ઉપર છેસી પોતાની વક્તૃત્વ શક્તિથી સંસારીઓની નિર્ણયતા ઉપર પ્રહાર કરી અનેક રીતે માર્મિક વચનો બોલી દીકા કરે પણ પોતાની અંદર રહેલા વ્યસનોને નાખુફ ન કરી શકે. ઉત્તમ આત્માની ક્રિદ્ધસુશ્રી સમાજને સમજાવી શકે પણ પોતાના ઝુદ્ધયની અંગત પામરતાને હૂર ન કરી શકે એ કેવી વિષમ વાત. પણ વાંચક ! હવે વ્યક્તિગત દિક્ષિતોના

ઉચ્ચ તપસ્યા અને સાધના.

નિર્બંહ જીવનથી હવે સમાજ અન્નાણ્યો રહ્યો નથી. વર્ષો સુધી શ્રદ્ધાના જેરને અંગે વેષધારી દિક્ષિત હોય તો પણ રૂઢીપૂજક વર્ગ કે જેમનામાં સ્વતંત્ર ખુદ્ધિ અને વિચારકપણુંનો નાશ છે. તેવા પૂજય મુનીવરોમાં આપણું આત્મકલ્યાણ કરવાની શક્તિ છે એમ માની લીધું. અને પૂજય માન્ય સાથે દલીલો કરતા ગયા કે દિક્ષિતોના અંગત જીવનમાં આપણે શા માટે હાથ નાખવો જેધાએ. આપણે તો મહાવીરના વેષને માનવો છે ને ! પરે પણ મહાવીરના વેષનેજ લાગવાનું છે ને. આવી લાવના અને તેને દ્વદ્દ કરવનારા પણ તેજ દિક્ષિતો છે. તમારે તો ગુણશાહક થવું અવગુણ જોવાની દષ્ટિનો નાશ કરવો હુંસ જેવી વૃત્તિ આહરણીય છે. વીગેરે વચ્ચનોથી જીનવાળી સમાજમાં શ્રદ્ધાને રેડે અને આજ આવીજ શ્રદ્ધાથી દિક્ષિત અવસ્થામાં રહેલા કેટલાએ દિક્ષિતોની પોલ ઉપર ઢાંક પીછોડા થાય તેમની શિથિલ વૃત્તિઓને પોષી રહેવાય. સત્ય માર્ગનું અવરોધન થાય અજ્ઞાન સમુહની જેમ સંસારી કુલમાં જેમ એકની પછવાડે અનેક પોષાતા હોય તે પ્રમાણે દિક્ષિત સમાજમાં પણ મોટા સમુહની સાથે વધારે સંખ્યામાં વિચરતા હોય તેમાં ભાર એકજ ઉપર. થોડું જ્ઞાન પણ એકનેજ

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત.

હોય. બાકી ખીણ દિક્ષિતો વહેરવાના કામમાં
પાણી લાવવાના કામમાં અને લુગડા ધોવાના કામ-
માંજ દિક્ષિતો રોકાચેલા હોય. પ્રાયે આજ સ્થિતિ
નજરે જોવાતી હોય ત્યાં સ્વ અને પર સમાજને
ધર્મ તેની ઉત્તરિની વિચારણા કચાંથીજ થાય.
કદાચ તે દિક્ષિતો બાધ્ય પ્રવૃત્તિથી ત્યાગી હેખાતા
હોય પણ છતાં આત્મ જગૃતી આવી જતી નથી.
કારણ અંતર જગૃતિની મહદ્દ રૂપ ને જ્ઞાન તેનો
તો અલાવજ હોય, વાંચક ! આ સ્થિતિ જાણવા
છતાં સમાજને તેની ચિંતાજ નથી. ને દિક્ષિતો
જ્ઞાનાભ્યાસ કરી ધર્મ દેશના દેવા ઉપરોગી થાય
અને જ્યાં ધર્મ નથી લાં ધર્મ સ્થાપન કરે.
દિક્ષિતોના અજ્ઞાન સમૂહના મોટા લાગને જાણવા
છતાં પણ સમાજની આંખ ન ઉઘડતી હોય જ્ઞાના-
ભ્યાસના ચોગ્ય પ્રણાયો ઘડવાની વિચારણા સમાજ
ન કરી શકતો હોય તો જાણો કે જૈન સમાજની
ઉત્તીને સૈકાચ્યેાની વાર છે. વાંચક ! ચુગ કાળના
આ જમાનાએ કેટલાકોની આંખ ઉધાડી છે હુંબે
પૂર્વની જેમ દિક્ષિતોની વાગનામાં ફ્રસાઈ જય
એ જમાનો રહ્યો નથી. ઉપરાંત દિક્ષિતોને કર્તાંયતું
ભાન કરાવવા સમાજ તૈયાર છે. એથી આગળ
વધતા હુંબે એમ પણ કહેવાની ફીમત કરે છે કે

ઉચ્ચ તપસ્યા અને સાધના.

ગુજરાત ને કાઠીયાવાડ તો બાપીકો દેશ છે. ત્યાં તો ધર્મ ધર કરીને રહેલો છે. અહીંથા તો ધર્માય મુનીવરોનો નિવાસ છે. માટે આપ વિદ્વાનો ત્યાં વિચરો કે જ્યાં ઉપરેશની વધારે જરૂરી-યાત હોય. જ્યાં અજ્ઞાનતાના થર બાજ્યા હોય હર વરસે ઉપરેશકોના અભાવે જ્યાં ધર્મ છોડી હેવાતો હોય એવા મગધ, બંગાલ, પંજાબ વગેરે દેશોની ભૂમી ઉપર પધારી શાસન સેવા કરે. ગુજરાત તેમજ કાઠીયાવાડમાં આટલા વરસો સુધી દરરોજ વ્યાખ્યાન આપવા છતાં કોઈ પણ અજ્ઞેન જૈન બન્યો નથી. માટે આપ ત્યાંજ વિચરો કે જ્યાં ધર્મ શાખદનો અર્થ જણુતાજ નથી ત્યાં જઈ ધર્મનો ડંકો વગાડવો એમાંજ તમારી હિક્ષિત અવસ્થા જળહળી ઉઠશે. આ પ્રમાણે વિદ્વાનોને કહેવા જેટલી નીડરતા પણ હુવે સમાજમાં આવી છે. વાચક ! જ્યારે યતીસમાજ લારતવર્ષમાં ડેક ડેકાણે હતો ત્યારે યતીવર્યોના નામથી રાજ્યો અને સહૃદનતો ડાલતી ત્યારે અનેક અન્ય ધર્મિઓને યતી-વર્યોએ જૈનધર્મી બનાવ્યા છે. અનેક હિંસાતમક રાજ્યોને અહિંસક બનાવ્યા છે. અનેક ધીજ દરશનના ધર્મશુરુંએ સાથે વાદ કરી રાગ રહીત એવા વિતરાગ ધર્મમાં લાવ્યા છે. અરે તેનાથી

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

આગળ વધતા જૈન ધર્મને અત્યાર સુધી ટકાવી રાખવાનું કામ યતીવર્યોચેજ કર્યું છે. જૈન ધર્મની વિજય પતાકા હેશો હેશમાં સ્વાર્થત્યાગી બની અમર બલીહાનના ભોગે રાજસત્તાઓની સામે થઈને પણ ઝીરકાવી છે. શાસનની સેવા બજવી છે. ધર્તિહાસમાં દૃષ્ટિપાત કરેલા કુમારપાળને ગુજરાતની ગાઢી અપાવવા પ્રયત્ન કરુનાર કળીકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય યતીજ હતા. વીર વનરાજ ચાવડાની કીર્તિ પણ શીયળગુણસુરી યતીના પ્રતાપેજ હતી. સાંઘાટ અકાગર આગળ જૈનધર્મ સંખાંધી પહેલી જ વાર માહીતી આપનાર ઝીરવીજયસુરી યતીજ હતા. ત્યાર પછી તેજ ધર્મમાં વધુ રસ લેતા બનાવનાર પૂજય લઘુવરસીહજ પણ યતીજ હતા. જહંગિર બને માનસીહ આગળ અહીંસાનો પડહ આખા રાન્યમાં પર્યાંખણુના દીવસોમાં વગડાવવાનો ઉપરેશ આપી હુકમ કઠાવનાર પણ તુલસીદાસજ યતીજ હતા. આવા એક નહીં પણ અનેક દૃષ્ટાંતો યતીવર્યોની સેવાના સાક્ષીરૂપ ધર્તિહાસમાં મોંનુદ છે. જે વખતમાં દિલ્હીની ગાઢી ઉપર સાંઘાટ અકખરની હાક વાગતી તે વખતમાં ૧૬૦૦ ની સાલમાં સાંઘાટ અકખરે સર્વ ધર્મના ધર્માચાર્યોને બોલાવ્યા. તમામ ધર્મના ધર્મગુરુઓની સાથે પોતાના મનનું નિરાકરણ કરવા

ધર્મ ગુરુઓની સાથે ચર્ચા કરી. હોસામાંજ જે ધર્મોએ
આત્માનો શાંતિ માની છે એ ધર્મના અનુયાયી
સાથે વાહમાં મનનું નીરાકરણ ન થઈ શકવાથી
તમામ ધર્મના પ્રવૃત્તકોને સમાટ અકબરે મહેલોમાં
પુર્યા. તેજ વખતમાં વિહાર કરતા લોંકાગંધીપતી
પૂજય લઘુવરસિંહજીનું આગમન દીઠ્ઠીમાં થયું
સમાટને જાળ થઈ, અને આચાર્યદેવને ઐલાવ્યા
ખીજ ધર્મગુરુઓની જેમ આચાર્ય સાથે સમાટે
ચર્ચા કરી. સ્યાક્રાદની જગથી પૂજયશ્રીએ સમાટની
શાંકાનું સમાધાન કર્યું. અને સમાટે જૈન
ધર્મના સિદ્ધાંતો માનપૂર્વક ગૃહણ કર્યા અને
આચાર્યદેવની આજાનુસાર ધર્મ અનુઅયીએને
મહેલોમાંથી છોડી મુક્યા અને પૂજયશ્રીને મહદુર્પ
એવા પરવાના સમાટે લખી આપ્યા. અને સાથે હૃથ
નીચેના તમામ રાજ ઉપર પૂજયશ્રીને માન આપવા
સંખ્યાંધમાં ફરમાન લખી મોકલ્યાં. એવા એક નહીં
પણ અનેક રાજ્યો યતીવર્યોને ગુરુ તરીકે સ્વીકારતાં.
તેની સેવા શાસન અને સમાજથી અજાણી નથી.
શાસનમાં તમામ આત્માએ એકાંતે કણુલે છે કે
અમે જે ધર્મમાં છીએ તે જૈનધર્મનો દિગ્ભુવિજ્ય
કટોકટીના પ્રસંગોમાં જ્યારે ભારતના તમામ સંપ્ર-
દાયોમાં અને સમાજેમાં પણ મોટા વિહવાનો હતા

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

તેવા વખતમાં જૈનધર્મનો દિગ્ભિજ્ય યતીવર્યોને જ આભારી છે. વાચક ! જુગ જુના આ ભારતવર્ષમાં ગૌરવલયો જૈન સમાજ અને તે ગૌરવતા પ્રાપ્ત કરનારો વર્ગ તેજ યતીવર્ગ. વાચક તે વર્ગ અત્યારે નિર્ણય છે. કુંક સંખ્યામાં છે. એટલે સમાજની દિદ્ધિએ અત્યારે ઓછો પરંતુ તે વર્ગ જે સેવા કરશે તે સાધૂ સમાજ નહી કરી શકે તે નિશાંક છે. યતી સમાજની નિર્ણયતા જણુવા છતાં તેને પગલાર કરવા તેના સેવકો તેના ઉપાસકો અને તેનો સર્વોપરી પહ લોગવતા આચાર્યોના માનસમાં ઉજીવીની વિચારણા જન્મતી નથી. તે કેટલી દીલગીરી ? અને યતીસમાજની હુર્ણયતા સાથે સાધુ સમાજની સણળતામાં જૈનો જૈન ધર્મને છેલી સલામ હર વરસે કરતા જય તે પણ કેટલી દીલગીરી ? કાંતીના આ જમાનાને ચોગ્ય દિક્ષિતો પોતાની દીશા નહી ખફલે પોતાની વિહાર ભૂમીને સંકુચીતમાંથી વિશાળ નહી ખનાવે અને જમાનાની સાથે રહી ધર્મ ટકાવવા પોતાના બ્યસનોને હુર નહી કરે અને સમયસર ચોગ્ય પ્રયત્ન નહી થાય તો જાણ્ણો કે શુજરાત અને કાઠીયાવાડ શીવાય ધર્મ દેખાવાનો નથી. વાચક ! અત્યારે તો પૂજયશ્રી જેવા ત્યાગીનીજ જરૂર છે. કયાં અત્યારના દિક્ષિતોનું જીવન

ઉમ્ર તપસ્યા અને સાધના.

અને કયાં પૂજયશ્રીનું જીવન અને તેનાજ પ્રતાપે
પૂજયશ્રીના જીવન સાથે છિયા અને ખોરાક રાત્રીના
ધ્યાનની પ્રણાલિકા ઉચ્ચ તપક્ષીયર્થી અને અધોાર આત્મ
સાધના પૂજયશ્રી આચરતા તે પણ સમાજથી અજા-
ણયું ન રહ્યું એટલે પૂજયશ્રી દીવસના ધર્મનો બોધ
સમાજને આપતા અને રાત્રે પોતે બોધ લેવા રૂપ
ધ્યાન ધરતા આવી ઉચ્ચ તપક્ષીયર્થી અને આત્મસાધના
ગુરુઆજાનુસાર આચરતા અને આત્માનું શ્રેય કરવા
તાત્પર બનતા.



વડોદરામાં આચાર્ય પહ અને વિહાર

વાંચક પૂજયશ્રી કલ્યાણુચંદ્રજી જૈન જગતમાં દરેક રીતે પ્રખ્યાત થધ ચુક્યા હતા. એમની વિદ્વતા અને ધ્યાન અને તપક્ષયાર્થી ઉત્પજ્ઞ થતી આત્મશક્તિના પ્રતાપે જૈન જગતમાં નાનાથી મોટા પર્યંત દરેકના હૃદયમાં બહુ માન ઉપજાંયું હતું. પ્રત્યેક સ્થળોએ પૂજયશ્રીના વ્યાખ્યાનથી જનતા ઉપર બહુ સારી અસર થધ ચુકી હતી. અને તે વખતમાં એમના જેવી વિદ્વતા અને એમના જેવા શાક્લના જાણુકાર થોડા હતા. પૂજયશ્રીની નાના અને સાદાઈ જોઈ તેમના સમાગમમાં આવનારા પ્રત્યેક મનુષ્યો આક્ષર્ય પામતા. કોઈ કોઈ વાર તે પૂજયશ્રી નાના બચ્ચાની સાથે ગોલ કરાવા પણ લાગી જતા.

∴ ૬૦ ∴

વડોદરામાં આચાર્ય પહ અને વિહાર.

ખરચા સાથે રમતા અને સૈને કહેતા કે ખરચાની સાથે બાળકવૃત્તિ રાખીએ તોજ આપણી સાથે ખરચું રમે તેમ કોઈ પણ કાર્યની સાથે જ્યાંસુધી તહ્વીન ન થાયો ત્યાંસુધી કાર્યની સિદ્ધિ ખડુ મોડી થાય. તેમ કુરમાવતા કાળને નિર્ગમ કરતા પુજ્યશ્રી જ્યાંદ્રલું સાથે વડોદરા મુકામે પધાર્યા. આચાર્યપદની લાયકાત કલ્યાણુચંદ્રલુંમાં જેઠને તથા વડોદરા શ્રી સંઘનો આથડુ પણ ત્યાંજ આચાર્યપહ અપાય એમ દૃચ્છા જાણી આચાર્ય પદવીનો હીવસ નહીં કરી શ્રી સંઘમાં જહેર કર્યું. આમંત્રણુ પત્રીકાએ ખહાર પડી. ઉત્સવ ઉજવવા નિમિત્તે આચાર્ય પદવીના સમારંભમાં સ્થળે સ્થળોથી હળવો માણુસો લાગ લેવા આવ્યા. ત્યારણાદ વિકિમ સંવત ૧૯૧૮ ના મહા સુહી ૧૩ ને હીવસે પુજ્ય શ્રી કલ્યાણુચંદ્રલુને ૨૮ વરસની ઉમરે સમસ્ત શ્રી સંઘ સમક્ષ વિધી સહીત આચાર્ય પહ ઉપર આરૂઢ કર્યા. સર્વ જનતાના હુદયમાં આત્મોહ્લાસ પ્રગટી નીકળ્યો. શાસનમાં ચારે તરફ જ્યાંયકાર થયો. વિજયના પોકારો ચારે તરફ થયા. આખા સમાજમાં આનંદ પ્રસરી રહ્યો. ઘેર ઘેર સ્થળે સ્થળે હરોન્માદ પ્રગટી નીકળ્યો. સમાજના નાયક તરીકે પુજ્યશ્રી નીમાયા. નાયક વગરનું સૈન્ય આંખ વગરના હેઠ જેવું છે. નાયક

આચાર્ય શ્રી કલ્યાણુચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.


હોય તો પોતાની આજામાં રહેલા સમાજને ચોગ્ય માર્ગે લઇ જાય છે. તે હેતુએ સમાજે પણ પુન્યશ્રીને નાયક તરીકે કખુલ્યા. શાસનની તમામ હિતાહિતની જવાણદારી પુન્યશ્રી ઉપર આવી, સમાજ રક્ષણનું કાર્ય અને તેની જવાણદારી આચાર્ય ઉપરજ હોય છે. અને તે આચાર્યની પહ્વી પૂર્વના વળતમાં સમાજના નાયકો લેગા થઈને ચોગ્ય અને લખધીવાન સાધુનેજ અર્પણુ કરતા કે કે આત્મશક્તિના પ્રતાપે સમાજને ધર્મ ઉપર આવતી આપત્તિને અટકાવી શકે. વાંચક ! આજે તો સમસ્ત જૈન સમાજમાં આચાર્યની ખોટ નથી. મોટા શહેરોમાં નજર નાઓ. તો આચાર્ય દેખાયા વગર ન રહે અને જેની સત્તા તો ફૂક્તા પોતાના દિક્ષિત શિષ્યો ઉપર પણ ન હોય. શિષ્યની ભૂલ ખતાવતા કદાચ શિષ્ય ચાલ્યો જ્ઞે એ બીકે ગમે તેવા વર્તનવાળા શિષ્યનો સંબંધ કરી આચાર્ય પોતાનું આચાર્યપદ સિદ્ધ કરે. જ્યારે પૂર્વના આચાર્યની તો સમસ્ત સમાજમાં હાક વાગતી. એમની આજાના પાલનમાં અહુરનીશ શ્રી સંઘ તૈયારજ રહેતા. અને તેથીજ ધાર્યી કામ પાર ઉત્તરતા. પૂર્વ મણુલિકા અનુસાર લોંકાગચ્છાધિપતિ શ્રી કલ્યાણુચંદ્રજી વડોદરામાં આચાર્યપદે પિરાન્યા. ત્યારપણી ચાર માસની અંદર ચુડ્યા

શ્રી જ્યયચંદ્રજી જાડાની બિમારીને અંગે સ્વર્ગવાસ થયા. કાળના સપાટે કોણું નથી આવતો. જ્યાં કર્મ છે ત્યાં કાળની સત્તા છે. અને તે સત્તાની નીચે કર્મસ્વરૂપમાં રમણું કરનાર આત્માચોજ છે. અને તે સત્તા અખંડ અને એક ધારી છે. કર્મના બંધનમાં જ્યાં સુધી આત્માચો અટવાય છે ત્યાં સુધી રહેશે. અસ્તુ.

પૂજ્ય ગુરુવર્ય સ્વર્ગવાસી થયા પછી આચાર્ય દેવ શ્રી કલ્યાણચંદ્રજી વડોદરામાં રહ્યા. દીવસે જતાં ચાતુર માસનો કાળ નજીક આવ્યો. પોતે સર્વે યતીવર્યેનો ચાતુરમાસ માટે ચોણ્યતા સુજગણ નીમ્યા. અને પછી દેશાવરેથી આચાર્યપદ પ્રાપ્ત થયા પછી પ્રથમ ચાતુરમાસ પોતાના ગામમાં કરવાની આચહુ ભરી વિનંતીએ આવવા લાગી. પોતાના ગામે પૂજ્યશ્રી ચાતુરમાસ માટે પધારે એમ સૌ કોઈ વીચારતા. આચાર્યપદ ઉપર આવતા પહેલા પૂજ્યશ્રીનો કીર્તિ હિગંતંયાપી થએવી હતી જેના પ્રતાપે સૌ આતુર મને વાટ જેઠ રહ્યા હતા. વડોદરાના શ્રી સંધનો ચાતુરમાસ માટેનો આચહુ તો ચાલુજ હતો. તેમાં વડોદરા શ્રીસંધને તો પૂજ્યશ્રીએ કહું કે તમોએ અપાર લાલ લીધો છે. તમારી લક્ષિતમાં જરાએ કચાશ નથી. આ પ્રમાણે

આચાર્ય શ્રી કલ્યાણયંત્રજી મહારાજનું જીવનચરિત.

વડોદરા શ્રીસંધને પૂજયશ્રી સમજની રહ્યા છે. ત્યાં સુરતનો સમસ્ત સંધ પૂજયશ્રીને ચાતુરમાસ માટે તેડવા માટે આવ્યો. સર્વ શ્રાવકોએ તથા વડોદરા શ્રી સંઘે સાંજનો ટાઈમ હતો એટલે લોજન કરવાનું આમંત્રણ કર્યું. સુરતના સહયોગસ્થોએ કહ્યું કે પૂજયશ્રી તરફથી અમને સંતોષકારક જવાણ મળશે ત્યાર પછી અમને આહાર પણ ગપશે. પૂજયશ્રીને પણ કહ્યું કે અમારા ખાળખચ્ચા સર્વેને લોજન કરાવવા મોકલવા હોય તો આ ચાતુરમાસ સુરત મુકામે કરવું, એ નક્કી કરે. અતુલ ભક્તિ લાવ જોઈ અંતે પૂજયશ્રીએ સુરતનું ચાતુરમાસ નક્કી કર્યું. સુરતનો શ્રી સંધ વડોદરા શ્રી સંધના અત્યંત આશ્રયથી એ હિવસ નીવાસ કરી સુરત મુકામે ગયો. પૂજયશ્રીનું ચાતુરમાસ સંધમાં જહેર થઈ ગયું. સૌ આતુર નથને હવે પૂજયશ્રીની રાહ જોવા લાગ્યા. અનુકૂમે સંવત ૧૯૧૬ માં ચાતુરમાસ કરવા અશાડ શુદ્ધ ૧ ને હિવસે સુરત મુકામે ૪૫ યતીએ તથા ૨૭ શિષ્ય વર્ગ સાથે પદ્ધાર્યા. સંધમાં અગાઉથી ખખર થવાને અંગે લભ્ય સ્વાગતની તૈયારી થઈ ચુકી હતી. ગામની બહાર ખ્રી અને પુરુષો મોટા સમુહમાં લેગા થયા હતા. પૂજયશ્રીનું મહોત્સવ સહૃત સામૈયુ થવાનું હતું. તેને માટે સર્વ તૈયારી થઈ જતા



અતિશ્રદ્ધા ભીજાલાલ

શાસન પ્રેમી આત્માઓએ લભ્ય સામૈયુ કર્યાં. ધર્મ પ્રેમી આત્માઓને ઉત્સાહ અજ્ઞબ અને આક્ષર્ય-કારી હતો. અને અન્ય સમાજ પણ જણે પોતાના ધર્મગુરુ આંદ્રા હોય અને જેટલો ઉત્સાહ હોય તેટલો ઉત્સાહ અન્ય સમાજમાં પણ દેખાતો હતો. ઉપરાંત હીંકુ મુસલમાન તમામ વર્ણ પુજયશ્રીનું સ્વાગત કરવા સામૈયામાં આંદ્રા હતા. શહેરનાં મધ્ય લાગમાં થઈ સામૈયુ પસાર થતાં પૂજય ગુરુદેવના દર્શાન કરવા નગરના સ્ત્રી પુરુષો બન્ને હારમાં ગોઠવાઈ ગયા. અને પુજયશ્રીની લભ્ય મૂર્તિના દર્શાન થતાં જ તમામ પ્રજા આચાર્યશ્રીને નમન કરી પોતાના આત્માને ધન્ય માનવા લાગ્યા. પચરંગી પ્રજા સહિત પુજયશ્રીને ઉપાશ્ર્યે લાંદ્રા. ઉપાશ્ર્યના ચોકમાં સમાજ ગોઠવાઈ ગયો ઘોંઘાટ તો અતુલ હતો. સંઘના કુમ પ્રમાણે પ્રતિષ્ઠિત માણુસોએ ઉઠીને પુજયશ્રીના શુણુગાન ગાયનના રાગમાં સલા સમક્ષ ગાઈ બતાંદ્રા. મહાપુરુષોને પોતાના શુણુ સાંલળવાની વિચારણા હેતી નથી. શુણુ સાંલળની મહાપુરુષો ક્ષોલ પામતા નથી. તેમાંજ તેમની મહતા છે. કીર્તિ અને યશાની ઝંખના જો ફુનીયાની જેમ ફુનીયાથી વિમુખ બનેલામાં જન્મે તો ખાદ્ય ત્યાગ શીવાય અંતર ત્યાગ તેમાં રહેતોજ નથી. અને

આચાર્ય શ્રી કલ્યાણુચંદ્રજી મહારાજનું જીવમચરિત્ર.

અંતર ત્યાગ ન હોય તો હુનીયામાં અંતર ત્યાગી હૃદાડવા અનેક દંલ કરવા પડે અને પછી અસ્ત્યનીજ પ્રરૂપણામાં જીવન સમાસ થાય. આત્માને ઠગી હુર્ગતિમાં જવાય. અસ્તુ.

યશ અને કીર્તિની લાલસાને તોડી પુન્જ્યશ્રી સુરતમાં આવ્યા; ભક્તા હૃદયોએ ભક્તિ ખતાવી. ભક્તા હૃદયને ભક્તિ ખતાવ્યા વગર ચેન પળુન પડે. અને તેથીજ ભક્તિ એજ ભક્તોનું જીવન હોય છે. તફાનુસાર ભક્તિવાન આત્માએ પોતાની પુન્જ્યશ્રી ઉપરની ભક્તિ ખતાવનારા વાક્યો. ખાલી કર્યા. ત્યાર પછી પુન્જ્યશ્રીની દેશના સાંલળવા સમાજ શાંત થયો. નવકારમંત્રથી ગ્રેરક વાણી વડે મંગળાચરણ કર્યું કે લાઈએ મોટા સમુહમાં તમો લેગા થઇ માર્દ સ્વાગત કર્યું તે તમારી અંદર રહેલી ધર્મ ભક્તિ છે. ભક્તિ એ ઉત્તીનું લક્ષણું છે છતાં મારા આ દેહનું સ્વાગત કરી તમારા આત્માને ભુલો તે નહી ચાલો. મારી જેમ તમારી અંદર રહેલી આત્મ શક્તીને જગાડી સત્કાર કરો. માનવ જીવનનું ધ્યેય તે સીવાય ખીણું ન હોય. ચાતુરમાસના કાળમાં ધ્યેયની પુર્ણતા કરવા પ્રયત્ન કરવાનો છે. આત્માને ચોગ્ય માર્ગમાં લઈ જવા સીવાયના ધ્યેયમાં હૃન્યવિ ધ્યેયને સિદ્ધ

વડોદરામાં આચાર્ય પદ અને વિહાર.

કરવા તમારી આંતરિક શક્તિઓ વેડશ્રી નાગશો તો માનવ જીવન ગુમાવશો અને હુણમાં પડશો. પુર્વના મહર્ષિઓનો પુરુષાર્થ આત્માની સુક્રિયા માટેજ હતો. તીર્થપતીઓએ પણ પુર્ણત્વ દર્શા પ્રાપ્ત કરી આત્મકલ્યાણને માટે જગત સમક્ષ ધર્મની સ્થાપના કરી છે. તે મહાત્માઓએ અનુભંગું કે જોગોમાં આત્માની શાંતિ નથી. જડમાં આત્માને કચાંય સુખ નથી. જીવિત ચંચળ છે. કર્મના ઇણ જોગંયા વગર ચાલે તેમ નથી. કુકર્મના ભાવ કરવા છે. હુષ્ટ વાસનાને અનુસરવામાં આત્મહાની છે. જ્ઞાનીઓએ અનુભંગું માટે ભાઇઓ યોગ્ય કિયામાં તમારા આત્માને જોડી સંસારના મૂળને નાશ કરો. આત્મવિકાસમાં જાતીનું બંધન નથી. કોઈ પણ જાતીને આત્મવિકાસ કરવાનો અધિકાર છે. અરહત ધર્મ આપા વિશ્વનો છે. વિશ્વધર્મ છે તેમાં સર્વેને સ્થાન છે. અમે સાધુ બન્યા એટલે આત્મવિકાસ થયો એમ પણ ન માનશો. કારણ વેશ પરિવર્તનની સાથે હૃદયનું પરિવર્તન થવું જ જોઈએ. અને તેથીજ અરહત ધર્મ જ્ઞાન અને કિયા બનેની સહાય સ્વિકારે છે. માટે તમે પણ જાન અને કિયાથી ગુણું સ્થાનકની શ્રોણી ઉપર આત્માને ચઢાવો. રચનાત્મક રીતે તૃષ્ણાનો નાશ કરો. મન

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત.

એજ બંધ અને મોક્ષનું કારણ છે. વિકાસ એ હુર્દાલ છે. અને પતન એ સુલભ છે. એક વાર પતન પામેલો આત્મા ઠૈઠ નીચે પડે છે. આ મનુષ્યલવમાં તમોને પ્રાપ્ત થએલા સાધનો જેવા કે ધન, કુદુંણ, પુત્ર, ભાર્યા વગેરેનો મોહ આત્મામાં આસક્તિ ઉત્પન્ન કરે છે. આસક્તિ તે લવની પરં-પરા ચાલુ કરે છે માટે આસક્તિ ઘટાડવા ગમે તેવી કઠીનમાં કઠીન તપશ્ચિર્યા કરીને પણ લવોલવથી વારસામાં મળેલા, અને જીવનના અણુએ અણુના સંસ્કારમાં જડાએલા, આસક્તિ અને અજ્ઞાન; તેને નીવારવા પુરુષાર્થ ચાલુ કરો. લોગોની રમતમાં આત્મા બંધાશે. ત્યાગની રમતથી આત્મા છુટશે. લોગની લુણધતાએજ આત્મા પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયો છે. આત્માનો સહજ સ્વલાવ જાન, દર્શાન, અને ચારિત્ર, તેના ઉપર આવરણું આવ્યા છે. જેના પ્રતાપે આત્મવિકાસ અટક્યો છે. ઘર ભુલેલા માનવીને હુની-યાના કેાઢ પણ ઘરમાં કુદુંણી તરીકે જેમ આશ્રય મળતો નથી અને હુણ અનુભવ કરે છે તેમ આત્મા પોતાના સ્થાનથી પતિત બની અન્યત્ર પરિભ્રમણું કરી રહ્યો છે. ત્યાં સુધી આત્માને કયાંય સુખ અને શાંતિ મળશે નહીં. માટે લાઈઓ. એવી પ્રવૃત્તિનો આદર કરો કે સ્થાનભ્રષ્ટ થએલા આત્માને પોતાનું સ્થાન પ્રાપ્ત

વડોદરામાં આચાર્ય પદ અને વિહાર.

થઇ જય અને હુઃખમાંથી છુટી જય. આત્માની સત્તા જ્યાં સુધી આવી નથી ત્યાં સુધી લવનું પરિભ્રમણું પણ હુર થતું નથી. તમારાજ અનુભવથી સાળીત થયું છે કે અત્યાર સુધી આત્મા ઉપર વિષયોનાં એર ચઢાવી ઊરમય સ્વભાવ કરીને જ ઉજ્ઞતિનો અવરોધ કર્યો છે. કાચના મકાનમાં ગચ્છેલો કુતરો પોતાનું સ્વરૂપ જોઈને જેમ હુઃખી થાય છે તેમ તમારો આત્મા પણ સ્વયં હુઃખ ઉમજ કરી બીજા ઉપર હોષ ચઢાવી મુકે છે. માટે લાઇઓ રચનાત્મક પ્રવૃત્તિ કરી આત્માને જગાડો જે સુધુમ દશામાં રહી પોતાની શક્તિનો નાશ કરી રહ્યો છે. પોતાના આત્મધનને કોધ, માન, માયા, વીગેરે લુંટારા લુંટી જય છે તેને અટકાવવા માલિકને (આત્માને) જગાડો. જ્યારે તમારો આત્મા જગશે ત્યારે હુનીયાની આસક્તિ છુટશે. આજે તમારામાં ખોટી રીતે મારાપણુંની ભાવના પોષાઈ રહી છે. તેનો નાશ કરો. હું અને મારું જ્યાં સુધી નાશવંત વસ્તુઓમાં છે ત્યાં સુધી તમારા સમસ્ત હુઃખો જીવતા છે. કારણું, એક વસ્તુમાં મારા પણુંની ભાવના આવતા જ આસક્તિનો જન્મ થાય છે. અને આસક્તિના જન્મ પછી કુમ પ્રમાણે તેની પરંપરા દ્વારા હુઃખ હુઃખો આવવાના છે તેમાં પણ હુન્યવી આત્માઓના હુઃખનું મોટું કારણ તેઓનાં

કૃત્યો નથી; પણ કૃત્યોની પછવાડે રહેલી આસક્તિ છે. આસક્તિથી મમતાપૂર્વક કર્મ કરવામાં આવે તોજ તેનાથી ઉદ્ભવ થનારા હુઃખો કરતા તે બહુ જ હુઃખીત અવસ્થામાં લોગવવા પડે. દ્વારાંત તરીકે કોઈ પણ મનુષ્ય નિરાધાર હોય તેના આધારભૂત એકનો એક પુત્ર મરણ પામતો જોવામાં આવે ત્યારે તેની સાથે જેનો સંબંધ નથી, એવા તમને કંઈ પણ હુઃખ થતું નથી અને તમને એ પાંચ સંતાન હોય અને સાથે સંપત્તિ પણ હોય એવા વખતમાં એક પુત્રનો વિયોગ થવાનો પ્રસંગ આવે ત્યારે તમને કેટલું હુઃખ થાય ? એકના નાશથી હુઃખ નથી થતું અને ખીણના નાશથી હુઃખ થાય છે. એજ સિદ્ધ કરે છે કે તેમે તમારા પુત્રની સાથે જે મમતા ઝૂપ અદ્યાસ બાંધ્યો હતો તેવો અદ્યાસ ખીણના પુત્રની સાથે નહોતો બાંધ્યો. તેથી જ તમારા પુત્ર પરની આસક્તિને અંગેજ તમારા ઉપર હુઃખોનો પહુાડ ખડકાયો. માટે જ જ્ઞાનીઓએ કહ્યું કે સંસારી આત્માઓના હુઃખનું મૂળ આસક્તિ છે. અને આસક્તિ જન્મી તો સૃષ્ટિની જાળ તૈયાર થઇ. મોહવશાત તેમાં શુંથાવવું જ પડે માટે લાઇએ આસક્તિને તોડવા કૂળની આશા રાખ્યા વગર નિષ્કામ કરેા. મારાપણુંની છાપ તમારા કોઈપણ

કર્ત્વબ્યમાં ન લાવો. એથી જ સ્વ અને પરલોક સુધરશે.
 વીરના શાસનમાં જન્મી તેના જ પગલે ચાલી
 આધ્યાત્મિક શ્રેણી ઉપર આત્માને ચઠાવવા પ્રયત્ન
 કરી સૈા આત્માનું કલ્યાણ કરે. વાંચક ! ત્યાર પછી
 પુજયશ્રીએ સર્વ મંગલ માંગલ્યમ કહી પ્રવચન પૂર્ણ
 કર્યું. ભાવિક આત્માએ કે જેએ સમયનું લાન
 લુલી પ્રેરક વાણીથી સુંધ થધ સાંભળવામાં તહ્વીન
 બન્યા હતા, તેએ એક પછી એક વીખરાયા. રસ્તે
 ચાલતા પણ વ્યાખ્યાનની જ વાત. ખીન હીંસે
 પણ સાંભળવાની ઉત્કંઠા હેખાઈ રહી હતી. વ્યા-
 ખ્યાનનો ટાઈમ સવારના સાડા છ થી સાડા નવ
 સુધી રાખવામાં આંદોલાનો હતો. અને તે ટાઈમમાં
 ચાતુરમાસ દરમીયાન ચર્ચાત્મક વીખયોને છણી ફરેક
 મનુષ્યોની શાંકાએનો સચોટ જવાબ આપી સાચુ
 શાન, સાચો માર્ગ, અને સાચી હીશા લોકોને બતાવી.
 આ પ્રમાણે ઉત્સવ સહીત પુજયશ્રીનું આચાર્ય પદ
 ઉપર આંદોલાનો પછી સુરતનું પહેલું ચાતુરમાસ પૂર્ણ કર્યું.



મુંખદમાં પ્રવચન

સુરત મુકમેથી પુજ્યશ્રી ચાતુરમાસનો કાળ પૂર્ણ કરી ઉઠ્યા. વિહારક્કમ યોજ મુંખદ તરફ વિહાર પ્રદેશ નક્કી કરી યતિવર્યો, શિષ્યો. અને ભાવિક આત્માઓ! સાથે વિહાર કર્યો. મુંખદનો માર્ગ લીધો. રસ્તામાં આવતા ગામોમાં યોગ્યતા મુજબ નિવાસ કરતા શાસનપ્રેમી આત્માઓના હૃદયમાં જ્ઞાનનું સીંચન કરતાં અન્ય ધર્મિઓના સ્થાનમાં નિવાસ કરતાં કરતાં મુંખદ તરફ શ્રી સંધની આચર્હ ભરી વિનંતિથી અને રસ્તામાં મુંખદ શ્રીસંધના આગે-વાનો પુજ્યશ્રીને ચાતુરમાસ માટે લઈ જવા આપ્યા. શ્રી સંધના અત્યંત આચર્હથી મુંખદનું ચાતુરમાસ પુજ્યશ્રીએ નક્કી કર્યું અને અશાડ શુદ્ધ ૧ ને હીવસે

પુજ્યશ્રી પરિવાર સાથે મુંબદ્ધ નગરીમાં પધાર્યા. ધર્મિ આત્માએ મોટા સમુહમાં લેગા થઈ સામૈયા સહૃત પુજ્યશ્રીને ઉપાશ્રીયે લાવ્યા.

વાંચક ! આજથી ઉત્ત વર્ષ પૂર્વે ની આ લક્ષ્ણ આજે કેમ હેખાતી નથી ? તે વખત જેવી સુયોગ્ય લાગણ્ણીએ જનતાના હૃદયમાંથી કેમ ઉડી ગઈ છે ? તે વખતની ધર્મ શ્રદ્ધા આજે કેમ મૃતઃપ્રાય થઈ ગઈ છે ? સંસ્થાએ પણ કેમ નિર્ભળ પડતી જાય છે ? સમાજ વ્યવસ્થામાં પણ ખામી હેખાઈ રહી છે. અત્યારના જેટલા તે વખતમાં નહોંતા આડંખરો, તેમજ ધર્મના ઉત્સવો ઉપધાનો વીગેરે નહોંતા છતાં ધર્મનો મહીમાં ચારે તરફ પ્રસરતો આજે કેટલાએ ધર્મગુરુએ તરફથી ધર્મિકિયા કરવાનું દખાણું કરાય છે. છતાં ધર્મ પ્રચાર પહેલા જેવો નથી. કિયાની અલિઝીવાળો અજ્ઞાન વર્ગ અત્યારે કેટલાએ પ્રદેશમાં છે જે ઇકત સમજણું વગર કિયાજ કરી પોતાને ધર્મી કહેવડાવી આનંદ માની રહ્યા છે. વાંચક ! આમાં બન્નેનો સમાવેશ છે. દીક્ષીત વર્ગ અને અહસ્થ વર્ગ, જે હીક્ષીતમાં વિક્રતા ન હોય તે પોતાના ઉપવાસ વીગેરે કિયાએના હૃથીયારથી સમાજને આંજવા પ્રયત્નો કરે, અને ધર્મની ઉત્સવતા હેખાડે. છતાં પણ પૂર્વ જેટલી ધર્મશ્રદ્ધા

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત.

તો નથીજ. અને આવી હિયા કરવામાં અને શ્રાવ-
કેની પ્રશંસા સાંભળવામાં તહીન રહેતા દીક્ષીત
વર્ગો ઉપર પણ પૂર્વના જેટલો પૂજયલાવ નથીજ.
પૂર્વનું બંધારણું લગભગ એક હતું. અને સમાજ
પણ એક હતો. અને તેથીજ ધર્મનો પ્રચાર પણ
સુંદર થઈ શકતો. અને સુનિવરોનો ઉપરેશ પણ
રાગ રહીત હતો તેને અંગે તેઓની પૂજયતા
વધતી અને આજના વાતાવરણમાં સમાજના કેટ-
લાએ આત્માઓના હૃદયમાંથી ધર્મ ઉપરની શક્તા
ધર્મના ખોટા આડંખરોથી ધરી છે અને સાથે
ધર્મગુરુ પ્રત્યેનો પૂજયલાવ તેમની ખોટી સત્તાના
ઉપરોગથી ઓછો થયો છે. ગરૂડમવાદ જેને કહે
છે તેના ઉપરોગથી સમાજ પણ અંદરખાનેથી
ત્રાસી ગયો છે. તેજ ગરૂડમવાદીઓ ચાતુરમાસ
રહે તે પહેલા નક્કી કરાવે કે અમારે માટે આટલો
ખર્ચો કરો તોજ અમારું ચાતુરમાસ થઈ શકશે
અને અમારું કહેવું પણ તમારે માન્ય રાખવું પડશે
આવા અનેક પ્રકારના પ્રયોગોથી ચાતુરમાસ રહીને
શ્રીમતોને હુથા બનાવી પોતાની નામના માટે
પોતાને ડોળ ચલાવે અને ત્યાંથી પણ આગળ,
વાંચક ! અત્યારના સમાજના ભાગલા તેમની ઊરીલી
જીલના ઉપરોગથી જ પડ્યા છે. સમાજની છીન

લિન્ન દશા પણ તે ગરૂડમવાહીઓના પ્રતાપથી જ થઈ છે. પોતાનું વચન કોઈ ન માને એટલે ગમે તે પ્રકારે તેને ઉતારી પાડી જનતા સમક્ષ તેને ખુલ્લેલો કરવા ઉપરાંત તેની અનેક પ્રકારે ટીકા કરી હુલ્કું ચીતરતા વાર ન લગાડે. બીજુ તરફ પોતાની સર્ચચાઇનો ડેકો વગાડવા તે ગરૂડમવાહીઓ પાના-ઓના પાના ભરી છપાવે. પરીણુંમે જૈન ધર્મને પાળનારા અનેક કુટુંબો ગરૂડમવાહીઓના પ્રતાપે અન્ય ધર્મમાં ચાલ્યા ગયા છે. અને તેને અંગે જૈન સમાજનો સામાન્યવર્ગ પણ દીક્ષીતના નામથી ભડકી રહ્યો છે. વાડાઓની મજબુતાઇ અને તે મજબુતાઇને અંગે અંદર અંદરના કલેશોની હોળી સળગાવવા રૂપ નિમિત્ત પણ તે ગરૂડમવાહીઓ જ છે. અને તેના પ્રતાપે ધર્મગુરુઓની લક્ષિત તેના અંદર રહેલી પુન્યભાવના પણ ગરૂડમવાહીઓની નાહીરશાહીથી જ ઓછી થઈ છે. અને તેથી જ સમાજનું અધ્યપતન ચાલુ રહ્યું છે. વાંચક ! સુંબદ્ધ નગરીમાં તો ગરૂડમવાહીથી લિન્ન જેનું માનસ છે તેવા પુન્યશ્રી આઠ્યા અને તેથી જ તેમના સામૈયામાં ઔક્યતાના દર્શન થતા હતા, અને ત્યારપણી અનુકૂળે પુન્યશ્રીને સુંબદ્ધના પુરાણા ઉપાશ્રયમાં લાઠ્યા. અગાઉિત સંખ્યામાં નર નારીઓ લેગા

ધ્યા હતા. પુન્યશ્રીની અમૃતમય ધર્મ દેશના સાંલળવા મેદની શાંત થઈ ગઈ અને પુન્યશ્રીએ શરૂઆત કરી. આજે તમો મોટા સમુહમાં લેગા થઈ મને અહીં લાવ્યા. દરેકના આ સામૈયામાં હાજરી આપવાના કારણો લિખ લિખ હોય છે. કેટલાય લક્ષિતથી આવ્યા હુશે. કેટલાય ઉપદેશને વાસ્તે આવ્યા હુશે. કેટલાય ધમાલ જોવા આવ્યા હુશે. કેટલાય કુતુહલ કરવા આવ્યા હુશે. આમ દરેકનું ધ્યેય જુદું હોય છે. વાસ્તવિક રીતે આ ધર્મસ્થાનમાં આવ્યા પછી દરેકનું ધ્યેય એક હોવું જોઇએ. ઉપાશ્રયમાં આવે અને તમારામાં રહેલી અજ્ઞાનતા, જડતા, સંકુચીતતા નાશ ન થાય અને વિકાસનો કમ ન આવે તો આ ઉપાશ્રયમાં આવવાનો કંઈજ હેતુ નથી. ભાઈએ આજ ઉપાશ્રયના સ્થાનમાંથી આત્મવિકાસનો માર્ગ અહૃતું કરી શકો તોજ અજ્ઞાનતાની પ્રણાલિકા પણ બંધ પાડી શકશો. વિકાસના એ માર્ગ છે. શાસન સેવા અને સમાજસેવા. આ એજ કર્તાઓ મનુષ્ય જીવનના છે. સમાજસેવા કરી પોતાનામાં રહેલી તુટીએને પુર્ણ કરો. સામાજિક જીવનમાં રહેલી નણળાઈએને ઝગાવી દો. સમાજમાં રોગ લાગુ ન પડે તેનો યત્ન કરો. અને રહેલા રોગને નાખું કરવા નીડરતા

પ્રાસ કરેા. કાંતીની ચીખુગારીએ પ્રગટાવે અને તેની જ્યોતમાં રોગના કીડાને બાળી નાંખો. અને તેમ કરતાં જુનવાણી વીચારના પુરુષોના શાખદ પ્રહારો, ટીકા અને ઉપાલંબોને સાંભળી સહન કરવાની શક્તિ પણ ઉત્પન્ન કરેા. જ્યાંસુધી સામાજિક જીવનમાં સડો છે ત્યાં સુધી શાસન સેવા કરી શકવાના નથી. સંપૂર્ણ સેવા ન કરી શકો તો સેવાના સાધનમાં જેટલા સાધનો સેવામાં લઈ શકતા હો તેટલા સાધનોને સેવાના ઉપયોગમાં દ્યો. શ્રીમંતો ! તમો ધનથી સેવા કરેા, તમારા ધનનો ઉપયોગ એકારીની ચક્કીમાં પીસાતા તમારા સધમી ભાઇએને બચાવવા ઉપયોગ કરેા. એકારીની કીકીયારીએથી તમારો જૈન સમાજ બચ્યો નથી. એકારીના વાતાવરણુમાં સમાજનો બાર આની લાગ છે. તે એકારો પણ તુટેલા ખાટલામાં રહી લુંઢની જેમ પ્રજોત્પત્તિ કરી લીખારીએ અને ગુલામો ઉત્પન્ન કરવામાં પાછા પડતાં નથી. વાસના તારું ખપર કેવું છે. જ્યાં અજ નથી, ભીખ માગતા પેટ ભરાતું નથી. ત્યાં પણ તારે અધીકાર છે. શ્રીમંતો ! સુવર્ણમય ભારતભૂમિમાં આજે અજને માટે હાહાકાર છે. તે જરા આંખો ઉધાડી જુઓ, અને તમારા ધનથી એકારીના ત્રાસમાં કંટાળી ધર્મપલટો કરતા તમારા ભાઇએને બચાવો.

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

તન, મન અને ધન ત્રણેંના ચોગમાં જેનાથી તમે મદ્દ આપી સેવા કરી શકતા હો તેનાથી સેવા કરી શાસન સેવા કરવા પણ તૈયાર થાઓ. તમારા શાસનની કેવી ફુર્દ્દીશા થઈ રહી છે તેનો ખ્યાલ કરો. જેના ઉપર શાસનનો આધાર છે તે યતી વર્ગ પણ ઓછો થતો જય છે. તેને વિસ્તૃત બનાવવા પ્રયત્ન કરો. જે યતિવર્યોએ તમારા શાસનને ટકાવવા અને સમાજને બચાવવા અગણીત પ્રયત્નો કરી પોતાનું જીવન સમર્થ્યું તેને મજબૂત બનાવવા પ્રયત્નો નહીં કરો તો જણો કે તમારો વિનાશ નાણક છે. શ્રીમાનો! તમારી નિંદા અવસ્થાનો સમયસર ત્યાગ નહીં કરો તો યાદ રાખો કે તમારો મૃત્યુધંટ વાગ્ની રહ્યો છે. વિનાશના પડકંદા બોલી રહ્યા છે. કુમસર અત્યાર સુધી જૈન સમાજનો વિનાશ ચાલુ રહ્યો છે. તે અટકવો પણ અરાક્ય છે. રોગવાળો મનુષ્ય જ્યાં સુધી રોગ હોય જ્યાં સુધી જેમ બળવાન થઈ શકતો નથી તેમ શાસન અને સમાજમાં અનેક રોગ દાખલ થયા છે. તે રોગોનો નાશ કરવા જેસ લેર પ્રયત્નો શરૂ કરો. એમાજ તમારી ઉજ્જીવિની શ્વાસ છે. વાંચક! ધ્રુવા ટાઇમ થઈ જવાથી પુન્ય-શ્રીએ સર્વ મંગલ માંગલ્યમ કહી સમાસિ કરી. અસીમ વાગ્દ્ધારા વડે સર્વ સમાજ ચકીત થઈ ગયો.

મુંબદી પ્રવચન.

સમુદ્ધાય વર્ગ પોતાની બુદ્ધિ અનુસાર પુજયશ્રીના વચનો ઉપર વિચાર કરતા સૌ ધરે ગયા. આવી રીતે પુજયશ્રીના વ્યાખ્યાનો પ્રભાત કાળે દરરોજ ચાલતા. જાહેર વિષયો ચર્ચી લોકોમાં ઉત્સાહ લાવતા હતા. અનુક્રમે પુજયશ્રીના મુંબદી થએલ પ્રવચનો સમાજના શ્રોતા ગણોના હૃદયમાં અંકિત થઈ ગયાં.



પ્રેતાદિક ઉપદ્રવો અને અન્યત્ર ચાતુરમાસ

વાંચક ! મુંબદ્ધના પુરાણા ઉપાશ્રયમાં પુજ્યશ્રી ચાતુર્માસ આઠ્યા તેજ રાત્રીના ઉપાશ્રયમાં પ્રેતને ઉપદ્રવ છે એમ સમાજનું માનવું હતું. તે પ્રમાણે પુજ્યશ્રી રાત્રીના જ્યારે ધ્યાનમાં એડા ત્યારે તે પ્રેત કે જેનું સ્થાન ઉપાશ્રયમાં વરસોથી હતું તે પુજ્યશ્રી આગળ આવી અનેક પ્રકારના ઉપસર્ગો ધ્યાનથી ચલાયમાન કરવા માટે કરવા લાગ્યો. પુજ્યશ્રી તો નીડર હૃતા એટલે લય રહિત એવા પુજ્યશ્રીને તે પ્રેત કંઈજ ન કરી શક્યો. ત્યાર પછી પુજ્યશ્રી આગળથી નીકળી પુજ્યશ્રીને છડીદાર જ્યાં સુતો હતો ત્યાં આવી તેને પગથી પકડી ઓરડામાં ખુખ ફેરંયો. ખુમ પાડતો પાડતો માંડ માંડ પ્રેત આગ-

શિકુંદરખાન તરફથી મળેલો પરવાનો



Alfredo Stroessner
28th March 1894.

28th March 1874.

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
كُلُّ حَمْدٍ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَلَا إِلَهَ إِلَّا هُوَ
وَلَا يَشْرِيكَ لَهُ فِي كُلِّ شَيْءٍ وَإِنَّمَا يَنْهَا
عَنِ الْمُشْرِكِينَ مَنْ يَتَوَلَّهُ فَأُولَئِكَ هُمُ الظَّالِمُونَ
وَمَنْ يَتَوَلَّهُ فَأُولَئِكَ هُمُ الظَّالِمُونَ

فیض میرزا
میرزا فیض
میرزا فیض میرزا

॥ राधालवागुजन्वानावाजमीदारकाकुजं वर्गे देस्मत्तरं
जोगे अप्रस्तुलोकागच्चानाश्रीपुण्डित्वद्भूर्जीशीक्षीतरी
सेयुजरामकेजयेजाता श्रीहामीथाहस्त्वाव्याप्तिणमह
कषणकेसाथस्तोमारगमेकोर्णिख छावीवेअणकरार
कीजेष्ठीक्षिआप्त्विआपीस्तीमदारं सुअद्वृताद्वाचातासेप्तु
चावीर्गिनारागन्धेजेट्वोकीपोरतोपुनीजावीतोनावजो
वीष्टस्याथवालके उपरी बाकीकाद्याप्तमेवजेर
प्रौद्योगिपूपास २० गान्धीजीर
कर्त्तव्यकुनेत्सद्गारात्मारवच्छुट्टुमान्त्रि
देव

જથી છુટી રાત્રીના સમયમાં પુન્જયશ્રી આગળ આવી ધુજતો થર થર કાંપતો કહેવા લાગ્યો કે કોઈ અદ્રષ્ટ પ્રેત મને હેરાન કરે છે. મને બચાવો નહીં તર હું ભરી જઈશ. દયા ચુક્ત એવા વચન સાંલળી પુન્જયશ્રીએ પોતાની આત્મશક્તિ દ્વારા તે પ્રેતને જ્યાં તેનો નીવાસ હતો, ત્યાં આવી કલ્યું કે, તારે પાસેના આડમાથી કોઈ હીવસ બણાર ન નીકળવું. એવી આજા કરી. આ આજાને માન આપતો હોય તે પ્રમાણે, તે પ્રેત આડમાં ચાલ્યો ગયો. અને લ્યારપણી કોઈ હીવસ બણાર નીકલ્યોઝ નહીં. પ્રેતના ઉપસર્ગને નાશ કરી જનતાની ખીકને હુર કરી પુન્જયશ્રીએ મુંબદ્ધનું ચાતુર્માસ પુર્ણ કર્યું. સંઘની રણ લઈ ત્યાંથી વિહાર કરી ધર્મનું સીંચન કરતા દરેક સ્થળે સત્કાર પામતા વીરમગામ શ્રી સંઘની વિનંતીને માન આપી સંવત ૧૯૨૧ નું ચાતુર્માસ કરવા વીરમગામ સુકામે પધાર્યો. ત્યાં પણ પુન્જયશ્રીના ધાર્મિક પ્રવચનો શ્રવણ કરવાથી બીજા ગામોની જેમ વીરમગામનો સમાજ મુગધ બન્યો. ૧૫૦ ધરની સંખ્યામાં રહેલા જૈનો તથા અન્ય કોમ વ્યાખ્યાનનો અત્યુત્તમ લાલ લેવા ચુક્તા નહીં. કુમસર ત્યાંથી પણ પુન્જયશ્રી ચાતુર્માસ પુર્ણ કરી વિહાર કરી વડોદરા તરફ આવ્યા. વડોદરા શ્રીસંઘે

ચાતુર્મસ માટે હઠ કરવથી સંવત ૧૯૨૨ નું ચાતુર્મસ વડોદરા સુકામે રહ્યા ન્યાં જૈન ધર્મને પાળનારી ભાવસાર જાતી છે. ધર્મની શ્રદ્ધા ધણી જ છે છતાં સુક્ષમ તત્વોને નહી જાણુતા તેઓમાં પુન્યશ્રીએ ચાતુર્મસના કાળમાં તત્વોનું ખીજ આરોપણ કર્યું. અને ભાવસાર જાતીને રંગાટનો ધંધો જે ધંધામાં અનંત હિંસા છે તે ધંધો ચાતુર્મસમાં ન કરવો એવી પ્રતિજ્ઞાએ અપાવી. આ પ્રમાણે ધર્મ શ્રદ્ધાળું એવી ભાવસાર જાતીએ હર્ષ સહિત પુન્યશ્રીનું ચાતુર્મસ કરાયું. ચાતુર્મસ પુર્ણ થએ ત્યાંથી ખંલાત, ખોરસદ, વસો, ઐડા વીગેરે સ્થળોએ કે ન્યાં વડોદરાની જેમ નાના મોટા સમુહમા ભાવસારનીજ જાતિ છે અને જેઓ સમાદૃ અકળરના વખતથી જૈન ધર્મી છે ત્યાં પુન્યશ્રી શૈવાકાળ પધાર્યો. ધણુજ લક્ષ્મિભાવથી પુન્યશ્રીને રાખ્યા. ત્યાંથી પાછા ફરતા વડોદરા શ્રી સંધની ખીજ ચોમાસાની અત્યંત માગણી અને વિનંતીથી સંવત ૧૯૨૩ નું ચાતુર્મસ કરવા પધાર્યો. તે ચાતુર્મસ પણ ધણુ મહેતસવ સહીત થયું. ચાતુર્મસ પુર્ણ થયા પછી માગશર માસમાં શ્રી સંધના ધણુજ આથહુથી સ્વ. પુન્યાચાર્ય શ્રી ખુખ્યચંદ્રજીને તથા અન્ય શિષ્ય વર્ગને દીક્ષા

મુંબધમાં પ્રવચન.

આપવામાં આવો. પહેલા ચાતુર્માસ કરતાં આ ચાતુર્માસ ધણ્ણાજ આનંદથી પસાર થયું. ત્યાંથી પુન્જયશ્રી, ખુખ્યંદળ આદિ શિષ્ય વર્ગને સાથે લઈ સંવત ૧૯૨૪ નું ચાતુર્માસ કરવા કુંડલા મુકામે પધાર્યા. વીસા અને દસા એમ એ જ્ઞાતીમાં વહેં-ગાએલો સમાજ ત્યાંનો ધણ્ણાજ ભક્તિવાળો છે. ત્યાં પુન્જયશ્રીનું ચાતુર્માસ પણ તેઓએ ધણ્ણાજ ભક્તિલાવથી કરાયું. ચાતુર્માસ પુર્ણ થયા પછી પુન્જયશ્રી વિહાર કરી ત્યાંના પરગણુંના નાના ગામોમા વીચરી સંવત ૧૯૨૫ ના ચાતુર્માસની વિનંતી જુનાગઢ શ્રી સંઘની આવતાં ત્યાં પધાર્યા. કુંકી સંખ્યા હોવા છતાં ભક્તિ કુંકી નહોટી. એટલે ભક્તિ તો ધણ્ણીજ હતી. પુર્ણ ઉત્સાહથી જુનાગઢમાં ચાતુર્માસ પુર્ણ કરી ત્યાંથી બીતખા, વીસાવદર, લલગામ, ભાંડેર વીગેરે નાના મોટા તમામ ગામડાઓમાં વીચરી સંવત ૧૯૨૬ નું ચાતુર્માસ કરવા વેરાવળ પધાર્યા. ત્યાં ઓસવાલ અને શ્રીમાલી એમ એ જ્ઞાતિમાં સમાજ વહેં-ગાએલો છે. અને ત્યાંની ઓસવાલ જ્ઞાતિ ધણ્ણીજ શ્રદ્ધાવાન છે. સંઘનું અથપદ પણ ઓસવાલ જ્ઞાતિમાં છે. ત્યાં પ્રણાલીકા પ્રમાણે ચાતુર્માસ પુર્ણ કરી ઉપરના ગામડાઓમાં શેષાકાળ વીચરી માંગરેણ

આચાર્ય શ્રી કલ્યાણુચંદ્રજી મહારાજનું જીવનચરિત.

શ્રી સંધની વિનંતીથી સંવત ૧૯૨૭ નું ચાતુર્માસ કરવા માંગરેણ મુકામે પધાર્યા. ચાર મહીનામાં ધર્મ તેમજ વ્યવહારોક વિષયો જનતાને સમજાવ્યા. ધર્મચર્ચાએ કરી. પોતાના મનની શાંકાઓનું સમાધાન કરી ધર્મી આત્માએ પુન્યશ્રીને ધણોજ લાલ લઈ પોતાને ધન્ય માનવા લાગ્યા. આ ઉપદેશ અને આ ગુરુદેવ વરસો વરસ મળવા મુશ્કેલ છે એમ માની લાવિક આત્માએ દરરોજ પુન્યશ્રીને ઉપદેશ અને દર્શનનો લાલ લેવા ચુક્તાં નહીં. બીજા ગામોની અપેક્ષાએ ત્યાંના સ્વી પુરુષોમાં પ્રકરણ તેમજ સુત્રોનું સાર્થક જ્ઞાન હતું તેથી ત્યાં પુન્યશ્રીએ અમોઘ તર્વજ્ઞાન અને સુત્રોના ગુણાર્થી અત્યુત્તમ શૈલીથી સમજાવ્યા. અતુલ જ્ઞાન અને પ્રલાવથી લોકોમાં પણ લક્ષ્ણિતના પુર ઉછબ્યાં. સામાન્ય જનતા દરરોજ વ્યાખ્યાન સાંભળી મનનું નીરાકરણ કરવા અપોરનો ટાઈમ ધાર્મિક ચર્ચામાં પસાર કરતા. આવી રીતે પુન્યશ્રી માંગરોલનું ચાતુર્માસ પૂર્ણ કરી ત્યાંથી પાસેના ગામોમાં વિહાર કર્યો. ગામડે ગામડે કુરી સમાજને જ્ઞાન અમૃત પાતાં જીવનને સાદાઈમાં જડી દેશ પ્રેમ શીખવતા દરેક સ્થળે રાઠ્ય અને ધર્મના ઉજ્જીવિનો નાદ પોકારતા. વાંચક ! લખવાની જરૂર નથી કે એમના વખ્તો જ દેશ પ્રેમનું ભાન કરાવે

એવા હતા. દેશી શાલ અને ખાદી શીવાય ખીજુ
વસ્તુ જેમના ઉપર ન હતું. ખાદી પહેરીને જગતના
મનુષ્યો સમક્ષ લોહીવાળા હિંસાત્મક વસ્તોનેા ત્યાગ
કરી શુલામીમાં પડી રહેલી ભારત માતાને છોડાવવા
અહુલેક જગાવતા. વાંચક ! સાચા સાધુ યા યતિને પણ
હિંસા વગરના વસ્તો પરીધાન કરી હિંસાથી વ્યામ
એવા વસ્તોનેા પહેરવેશ સહંતર બંધ કરવા પોકાર
કરવો જોઈએ. પણ એજ દીલગીરી છે કે સંસારીએ
વીલાયતી વસ્તુ અને બારીક વસ્તુ વગર જાડા વસ્તોથી
પોતાનું જીવન ચલાવી શકે પણ દીક્ષીતો વીલા-
યતી જીણું વસ્તો શીવાય ચલાવી ન શકે. જે વસ્તોમાં
અહિંસાનો સીઙ્હાંત સચ્ચવાતો નથી, મહાવીરનો
આદેશ પણ સંપુર્ણ રીતે પાલન કરી શકતો નથી,
જે વસ્તોમાં ધર્મની હાની સાથે રાષ્ટ્રની હાની છે,
છતાં અહિંસાનો આદર્શ જગત સમક્ષ ધારણું કરતા
પુન્ય દીક્ષીતો વીલાયતી વસ્તોનો મોહ છોડી શકતા
નથી. વાંચક ! ત્યાણી બન્યા છતાં વસ્તો પર મોહ
શો ? જે વસ્તો ઉપર પશુઓનું લોહી છાંટવામાં આવે
જેને માટે ચરણી વાપરવામાં આવે તેવા વસ્તોને
દીક્ષીતોથી અડકાય જ નહી તો પણી પરીધાનતો કેમ
જ કરાય ? હિંસાયુક્ત વસ્તોનો સ્વિકાર એઠલે હીંસાને
ઉત્તોજન તે નાનું બાળક પણ સમજુ શકે, જૈનદ્રષ્ટિએ,

આચાર્ય શ્રી કલ્યાણુચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

કરનાર કરાવનાર, અને અનુમોદનાર, ત્રણેને પાપના ભાગી બનાવ્યા છે. માટે પુન્ય દીક્ષાતોની સાથે સમાજના ચારે અંગો સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવીકાઓએ અપવિત્ર અને હિંસા ચુક્ત વસ્ત્રોને ઝગાવી અહિંસાના સીદ્ધાંતનું ચોગ્ય રીતે પાલન કરવું જોઈએ. પણ સમાજનો એક વર્ગ હૃદાત છે કે જે વર્ગ પોતાના જ સંતાનોને પહેરવા વસ્ત્ર જોઈએ તો આપતા વીચાર કરે, પણ દીક્ષાતોને વીલાયતી મલમલની પછેડી વહેઠાવી પોતાના જીવનને ધન્ય માને. જ્યાં સુધી આવા અપવિત્ર વસ્ત્રો આપનારા ઉદાર પુરુષો સમાજમાં છે ત્યાં સુધી પુન્ય દીક્ષાતો પોતાના અપવિત્ર વસ્ત્રો ત્યાગ કરવાની ક્રરજ સમજવાના નથી. અને બીજને સમજવી શકવાના નથી. પુન્ય ગુરુદેવે તો ખાદીને અપનાવી હતી. વિહાર પ્રદેશમાં વીચરતા ચાતુર્માસનો ટાઈમ નજીક આવતાં સંવત ૧૯૨૮ નું ચાતુર્માસ કરવા દીવ મુકામે પધાર્યો. પુર્વવત ચાતુર્માસ પુર્ણ કરી કાહિયાવાડ પ્રદેશમાં વિહાર કરતા કરતા ધારી, અમરેલી, બગસરા વીગેરે સ્થળોએ કરી સંવત ૧૯૨૯ નું ચાતુર્માસ કરવા મહુવા આવ્યા. ત્યાં દશા તેમજ વીશા શ્રીમાલી એમ એ જ્ઞાતીમાં થઇને શ્રાવકોનો સારી સંખ્યા છે. પુન્ય મહારાજશ્રીએ ભાવિક આત્માઓને પ્રેરક

મુંખમાં પ્રવચન.

વાણીથી સારો ધર્મબોધ આપી ચાતુર્મસ પુર્ણ કરી શોષાકાળ અન્યત્ર ગામોમાં વીચરી સંવત ૧૯૩૦માં ચાતુર્મસ કરવા લાવનગર મુકામે પધાર્યા. ધર્મનો ઉધોત કરાવતા ચાર માસ પુર્ણ કરી સીહેાર પધાર્યા. ત્યાંથી દેવગાણુા, ટાણુા, વરલ, લદ્રાવલ, દુંદસર વીગેરે ગામોમાં વિહાર કરી ત્યાંથી વળા મુકામે આવી દુંક સુદત રહી ઉમરાગા શ્રીસંઘને વંદાવી પાછા સીહેાર પધારી બોટાદ સુકામે પધાર્યા. ત્યાં એક માસ રહી ધર્મોપદેશ આપી કાઠીયાવાડના અન્ય ગામોમાં જવાની વીચારણુા કરવા લાગ્યા.

રાણુપુરમાં તોઝાની પ્રસંગ

વાંચક ! પુજ્યશ્રી એટાહમાં એક માસનો કાળ
પસાર કરી ત્યાંથી વિહાર કરતા પહેલો સુકામ
રાણુપુર કર્ચે. વીશા શ્રીમાલીની જાતીમાં રહેલા
ત્યાંના શ્રીસંઘે ભીંધ સામૈયું કરી “તપસ્તિવના ઉપા-
શ્રે” લાંધા. થોડા દીવસ પસાર થયા. એક દીવસે
એ યતિવર્યો ઠંડીલ ભૂમીએથી પાછા ઇરતા નગરના
મુસલમાનોએ ઉહાપોહ કર્ચે કે અમારા પીરને
કષ્ટસ્તાનમાંથી સેવડા એટલે યતિએ લઈ જાય છે.
ગામના મુસલમાન તાલુકદારોએ સામાન્ય મુસલ-
માનોને ઉશ્કેરી સુકયાં. તાલુકદારોએ હુકમ કર્ચો,
અને અજ્ઞાનતાના પ્રતાપે લોહીના ઉશ્કેરાઈ જવાથી
ધાર્મિક જનુને મોઢું કોલાહલ કરી સુકયું. ધર્મના

∴ ૮૮ ∴

નામે ઈતિહાસમાં આર્ય અને અનાર્ય બન્ને સમાજ અત્યાર સુધી અનેક ખળીદાન આપી ચુક્કાં છે. ધર્મના અનુને અનેક મનુષ્યોનો સંહાર થઈ ગયો છે. ધર્મને માટે કુદુંઘોને કટલ કરીને ધર્મ અનુન સાચયું છે અને તેથી જ અમર બન્યું છે. હુનીયાની તમામ સંસ્કૃતિ કરતા આર્ય સંસ્કૃતિ ઉજવલ છે. જે સંસ્કૃતિને પાશ્ચાત્ય વિદ્ધાનો પણ માનની નજરે જુએ છે. ધર્મ અનુને અનેક જુલમો ધર્માંધ રાજ્વીએઓ પ્રબુ ઉપર ગુણર્થી છે. અને સીતમો જીહન કરીને પણ આર્યોએ આર્ય સંસ્કૃતિ દીપાવી છે. વાંચ્યક ! અહિ તો ધર્મના એક ઘોટા અનુનથી લયંકર સ્વરૂપ ઉપસ્થીત થયું છે, ગામના મુસલમાનો લેગા થઈને “તપસ્વીના ઉપાશ્રયે” ખીરાજમાન થયેલા, આચાર્ય હેવ શ્રી કલ્યાણુચંદ્રજી અને અન્ય ચતિવર્ણીને મારવા માટે લાકડીએ લઈ ૫૦૦ માણુસો આવ્યાં. ભાવિક શ્રાવકો લેગાં થઈ ગલરાતા વિચાર કરવા લાગ્યા કે હુવે શું થશો ? પુન્યશ્રીનું રક્ષણ કેવી રીતે કરીશું ? આ પ્રમાણે વીચાર કરતાં પુન્યશ્રી આગળ આવી કહેવા લાગ્યા કે, આપશ્રીને મારવા ગામના મુસલમાનો ઉશ્કેરાટ પુર્વક આવી રહ્યા છે માટે આપ ઉપાશ્રય ઉપર આવ્યા જવ. અમે નીચે ઉલા છીએ અમારા દેહમાં

જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી અમે તમારું રક્ષણ કરીશું. અમારા પ્રાણુના બલીદાને આપને બચાવવા પ્રયત્ન કરશું. અને આપના બચાવમાં અમે પ્રાણ રહીત થશું તો આપના બચાવને ખાતર અમારા હેઠની કીંમત નથી. માટે આપ કૃપા કરી ઉપર ચાહ્યા જવ. અમારું જે જનવાળું હુશે તે જનશે. તેમ ગલરાચેલા અવાજે શ્રાવકો પુન્જ્યશ્રીને કહી રહ્યા છે, ત્યાં માણુસોનો કોલાહલ નજીક આવતો સંભળાયો. શ્રાવકોને વધુ ભયભીત ઘતા જોઈને પુન્જ્યશ્રીએ શાંત સ્વરે કહ્યું કે તમો ગલરાચો નહીં. અમારે ઉપર જવાની પણ જરૂર નથી. કારણ સંસારથી ત્યાગી જનેલાઓને મરણુનો લય હોતો નથી. અને તેમાંચ તમો જેનાથી ગલરાચો છો તે મારવા આવનારા મનુષ્યોનો આગેવાન જ આંધળો છે ત્યાં તે શું મારી શકવાના હતા. આ પ્રમાણે પુન્જ્યશ્રી શ્રાવકોને કહી રહ્યા છે ત્યાં તો ખુમરાણ કરતું મારે મારેના પોકાર કરતું ટોળું ઉપાશ્રય આગળ આજ્યું. ઉપાશ્રયમાં પ્રવેશ કરવા જતા ખારણા આગળ ૫૦૦ માણુસો સ્થંભી ગયા, અને તેનો આગેવાન ખરેખર આંધળો થયો. આ દિંય ચમત્કાર જોઈને લાકડીઓ લઈ મારવા આવેલા માણુસો લાગી ગયા. રાણુપુરમાં આ ચમત્કારની વાત વાયુ વેગે ફરીવળી,

સૌ પોત પોતાની તુલનાત્મક શક્તિ અનુસાર વાત કરવા લાગ્યા. શ્રદ્ધાવાન વર્ગ અને જુનવાણી સમાજ તો એ પ્રમાણે વાતો કરવા લાગ્યો કે યતિઓ ખણું ચમત્કારી હોય છે. તેઓ ધણી મંત્ર વિધા સીદ્ધ કરે છે અને તેથીજ મારવા આવનારા મુસલમાનોને પુન્યશ્રીએ સ્થંભાવી દીધા.

વાંચક ! ખ્રિસ્તાર્થના ઉપાસકોમાં પણ ઉપરની શક્તિ આવે છે. ખ્રિસ્તાર્થથી વચ્ચેનોના અતીશયો વધે છે અને વચ્ચેન સીદ્ધી પ્રાપ્ત થાય છે, પાંચ મહા વૃત્તો સમ્યક્ રીતે પાલન કરનારાઓમાં હિંય શક્તિ પ્રગટ થાય છે. અને તેમાં એક ખ્રિસ્તાર્થના ગુણે જ પુન્યશ્રીને મારવા આવનારાઓ પાછા હુક્યા. મંત્ર શાસ્ત્ર પણ ખ્રિસ્તાર્થની પછવાડે છે. સંયમ વગર મંત્રની સીદ્ધી થતી નથી. બાકી યતિવર્યોની છાપજ એવી છે કે જેમને હેખતા જ સમાજને વહેભી અને નિર્ભળ વર્ગ કદ્યના કરી લીએ કે આ કંઈક પણ જાણુતા હુશે. માટે આપણાં હુઃખોનું નીવારણું કરાવી લઈએ. જેમનામાં કમાવાની તાકાત નથી, પૈસો મેળવવો છે અને પુરુષાર્થ કરવો નથી, અને પૈસા ખરચીને કંઈ પણ કાર્ય કરવું નથી, એવા માનસવાળા માણુસો યતિવર્યો પાસે આવે છે. પરીણુંમે કંઈક યતિઓ મંત્ર શાસ્ત્રના નામે પોલ ચલાવી પોતાની

આજીવીકા ચલાવતા હશે. પુર્વ મહર્ષિઓના ચમત્કારના ઉદ્ઘારણોનું આજે કેટલાકેના ઉદર પોષણના સાધન થઈ પડ્યા છે. અને તેથીજ સમાજના લોગા માણુસોને ઠગી પૈસા લેગા કરવાને અર્થે મંત્ર શાસ્ત્રનો ઉપયોગ કરનારા યતિઓએ જ મંત્ર શાસ્ત્રની કીંમત ધરાડી છે, અને સમાજની અંદર મંત્ર શાસ્ત્ર ઉપર અશ્રદ્ધા ઉત્પન્ન કરી છે. તેનાથી આગળ પુર્વના યતિવર્યોની કીર્તિને જાંખ્યપદગાડી છે. આ વિચારણા દરેક યતિવર્ગમાં નથી. કેવચીત અપવાદ રૂપે આ વસ્તુ હેખાઈ રહી છે. વાંચક ! અહીં રાણુપુરમાં તો વચનાતિશયોના નેરે અને પ્રક્રાર્યના પ્રતાપે પુજ્યશ્રીનું રક્ષણ થયું. બીજા દીવસે વળી પાછું ઉથ સ્વરૂપ થયું. પુજ્યશ્રી ત્યાંથી વિહાર કરી નાગનેશને માર્ગે જતા રસ્તામાં પાછળ મુસલમાનોનું ટોળું આવ્યું હતું. પરંતુ પુજ્યશ્રીને આત્મ શક્તિના પ્રતાપે કંઈ પણ કરી શકતા ન હતા. એ માઈલ સુધી સાથે આવી ટોળું પાછુ ક્ર્યું. પુજ્ય શ્રી નાગનેશ વંદ્દાવી ચુડા પધાર્યા. સમાજમાં રહેલા ખોટા વહેમોને ધર્મોપહેશથી નાશ કરવાનું સુચવી લોકોને જગૃત કરી અંધ શ્રદ્ધાને સમજાવટથી હુર કરવાનું સુચવી આઠ દીવસ રહી ત્યાંથી વિહાર કરી વીચરતા વીચરતા



પૂજયશ્રીના અનન્ય લક્ષ્મા સ્વામી રામણ માધવજી

સંવત ૧૯૩૧ નું ચાતુર્માસ કરવા સ્વ. શેઠ રામજી-
લાઈ માધવજીલાઈની વિનંતીથી પોરખંદર ઝુકામે
પધાર્યો. ત્યાં ચાતુર્માસમાં ધર્મ શ્રદ્ધાવાન આત્મા-
ઓએ વ્યાખ્યાનનો ધર્માજ લાલ લીધો, અને તેજ
વરસમાં ચાતુર્માસની અંદર સ્વ. શેઠ રામજીલાઈએ
ત્યાં પાંચમનું ઉજમણું કરી અઠાઈમહોત્સવ કર્યો
અને ધર્મનો ઉઘોત કર્યો. પુષ્ટયવાન આત્માઓજ
ધર્મના ક્ષેત્રમાં પૈસાનો વ્યય કરી શકે છે. તેમ
રામજીલાઈએ કરી બતાવ્યું. સ્વ. રામજીલાઈની
પુન્નયશ્રી ઉપર અનન્ય લક્ષ્ણ હતી અને સાથે
પુન્નયશ્રીની પણ રામજીલાઈ ઉપર પુર્ણ અમી
દષ્ટી હતી. અરસપરસ ઐઉના હૃદય એંચાણુકારી
હતા તેને અંગે પુન્નયશ્રીનું જ્યાં ચાતુર્માસ હોય ત્યાં
રામજીલાઈ આવવાનો વીચાર કરતા અને આવીને
દર્શાન કરી જતા. પુર્વવત પોરખંદરમાંથી પુન્નયશ્રીએ
ચાતુર્માસ પુર્ણ કરી સંઘની સાથે વિહાર કર્યો.
ત્યાંથી પાનેલી થઇ ઉપલેટા આવી એક માસ
રોકાયા. ત્યાં ધ્રાક્ષાથી લવચંદળ માંદા છે એમ
સમાચાર મળતા લવચંદળને જોવા સમસ્ત પરિ-
વારને ઉપલેટા રાખી એક છડીદાર સાથે લઈ
ધ્રાક્ષા પધાર્યો. લવચંદળને જોઈ ત્યાંથી તરતજ
પાણી કરી ઉપલેટા આવી ત્યાંથી વિહાર કરી ધોરાજ

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

આચાર્યા. થોડો કાળ ત્યાં પણ વીતાવી ચોમાસુનાંક આવતા જુનાગઢથી વેરાવલ, વંદાવી સંવત ૧૯૩૨ નું ચાતુર્માસ કરવા હીવ મુકામે પધાર્યા. પરહેશથી કમાઈ સુખ પુર્વક જીવન ગાળતા ત્યાંના અગ્રેસરોએ પુન્જયશ્રીની બાહુ સારી સેવા કરી. ત્યાંથી પણ શ્રી સંધની રણ લઈ દુંક મુહતમાં કાઠીયાવાડમાં રહી ગયેલા ક્ષેત્રોમાં ફરી સંવત ૧૯૩૩ નું ચાતુર્માસ કરવા વડોદરા શ્રી સંધની વિનંતીથી ત્યાં પધાર્યા. ચાતુર્માસ પુર્ણ કરી મારવાડ તરફ જવાને માટે કે જ્યાં ધણ્ણા વળતથી ક્ષેત્ર ખાલી છે તેમાં પણ પાલનપુર શ્રી સંધની વિનંતી ચાતુર્માસ માટેની આવેલ હતી. જેથી પુન્જયશ્રીએ વડોદરાથી પાલનપુર તરફ વિહાર કર્યો. વચ્ચમાં આવતા ગામોમાં શેષાકાળ વીતાવી ચાતુર્માસના ટાઇમમાં પુન્જયશ્રી સંવત ૧૯૩૪ નું ચાતુર્માસ કરવા પાલનપુર આવ્યા. ત્યાંના અગ્રેસરો કે જેએ ધણ્ણે ભાગે અવેરાતનો જ વેપાર કરે છે તેએએ ધણ્ણીજ લાગણીથી પુન્જયશ્રીને ચાતુર્માસ કરાયું. ચાતુર્માસ પુર્ણ થયે ત્યાંથી વિહાર કરી પુન્જય શ્રી મારવાડના સંસ્કાર વિહીન પ્રહેશમાં લમતા સત્યનો ઉપહેશ આપતા ધાર્મિક તત્ત્વજ્ઞાન શીખવતા સાદાઈના મહાન મંત્રને

આપતા વૈલવોને લાત મારી ત્યાગમય જીવન ખનાવવાનું સુચ્ચવતા તેમાં જ મનુષ્ય જીવનની ઉજ્વલતાનો આદેશ છે. એમ સૌને કહેતાં અનુકૂળે સ્થળે સ્થળે ધર્મનો નાદ પોકારતા, મહાવીરસંહેશ સંભળાવતા, સત્યના રાહ ઉપર ચઢાવવાનો ઉપહેશ આપતા, હેશની પરાધિનતાનો ખ્યાલ આપતાં, ભારતની પરતંત્રતાની એડી તોડવા ખાદી પેહેરવાનું સુચ્ચવતા, અસ્પૃશ્યતાને કુગાવી વિશ્વપ્રેમ ણતાવતા, અને સ્પૃશાસ્પર્શના લેદનો નાશ કરવાનું શીખવતા. વાંચક ! અસ્પૃશ્યતાના રાક્ષસે હિંદુ સમાજનું ધાણું એ નુકશાન કર્યું છે. અને તે ચેપ હિંદુ સમાજમાં જન્મી જૈન સમાજમાં પણ આવ્યો છે. જે અસ્પૃશ્યતા અને નીચ વર્ષી પરત્વે તીરસ્કાર વૃત્તિ ગુજરાત અને કાઠીયાવાડમાં છે તેવી મારવાડની ભુમીમાં તો નથીજ. ગુજરાત ને કાઠીયાવાડ જેટલી અસ્પૃશ્યતાની લાવના પણ ખીલી નથી. આજ પણ નાના ગામડાઓમાં મેઘવાળ અને ખાલ્સાણ એક ગોળે પીતા નજરે જેવાય છે. ત્યાં નથી નીચ ઉંચની લાવના. સ્પૃશ્યાસ્પર્શની તુચ્છ વૃત્તિ હજી મારવાડની બાધ્ય જનતામાં જન્મીજ નથી અને તેથીજ ત્યાં બધાએ વર્ષો એકચતાથી રહે છે. સવર્ણાના અત્યાચારો ગુજરાત કાઠીયાવાડને જ મુખારક ! ! પુજ્યશ્રી તો સ્થળે સ્થળે કહેતા કે જ્યાં

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત.

ઉંચ નોચની ભાવના છે ત્યાં આત્મવિકાસ નથી. માટે તે ઉંચ નોચના લેદને મુળમાંથી કાઢી નાખો. આ પ્રમાણે ગામડે ગામડે ઉપરેશ આપતાં, મારવાડમાં ચાણ્ણોદ મુકામે પુજયશ્રી સંવત ૧૯૭૫ તું ચાતુર્માસ કરવા પધાર્યા. પરીવારની સંગાથે ચાણ્ણોદનું ચાતુર્માસ પુર્ણ કરી મારવાડની ભૂમીના અણણું પ્રદેશમાં જણું થવા અણુષેડાયલા ક્ષેત્રોમાં જવા અને પાસે સાદઈ મુકામે જવાનો પુજય શ્રી વીચાર કરવા લાગ્યા.



સાદડીમાં તોઝાન

વાંચક! પૂજય શ્રી મારવાડની ભૂમીના તમામ ગામોમાં એક પઢી એક જવા માટે ચાણોદ સુકામે ચાતુર્માસ પુર્ણ કરીને ત્યાંથી સાદડી તરફ આવવા વિહાર કર્યો. ચાણોદ શ્રીસંધે પૂજયશ્રીના આગમનની અગાઉથી સાદડી શ્રીસંધને ખખર આપી. સાદડી સંધને ખખર મળતાં તરતજ ડેવી રીતે સ્વાગત કરવું, તેનો વિચાર કરવા લાગ્યા. આખા ગામમાં પૂજયશ્રીના સમાચાર ફરી વળ્યાં. તપગચ્છમાં પણ પૂજયશ્રી ચાણોદ સુકામેથી અહીં આવે છે તેમ ખખર પડી. “હજુ તો તેમનાં દર્શન થયા ન હતાં તે પહેલાં” અંહી પણ પૂજયશ્રીની વિક્રિતાના વખાણુ પહેંચી ગયા હતા. તેમની પ્રલાઘે અહીં પણ

ઃ ૬૭ ૩

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત.

ધણ્યાયના મન આકષ્ટિ લીધા હતા. સાદડી શ્રીસંધે લોંકાગંધિની ઢૂઢી પ્રમાણે સામૈયું કરી એમ પહેલાના આચાર્યને લાવવામા આવે છે તેવી જ રીતે ગાજીને વાજીને લાવવા એ પ્રમાણે નક્કી કર્યું. સામૈયાની વાત પણ જૈન સમાજમાં ફરી વળતા, તપગંધિના સંચાલકો સાદડી લોંકાગંધિ શ્રી સંધના અગ્રેસરોને આવી કહેવા લાગ્યાં કે:—

તપગંધિશ્રી:—“ શ્રી પૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણચંદ્રજી સ્તુર્ચિખરજીના આગમન થયા પછી તમો મોટી ધામધૂમ સહીત નગર પ્રવેશ કરાવવાના છો તેમાં જણાવવાનું કે ગામમાં આવતા અમારું દેરાસર વચ્ચમાં આવે છે તો ત્યાં થઈ અંદર દર્શાન કરી પૂજ્યશ્રી પછી ઉપાશ્રે જાય, અથવા દર્શાન કરવા ન આવે તો દેરાસર આગળ આવતાં વાળ બંધ થાય.”

આ હકીકત સાંલળી લોંકાગંધિ શ્રીસંધ હવે આને વીચાર કરે છે. ત્યાં ગામથી એ ગાઉ હુર પૂજ્યશ્રી આવી ગયા છે એમ સમાચાર મળતાં સંધના

સાદીમાં તોક્કાન.

માણુસો સામા લેવા ગયા. અને રસ્તામાં જ પૂજ્ય-
શ્રીને ગામની પરીસ્થીતીની વાત જણાવતાં પૂજ્યશ્રીએ
ગામની બહાર તંબુ તાણી વસવાટ કર્યો. સાદી
શ્રીસંઘે પૂજ્યશ્રી ને કહ્યું કે:-

લોકાગચ્છ સંધુ—“ તપગચ્છવાળા એમ કહે છે
કે આપ સાદી ગામમાં
આવતા રસ્તામાં જે દેરાસર
આવે છે તેમા દર્શન કરી,
પછી આપ ઉપાશ્રીયે પદ્ધારો.”

પૂજ્યશ્રીઃ—“ સામૈયામાંથી રસ્તામાં આવતાં દેરા-
સરમાં દર્શન કરવા જવાનો મારો
આચાર નથી. પુર્વની પરંપરા તોડી હું
દેરાસરમાં ન આવી શકું.

માટે હવે આવા નજીવા કારણુસર નાહુકની
તકરાર તમારા આપસ આપસમાં થશે માટે હવે
મને અહીંથી સીધે જવા દયો. અથવા આપ બન્ને
સંધના માણુસો મારી આગળ આવો જેથી હું તમારા
બન્નેના વિચારોની જુદાઈ કેવી છે તે સમજવી
સંગઠનનો માર્ગ સરળ કરી આપું જેનાથી કલેશ
નાશ પામે.” પૂજ્યશ્રીની આ વાત સંભળવાથી
લોકાગચ્છ શ્રીસંઘે તપગચ્છના સંચાલકોને પૂજ્યશ્રી

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

આગળ આવવા આમંત્રણ કર્યું પણ તેઓ ન આવ્યાં. પૂજયશ્રીએ લોંકાગંછ શ્રીસંધ પાસે ગામમાં ન આવતા અહીંથી સીધા જવાની રણ માગી.

સાદડી લોંકાગંછ સંધના અચેસરોએ પૂજય-શ્રીની વાત સાંભળી કહેવા લાગ્યા કે તેતો અધિતીત થાય. આપને નગરમાં લઈ જવા તે તો નિશ્ચય જ છે.

લોંકાગંછ સંધઃ—“ આપને નગરમાં લાવતા કદાચ વિદ્ધ આવે તો અમો સહન કરીશું. શુરુ દર્શન કરતા કયું વીશેષ છે ? માટે આપ અહીંથી જવાની તો વાત કરશો જ નહીં. ”

આમ પૂજયશ્રીને આચહૂ કરી રહ્યા છે તેવા વખતમાં સાદડીના હાકેમને આ સમાચાર મલ્યા કે શ્રીપૂજયજી ગામ બહાર આવ્યા છે અને ગામમાં આવ્યા વગર પાછા જય છે. હાકેમે પણ પૂજયશ્રીની પ્રશંસા અનેક વાર સાંભળી હતી તેજ પોતાના ગામ આગળથી આવી પાછા જય તે ઠીક ન લાગતા તેઓ પણ પૂજયશ્રીના તંબુ આગળ આવી આચહૂ કરવા લાગ્યા.

પૂજયશ્રીને લોંકાગંછના અનુઆધીએ તથા

હકેમ તરફથી અત્યંત આશ્રણ થતા ગામમાં આવવાની પુજયશ્રીએ હા પાડી. લોંકાગચ્છ સંઘના અંત્રેસરોએ તપગચ્છના સંચાલકો ઉપર કહેવડાંયું કે આપે કહેવડાવેલ હકીકિત જાણી છે પણ અમારા ધર્મગુરુએના સામૈયામાંથી દેરાસરમાં દર્શાન કરવા આવવાને રીવાજ નથી તે પરંપરાથી વિરુદ્ધ છે. ઉપરાંત અમારા અંત્યાર સુધી આવેલા ધર્મગુરુએ ગાજતે વાજતે જ આવ્યા છે અને તેને માટે તો લોંકાગચ્છાધિપતીએને પરવાના પણ જોધપુર સ્ટેટ વિગેરે તરફથી ભલ્યા છે તેથી પુજયશ્રીનું થનારું એક લંબ સામૈયું તેના વાળ બંધ રહેશે નહીં. અંત્યાર સુધીમાં તમારા દેરાસર આગળથી વ્યવહારીક અનેક વરધોડા નીકલ્યા હશે. ઈતર પણ ખીન એવા અનેક ઉત્સવોના વરધોડા નીકલ્યા તેમાં તમોએ અટકાવ કર્યો નથી અને આ એક મહાન ધર્મગુરુનું સામૈયું થાય છે તેના વાળ બંધ કરાવવા તે ચોણ્ય નથી. આવો વાંધો ડોધ પણ ગામમાં ઉઠ્યા નથી તેથી પણ તે ચુક્તા નથી.

વાંચક, ચારે તરફ આસપાસના ગામોમાં પણ આ વાત કરી વળી કે સાદીમાં આવી રીતે મતલેદ એ સમાજે વચ્ચે પક્ષાં છે. શીરોહી ખખર

મળતા શીરોધી શ્રી સંઘે પૂજયશ્રીના સામૈયામાં તોક્કાન ન થાય તેનો બંદોળસ્ત રહે તેને માટે અરજી પણ કરી. હકેમ તરફથી બંદોખસ્ત પણ રખાયો. સાદહી શ્રી સંઘના અતુલ ઉત્સાહથી પ્રચંડ માનવપુર સાથે પૂજયશ્રીનું ગાજતે વાજતે ભવ્ય સામૈયું થયું. ગામના પ્રતિષ્ઠિત માણુસો હકેમ વીળેરે અમલહાર વર્ગ પણ હતા. નગરમાં પ્રવેશ કરતાં જ પૂજયશ્રીએ શિષ્યોને છંદું કે નગર પ્રવેશ ચોગ્ય નથી માટે તે અનિષ્ટનું સૂચન કરે છે એવી આગાધી કરી. શ્રાવકોના સમુદ્ધાય સાથે પૂજયશ્રીની પાલખી સાહડીના મધ્ય લાગે આવી કે જ્યાં હેરાસર છે ત્યાં સામૈયું આવતા શરૂઆતમા વીરોધી મનુષ્યોએ વાળ ઝોડી નાખ્યા. તરતજ કંઈજ ન બોલતા શ્રાવકો ઝરી વાળ લાવ્યા તે પણ વિરોધીએ તરફથી ઝોડવામાં આવ્યા. અને પહેલેથી ગોઠવણું કરી હતી તે પ્રમાણે હેરાસરની જોડેના આનુણાનુના મકાનોમાંથી પથરે પડવા લાગ્યા. શાંત વાતાવરણ તોક્કાનમાં ઝોડવાઈ ગયું અને પશ્ચાચે ઉથ સ્વરૂપ ધારણ કર્યું પૂજયશ્રીની પાલખી ત્યાંજ ઉલ્લી રહી. રજુપુતો પોતાની ઢાલથી પાલખી ઉપર આવતા પથરે રૈકવા લાગ્યા. એક મીનીટમાં તો મોટું રમખાણું શરૂ થયું.

અરથાત જીવન

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું લુવનચરિત્ર.

વાંચક, જૈન સમાજની પડતીનું કારણું બીજા કારણોની સાથે ઉપરનું પણ કારણ છે કે જૈન સમાજના સંચાલકો અંદર અંદર લઢીને પોતાની શક્તિઓનો વ્યય કરી નાખે છે. અને શક્તિના ફરપચોગથી જૈન સમાજ પોતાના હાથે પોતાનો સંહાર કરી રહ્યો છે. આજ પર્યાંત જૈન સમાજે પ્રખૂર વિદ્ધાનો ઉત્પત્ત કર્યા છે. ત્યાગી તેમજ રાગીમાં અનેક લડવીર જન્મ્યા છતાં બંનેએ અત્યાર સુધી અંદર અંદર લઘવામાંજ પોતાનું ખંડન અને પારકાનું ખંડન કરવામાંજ જીવનની મુખ્યાઙ્કુલી કરી નાખી છે. અને તેના પ્રતાપે વિદ્ધાનો જન્મવા છતાં કાંઈપણ રચનાત્મક કાર્ય કરી શક્યા નથી. ગંધી કે સંપ્રદાય જુદા હોવા છતાં એકચયતાનો ધ્વની કેમ ન નીકળો ! અરે એક ગંધી કે સંપ્રદાય કિયાઓથી લલે જુદો રહ્યો છતાં મનુષ્યોના હૃદયો શા માટે લિન્ન હોય ?

એક કુદુંખના એ સંતાન હોય તેમાં એક કાપડની હુકાન કરે અને બીજે અપર હુકાન કરે તેમાં હુકાન જુદી છતાં ધર તો એકજ હોય તેમાં જ કુળની આખાહી છે. તેમ કિયાઓથી લિન્ન એવા ગંધો અને સંપ્રદાયોમાં અરસ પરસ પ્રેમ જાગે ભાતૃભાવ જાગે સહુકાર અને પ્રેમ કેળવાય તો જ

દેશની અંદર ખીલ સમાજે સાથે ઉલ્લા રહેવાનો વખત છે. સહકાર અને સંગઠન નહીં કરનારી પ્રજા અંદર અંદર લઢીને હુનીયામાં જીવંત રહીજ નથી માટે વાંચક, તારામાં પણ જો સાંપ્રદાયિક ઓર હોય તો તું પણ કાઢી નાખી કૈમનસ્યને ઝગાવી હેણે અને સમાજમાં સંગઠન ફેલાવવા કરુની ધારણું કરજે. સંગઠનનો અર્થ તો ધાર્ઘોજ વિશાળ છે. જૈન સંગઠન એટલે જૈન નામ ધરાવતા આ આર્ય ભૂમીના એકેએક જૈનને જૈનત્વના અંડા નીચે ઉલ્લો રાખવો તે. જૈન સંગઠન એટલે ગમે તે ગચ્છ કે સંપ્રદાયની કિયા કરવા છતાં હૃદયમાં જૈનત્વનું ઉજવળ અલિમાન રાખતા લાખો જૈનોને જૈનત્વની હુહાઈ સ્વીકારતા કરવા તે. જૈન ધર્મનું પાલન કરનારા તથા દરરોજ પ્રાતઃકાળે ધર્મ શ્રવણ કરી ધર્મની કિયા કરનારા ઉલય ટંક પાપને આલોવવા જાણીને કરેલા યાપોની મારી માગવા પ્રતિકમણું કરનારા અને અન્ય મનુષ્યોએ એટલુંજ જાણુવાની જરૂર છે કે સમાજના હૃદયમાં આ પૃથ્વી ઉપરથી નાશ કરી નાખવા એક પ્રકારનું સાંપ્રદાયિક ઓર ઉત્પન્ન થયું છે અને તે ઓરના કેક્થી સમાજની પ્રવૃત્તિએ વિનાશકારી હેણાય છે. જૈન સમાજ ઉપર આકબણું કરવા ખીલ સમાજે તૈયાર થયા છે. અને તે

આકભણું વખતે સમાજ જો નિર્ણિય રહેશે તે નહીં
ચાલે જૈનની અત્યારની મનોદશા એ તેની નિર્ણિ-
યતાનુંજ પરિણામ છે.

હુનીયાની કોઈ પણ પ્રજા જેને માટે મગઢર
ખની શકે એવા જૈનધર્મ અને જૈનસંસ્કૃતિ ઉપર
સમાજના કલુષિત વાતાવરણથી આકૃત અજુમી રહી
છે માટે કાંતો જૈનત્વની ઉદ્ઘોષણા કરવા સમાજ
તૈયાર થાય અથવા કાંતિની જાળમાં લીર્તતાપૂર્વક
આ ધર્મ અને સંસ્કૃતિને નાશ પામવા હે. જૈનોની
સાંપ્રદાયિક જેરની મનોદશા જો સમય સર નહીં
બદલાય તો જૈનકોમ અને તેની સંસ્કૃતિનું આચુષ્ય
ખાડું ન ટકે. ધર્તિહાસ અને સંસ્કૃતિના અવલોકનથી
નક્કી થાય છે કે જૈનસંસ્કૃતિ અને જૈન જીવન
ક્યાંય મળે તેમ નથી. છતાં ઉજવક્ત એવી સંસ્કૃ-
તિને રાખવા માટે પ્રવૃત્તિ અને મનોદશા જૈનો
ક્રીરવતા નથી એ કેટલી ખેદની વાત ? જ્યાં સુધી
સંસ્કૃતિનું અલિમાન જૈનોના માનસમા વિશાળ
દૃષ્ટિએ આવે નહીં ત્યાં સુધી સંગઠન કેળવાય નહીં
અને જ્યાં સુધી સંગઠન ન કેળવાય ત્યાં સુધી
ઉન્નતી થાય નહીં. અરે આજે તો સાંપ્રદાયિક
બિન્નતાને અંગે ચારે તરફથી વિચીત્ર સુરો સંભળાઈ
રહ્યા છે. સમાજમાં ન ધર્ણીયાતા સૈન્યની જેમ જેને

જેમ ફાવે તેમ ચાલે, નથી કોઈ પૂછનાર કે બોલનાર અને આ અંધાધુધી સંગઠન ના અભાવેજ પોષાઈ રહી છે. એકયતાના દોર ઉપર જૈન જીવન શરૂ થશે ત્યારે જૈન લાનુ પ્રગટશે, જ્યાં સુધી સમાજમાં કુસંપની આંધી પ્રસરેલી છે તે તો ભયંકરતાનું જ સૂચન કરે છે. અરે કોઈ પણ જગ્યા કે કોઈ પણ ગામ એવું પ્રાઃચે નહીં હોય કે જ્યાં જૈનોમાં ફાટકુટ ન હોય.

વાંચક, જ્યારે આર્ય સમાજ ખલોસમાજ વીળેરેની રચના જુઓ. તેઓની કાર્ય પદ્ધતિથી આપણું ને ભાન થાય કે તેમનામાં રહેલી સંગઠન શક્તિ જ તેમને હુનીયામાં આગળ લાવે છે. જ્યારે જૈન ધર્મનું પાલન કરનારાઓને વિતરાગ જેવો પવિત્ર ધર્મ મળવા છતાં કલુષિત અદ્યવસાચો ઉપર કાબુન મેળવે તો તે ધર્મની અસર શી? જે જાતિ ન્યાય કરવામાં ખીણના કલેશને બુદ્ધિથી શાંત કરવામાં અગ્રેસર ગણુંતી તેજ જાતી પોતાની અંદર સળગી રહેલા કલહના અગ્નિને શાંત કરવામાં કાયર ઘની ગઈ છે. છીન્ન બિન્નતા અને સંગઠનના અભાવે જૈનો પોતાનું તેજ ગુમાવતા જાય છે કે જે તેજ આપા દેશમાં એક વાર ફરી વલ્યું હતું. તે તેજ લાવવા માટેજ સંગઠનના માર્ગો છે.

વાંચક, પણ તે સંગઠન કંઈ એમ ને એમ નહિ થાય. બીજા સમાજેની જેમ સ્વાર્થનું ખલીદાન આપવા ભાવના જન્માવવી પડશે. પશ્ચીમના હેઠો ખલીદાન શક્તિથીજ પોતાના દેશના વિધાતા ખન્યા છે અને દરેક ક્ષણે પોતાના ઉપાડેલા કાર્યમાં આગળ વધી વિજ્ય પ્રાપ્ત કરે છે. નિદાન સંગઠન ને માટે સ્વાર્થ ત્યાગીએ જન્મે તો જ સંગઠન થઈ શકે. ઉપરાંત તિન્દેરી ઉપર ચોકી કરનારા શ્રીમંતો જે પોતાની સ્વાર્થ ભાવના છોડવા ન માંગતા હોય જ્ઞાતિના અગ્રેસરો પોતાના અહુંભાવને ત્યાગવા ન માંગતા હોય અને નવ ચુવકોની પલટણું સમાજ સેવાને માટે ઉત્તરીપડવા તૈયાર ન હોય અને સાથે પૂજનીય ગણ્યતા માન્યવર મુનિવરો માનપાન અને પદ્ધિના મોહનો ત્યાગ કરી સમય ધર્મની હાકલ કરવામાં તેઓને ધર્મની હીણુતા દેખાતી હોય તો સંગઠનની વાતો આકાશ કુસુમવતું છે. જ્યાં સમાજ ઉચિત ખલીદાન આપવા તૈયાર ન હોય ત્યાં ઔક્યતાને પોષણ મલતું નથી. દરેકના માનસમા સ્વાર્થ ત્યાગની ભાવના જન્મે તો જ સંગઠન શક્ય છે નહી તો સંગઠન વગર હુંએ જૈન જ્ઞતિના મૃત્યુના દિવસો નશ્શુક આવતા જય છે.

વાંચક, સંગઠનના માર્ગનો હેતુસર વીચાર

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

કરતા સમસ્ત જૈનસમાજના ચારે અંગોનું સંગઠન ત્યારે જ થાય કે જ્યારે દીક્ષિત અવસ્થામાં રહેલા મુનિવરો પોતાનું સંગઠન કરે સંસારીઓની જેમ સાધુ સમુદ્દરાયમાં પણ વૈમનસ્ય. છીજાભીજતા, કલુષિત માનસ વીગેરે જન્મભી ચુક્યા છે. સ્થાનકવાસી યા તપગચ્છ દરેકમાં પોતપોતાના ગચ્છ કે સંપ્રદાયમાં ઐક્યતા ન હેણાય ત્યારે તપગચ્છ કે સ્થાનકવાસી સાધુ સમાજને ઐક્ય થવાની આશા જ કયાથી રાખી શકાય ? જ્યારે વાંચક ! કલુષિત વાતાવરણુથી કેવળ એક યતિ સમાજજ બચ્યો છે. ઐક્યતાની ભાવનાના અંગે ગમે તે ગચ્છ કે સંપ્રદાયના યતિઓ લેગા થાય તે। પૂર્ણ સહકારથી લેગા રહીને દિવસો નિર્ગમન કરે ત્યારે એકજ જચ્છના યતિઓમાં કેટલું સંગઠન હુશે ? તે સંગઠનને લીધે જ યતિ સમાજની દીવાલ ટકી છે. જ્યારે યતિ સમાજનું માનસ વૈમનસ્યથી દુર છે ત્યારે સાધુ સમાજનું માનસ વૈમનસ્યથી ભરપૂર છે. આખા વિશ્વ સાથે મૈત્રી ભાવના રાખવાનો દાવો કરવા વાળા મહાત્માઓ પરસ્પર મૈત્રી ભાવ ન રાખી શકે તે કેટલી ઐદની વાત ? સાધુઓના અધડા હુવે સામાજથી અનિષ્ટયા નથી. એક સાધુની કૃતિં ભીજા સાધુથી ન સાંભળી શકાય એક આચાર્ય ભીજા આચાર્યને ભળવા ન જઈ શકે. એક પક્ષ

સાદડીમાં તોક્કાન.

ખીજ પક્ષની નીંદા કરે, આશ્વર્ય થાય છે કે આત્મ કલ્યાણુને માટે રાગ દવેષનો નાશ કરવા વિશ્વ ઉપકારને અથેર્ હીક્ષાને ધારણુ કરી છે તેમા સંસારી કરતા વધારે ધીર્ઘ વધારે ભમત્વ, વધારે પક્ષાપક્ષી, અને એંચા એંચી જઈ સમૃદ્ધિ માટે, કયા રાજ્યપાટ માટે જ્યાં સુધી સાધુ સમાજમાંથી વૈમનશ્ય નીકલ્યુ નથી ત્યાં સુધી ગૃહસ્થ વર્ગમાંથી નીકળવાનું નથી. એ હીવસ વહેલો આવે કે ભગવાન મહાવીરનો વેષ પહેરી વિચરનારા હીક્ષીતો એક સ્થાનકે લેગા થઈ શાસનના અભ્યુદ્ય માટે વીચાર કરી વિશ્વના જૈનોને એક છત્ર નીચે લાવવા કોરીશા કરે.

વાંચક ! અત્યારે તો જ્યાં વૈમનશ્યનું એક છત્ર હતું ત્યાં ઐક્યતાના અભાવે સાદડીમાં તોક્કાનની શરૂઆત અને વરસાદની જેમ પથ્થરો વરસવા લાગ્યા ગામના હાકેમને પથ્થર જરા લાગતા તેઓ પોતાના રહેઠાણુમાં જઈ પોલીસોને હુકમ કર્યો જલહી જાઓ અને તોક્કાન કરનારાઓને અટકાવો. અને અટકાવવા માટે જે પ્રયાસ થાય તે કરો. પોલીસો હુકમ સાંલળી તરતજ જ્યાં તોક્કાન હતું ત્યાં આવી ખાલી અવાજ કર્યો તે અવાજ સાંલળી મામલો શાંત પડવા લગ્યો. તોક્કાની માણુસો વીખરાયા લોકાગંધ

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત.

સંધે કુરી વાળ મંગાવ્યા અને ત્યાંથી કુરી વાળતે ગાજતે પૂજયશ્રીની પાલખી ઉપાશ્રી આવી. વાતા-વરણ કંઈક શાંત પડ્યું તેજ વખતમાં અંદર અંદર પથ્થરોની ઝેંકાઝેંકીમા તપાગચ્છના એક માણુસને સખત વાગ્યું અને તેનાજ દરદમાં તે લગભગ ચોડા હીવસમાં મર્ણું પામ્યો. આવી રીતના બનાવ બનવાથી પ્રતિસ્પર્ધિએ લેગા થઇ નક્કી કર્યું કે આ મરણના ખુનનો આરોપ શ્રી પૂજયશ્રી ઉપર મુકીએ તેમ નક્કો કરી સેંકડો માણુસો મૃતકને ઉપાડી ઉપાશ્રીના ખારણા આગળ નાખી ખુલ્લા ચોગાનમાં બધા બેઠા અને ગામમાં વાત ઝેલાવી કે શ્રી પૂજયશ્રીની ઉંફુરણીથી આ માણુસને મારવામાં આવ્યો છે. તેથી અમારે તેનો અહીંથાજ અજિન સંસ્કાર કરવો છે. આવી વાત ગામમાં ઝેલાવાથી લોકાગચ્છ શ્રી સંધના શ્રાવકો ગલરાવા લાગ્યા કે હુવે શું થશે. ઘણ્ણા કલાક સુધી મૃતકને ત્યાં પડી રહેવા હીધું ત્યાં પુજયશ્રીએ શાસન દેવનું ધ્યાન ધર્યું. તેજ વખતે ઉપાસરા પાસે સરકારી છાવણીનો દરવાજો હતો. તે દરવાળમાથી ઘોડેસ્વાર આવી બધાય ને પુછવા લાગ્યો. કે

ઘોડેસ્વાર કહે છે:—“ અહીં આ બધી શું ધમાલ છે ? ”

તપગચ્છના આવકેઃ—“અમારા માણુસનું ખુન
થયું છે તેના મૃતકને લઈ
એઠા છીએ તેનો અગની
સંસ્કાર પણ અહીં જ
કરવો છે. ”

ઘોડેસ્વારઃ—“ શું ગામ ઉજડ કરવું છે કે ગામમાં
સમશાન બનાવવું છે જાએા અત્યારે
જ અહીંથી ઉઠાવી જાએા. ”

ઘોડેસ્વાર કોઈ મોટો સત્તાધારી અમલદાર
જેવો હતો, જેથી બધા ગલરાઈને મુડદાને તરતજ
ઉપાડી લઈ ગયા. મૃતકને લઈ ગયા પછી તે ઘોડે-
સ્વાર પાછો છાવણીમાં ચાલ્યો ગયો. પુજ્યશ્રી તથા
સર્વે સમાજને શાંતિ વળી સૈા પોતપોતાને ઘરે
ગયા. વિરોધીએ વિચારમાં પડ્યા અને પુજ્યશ્રીએ
આરામ લીધો.




નેધપુરમાં કેસ.

વાચક, વિરોધી પદ્ધતિ એ વાર પૂજયશ્રીને હેરાન કરવા વીચાર કર્યો. હુમલાઓ. કર્યો. છતાં મનની ઈચ્છા મનમાંજ રહી ગઈ. ઈચ્છાઓને તાણે જગતનો ધણોખરો અજ્ઞાન વર્ગ થાય તેમા તે ઈચ્છાની સીદ્ધી થવી અથવા ન થવી તે કર્મધીન છે. છતાં ગુજરાતી કહેવત છે કે ખાડો એહે તે પડે. અહીં પણ એમજ બને છે. પૂજયશ્રીને હેરાન કરવા હવે નવી વિચારણા વિરોધી વર્ગ કરવા લાગ્યો. ભૂતકને સમશાનમા અગિન સંસ્કાર કરી આવ્યા પછી સરકારી છાવણીમાં જઈ ઘોંધાટ કરવા લાગ્યા પણ કોઈએ દાદ સાંલળી નહીં. ત્યાર પછી છાવણીમાં આ બાખતની જાણુ કરવી જ એમ વીચાર નક્કી કરી

जेधपुर रेट तरक्षथी भणेलो परवानो नं. १

॥ श्रीजवधुनाप्यजामलठे ॥



॥ श्रीद्विश्वीश्वर राजे म्बरमहाराजाधिराजमहारा
जाश्रीमांनमिंघजीवननाता तथाद्वबाररीहृद
मैंद्वंडागठरामिरापूजनजैवैदरोमांसेकोगजावाज
मुखदामदण्डैचैजिए साश्रद्धकांजामीश्वर गर्भ
रीजतीआवद्वजपासरैदेवरैपोमावज्ञागैंवाजतां
अउबीडरणतपावै। मर्मवत न्द्रराजामीननुद् ॥
मुकांसंपापतवतगजोधपुर

સંચાલકેએ બીજા દીવસે ચાર ખાટલા તૈયાર કર્યા તેમાં ચાર માણસને સુવાજ્યા. શરીર તેમજ મોઢા ઉપર રૂ દખાવી દીધું. ધાણું વાગ્યું હોય તે પ્રમાણે પડયંત્ર તૈયાર કરી ખાટલા ઉંચકી સરકારી છાવણી આગળ આવ્યા અને ત્યાં કોલાહલ કરવા લાગ્યા. સાહેબને ખખર પડતા સીપાઈને પુછ્યું આ શી ધમાલ છે ?

સીપાઈએ કહ્યું: ગામના પ્રતિષ્ઠત મનુષ્યો હેખાય છે.

સીપાઈના કથનથી સાહેબ બહાર આવવા લાગ્યા. દરવાનની બહાર નીકલતા સાહેબની મુલાકાત કરવા શીરોહીના વકીલ પુનમચંદલાઈ એઠા હતા. સાહેબે તેમની મુલાકાત કરી અને તરત જ બહાર આવી સૌને આવવાનું કારણ પુછ્યું.

તપગચ્છના આવકો:-જૈન સમાજના લોંકાગચ્છ
શીરકાના શી પૂજય અમારા
ગામમાં આવતા રસ્તામાં
તેમના સમાજે તોક્ષાન કર્યું
તેમની સાથે રહેલા પોલી-
સોએ બંદુક મારી જેનાથી
અમારા પાંચ માણસોને
ઇન્ન થઈ તેમાં ત્રણ દિવસ

થયાં એક માણુસ ભરણ
પામ્યો અને ચાર માણુસોને
કેટલું વાગ્યું છે તે જોવા
ઓપની પાસે લાવેલ છે.

વાંચક, આ જુઠાણું કયાં સુધી ચાલવાનું
છે પોતેજ તોક્કાન ઉપસ્થિત કરી જેમાં ન ઝાવતાં
પૂજ્યશ્રી ઉપર આરોપ મુકી સરકારી છાવણીમાં
અરજે આવ્યા છે ત્યાં પણ હવે જુડા પડે છે. વાત
સાંભળ્યા પછી ડાકટરને બોલાવવા કહ્યું. સિપાઈ જઈ
ડાકટરને બોલાવી લાંઘ્યો. ધાને તપાસવા ડાકટરે
હુથીયાર કાઢ્યા. ખાટલામાં સુતેલા મનુષ્યો વિચા-
રવા લાગ્યા, આપણે તો સારા છીએ કોઈ પણ
જતનો ધા પડ્યો નથી. હુમણું ડાકટર આપણા
શરીરમાં હુથીયાર ભોંકશે અને ઉપાધી ઉલ્લી થશે.
આ જીકે ખાટલામાં સુતેલા બનાવટી દરહીએ
લાગવા લાગ્યા. નાશલાગ શરૂ થઈ. સાહેએ ફોંધે
ભરાઈ સિપાઈને હુકમ કર્યો જવ બધાયને કાઢી
મુકેલા. અસત્ય કયાં સુધી ટકે. વીરેાધી વર્ગ ચારે
તરફથી નિરાશા મેળવવા લાગ્યો. અને છેલ્લો દાવ
અજમાવવા જોધપુર પૂજ્યશ્રી કદ્વાણુચંદ્રજી ઉપર
કેસ કરવા વિચાર કરવા લાગ્યા. કેસના ખર્ચ માટે
શ્રીમંતોએ ક્રાળા કર્યા અને કુરીયાદ દાખલ કરી

કે આ સાહડી મુકામે આચાર્યના આગમનથી તોક્કાન થયું અને તેમાં તેમની ઉંશકેરણીથી અમારા માણુસનું ખુન થયું. આવી વસ્તુને સમજાવતો કોઈ માં કેસ દાખલ કર્યો. તેનો શરૂઆત થઇ કેસનો નિકાલ ના આવે ત્યાં સુધી ગામમાંથી બહાર ન જવું તેવો નેધપુર સ્ટેટ તરફથી પૂજયશ્રી ઉપર ઇરમાન નીકળ્યું. રાજ્ય આજાનો અમલ કરવા પૂજયશ્રીને રોકાવું પડયું વીરોધી પક્ષ તો આ કેસમાં પૂજય શ્રીને સન્ન થાય એમ ઇચ્છી રહ્યો હતો. અને તેથી પોતાની લાગવગ લગાવી રહ્યો હતો. મોટા અમલ-દારોની મુલાકાત કરી રહ્યાં હતાં. મહારાજશ્રીને જેલમાં એસાડવા તેમાં શું? એમ ઓલી રહ્યા હતા. કેસ તૈયાર થતા કેસની તારીખ પડી આચાર્યશ્રી કોઈ માં નહીં આવી શકે એમ શ્રાવકોના કહેવાથી રાજ્યે પણ ધર્મશુરુ જાણી તેમના માન ખાતર નાજર જુણાની લેવા તેમના સ્થાને આવશે એમ કહ્યું. કેસ ચાલ્યો જુણાનીએ લેવાણી. પૂજયશ્રીની જુણાની આવતા તે જુણાની લેવા નાજર નેધપુરથી ઉંટ ઉપર રવાના થઇ આવ્યા. આજે પૂજયશ્રીની જુણાની છે એમ આખા ગામમાં વાત પ્રસરી ગઈ હતી. નાજર આવતાં પૂજયશ્રી પાસે તો સમાજ ભરચક એઠો હતો. નાજર પૂજયશ્રીની પ્રતીભામાં અંનયો.

મુખ ઉપર અદૌડીક નીર્દેખતા હતી આંખોમાં સંયમનું તેજ હતું. પૂજ્યશ્રીના વચનામૃતો નાજરે સાંલઘ્યા. પૂજ્યશ્રીની જુખાની લખી અને નાજરની ભાવના અને મનોદૃશા તો ફરી ગાઈ હતી. તેણે તો મનમાં નક્કી કર્યું હતું કે આવા પવીત્ર અને ઉપકારી પુરુષોને ઉતારી પાડવાની આ જગ છે. એમ વીચારી પૂજ્યશ્રીને નમન કરી જોધપુર જઈ જુખાની રણુ કરી વીરોધીએ એ કણું, તે મહારાજ તથા તેમના સેવકો ધણ્યાજ પૈસાવાળા છે. નાજરને પૈસા આપ્યા છે માટે બીજો મોંકલો. બીજાવાર પૂજ્યશ્રીની જુખાની લેવા બીજા નાજરને મોંકલવામાં આવ્યા ઉટ ઉપર તે પણુ પૂજ્યશ્રી આગળ આવ્યાં લઘ્ય સુખ સુદ્રાના અપૂર્વ તેજમાં જુખાની લેવા આવનાર ક્ષોલ પામ્યા. ન્યાં સાક્ષાત પવીત્રતાજ નીતરતી દેખાય એવા પૂજ્યશ્રીના વચનો સાંલળી નક્કી કર્યું કે વીરોધી પક્ષનો એક જાતનો પ્રપંચ છે. પૂજ્યશ્રીને દ્વારીત બનાવી તેમની અપકીર્તિને જગતમાં પ્રચાર કરવાનો આ હેતુ છે. વીશ્વ આખું જેને નમન કરે એવા જેના આચાર અને વીચાર છે. વીશ્વમાં આવા મહાત્માએ થોડાજ હોય છે એમ સ્વગત કહી ત્યાંથી પૂજ્યશ્રીને નમન કરી પૂર્વવત જોધપુર આવી જુખાની રણુ કરી. બીજાવાર પણ

વીરોધીપક્ષ તરફથી વાંધો લેવામાં આવ્યો અને ત્રીજીવાર જુખાની લેવા રાજ્યના વચોવૃદ્ધ કાળ હતા તેમને મોકલવામાં આવ્યાં. રાજ્યમાં તેમના જેટલો વીશ્વાસુ બીજો કોઈ માણુસ નહોતો. અને તે પણ ઉંટ ઉપર એસી પૂજ્યશ્રીની જુખાની લેવા આવ્યા તે વખતે પૂજ્યશ્રી પાસે ઈતર સમાજના નાયકો બેઠા હતા. દરેક ધર્મેની તુલના ચાલતી હતી ત્યાં કાળનું આગમન થયું. બંને વીક્રાન આત્માઓ લેગાં થયા દરેક ધર્મેને સમન્વય કરવાની પૂજ્યશ્રીમાં અગાધ શક્તિ જોઈ વચોવૃદ્ધ કાળ પણ અંજાયા.

વાંચક, પૂજ્યશ્રીની પ્રતીલાજ મોટા વીક્રાનો અને મહર્ષિઓને ગાળી નાંખે તેવી હતી. અપૂર્વ સંયમનોઝ આ પ્રલાવ છે. પ્રખર સંયમ વગર આવો પ્રલાવ ન પડે. સત્યનો સૂર્ય જ્યાં જાય ત્યાં પ્રકાશ કરેજ અને તેના પ્રતાપે અસત્ય રૂપી ધુવડો ગલરાયા વીના ન રહે. કાળની સાથે પૂજ્યશ્રી જ્ઞાનચર્ચામાં પડ્યા એ કલાકની જ્ઞાનગોદિશે કાળનું મન હરી લીધું. પૂજ્યશ્રીની જુખાની લઈ કાળ જેધપુર ગયા. અને પૂર્વની જેમ જુખાની સુકી. અને ત્યાર પછી કોઈ તરફથી પૂજ્યશ્રીના લાભમાં ઠરાવ બહાર પાડ્યો. વીરોધી પક્ષ પરાળત થયો. રાજ્ય તરફથી પૂજ્યશ્રીને ૧૦૧ રૂપીયા લેટ આપ-

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

વામાં આંધ્રાં. વીરોધીઓના સ્લાન મુખ થઈ ગયા. આટલી મહેનત, તનતોડ પ્રયત્નો કરવા છતાં આવી નીરાશા મળી પણ હવે શું થાય કાંઈ ઉપાયજ નહોતો એટલે શું થાય? અન્ય સમાજમાં તો પૂજયશ્રીનું ધાર્ણાંજ માન વક્ષ્યું. ચારે તરફથી હેરાન કરવામાં વીરોધીઓ ન કાવી શક્યા ત્યારે શાન્ત થઈને એઠા ત્યારથી સાદગીમાં બંને સમાજમાં મોટો કલહ પ્રવેશી ગયો કે અત્યાર સુધી જ્યાં સંપનું નામ નથી. આજે પણ આ વાત સાદગી અને આસપાસના ગમોમાં પ્રસિદ્ધ છે. તોક્કાની મામલો અધો શાંત પડી ગયા પછી પૂજયશ્રી ત્યાંથી વિહાર કરવાનો વિચાર કરવા લાગ્યા.

અન્યત્ર વિહાર.

વાંચક ! પૂજયશ્રી હવે સાદડીથી આવક વર્ગની સાથે વિહાર કરી મરુભૂમીના નાના મોટ, ગામોમાં વિચરવા લાગ્યા. પૂજયશ્રીની આ મુસાફરીમાં પૂજયશ્રીને મારવાડના ઘણાં સ્ટેટો ઉપરાંત જેધપૂર પોલીટીકલ એજન્ટ વિગેરેની મુલાકાત થઈ હતી. અતુક્કે પૂજયશ્રી મારવાડ તેમજ કચ્છ પ્રદેશમાં વિચરતા. શારીરિક ઉપસર્ગોને સહુન કરતા અડહની દાળ અને રોટલો જ ઓારાક હતો જેથી ત્યાં પણ તેમના ઓારાક સંબંધી વાંધો હતો જ નહીં. આ રીતે ધર્મ ઉદ્ઘોત કરતા કચ્છમાંથી વિહાર કરી પાછા મારવાડને રસ્તે વિચરતાં વિચરતાં જયપુર અજમેર, વિગેરે શહેરો ઉપર થઈ રાણી સ્ટેશને

∴ ૧૧૬ ∴

પધાર્યા. ત્યાંથી સોનાણું, ગામમાં કે જ્યાં પહાડની વચ્ચે લોંકાગંધીની ગાહીના અધિષ્ઠાયીક શાસ્ત્રન હેવનો નિવાસ છે ત્યાં પૂજયશ્રી પૂર્વે આવી ગયેલ હતા. છતાં સાહીનું સંકટ નાશ થઈ ગયું તેથી ખીળુવાર શાસનહેવ આગળ ત્રણ દીવસ અઠમ તપ કરી ત્યાંથી ચોથા જ દીવસે પારણું ત્યાં ન કરતા પાછા ફર્યા અને રસ્તાના ગામોમાં પારણું કરી અનુકૂમે વિચરતા વિચરતાં સંવત ૧૯૭૬ નું ચાતુર્મસ કીસનગઢ શ્રી સંધના આગ્રહથી ત્યાં પધાર્યા. ચાતુર્મસમાં સવારના ધર્મ પ્રવચનમાં હજારોની સંખ્યામાં આવતા શ્રોતાઓ સમક્ષ સંસારના સુખને અનિત્ય સમજાવી અનેકોને વિતરાગ ધર્મના રાગી બનાવ્યાં. ચાતુર્મસની પૂર્ણાહૃતી કરી વિહાર કરતા જ્ઞાનદિષ્ટિની વીશાળતા સમજાવી. અસ્ત થઈ ગયેલા જીવનને ઉદ્ઘયનો માર્ગ હેખાડતા પૂજયશ્રી સંવત ૧૯૭૭ નું ચાતુર્મસ કરવા બાલાપુર સુકામે પધાર્યા. લક્ષ્મિવાન આત્માઓએ લક્ષ્મિના વાત્સલ્ય ભરપુર માનસથી પૂજયશ્રીનું ચાતુર્મસ પૂર્ણ કરાવ્યું. ત્યાં એકવાર કારતક વહમાં રાત્રીના સમયમાં આંત્રીક્ષમાં જાળે આવ્યા હોય તે પ્રમાણે એ દીગંખરી સાધુઓ પૂજયશ્રીને વંદણા કરવા આવ્યા હતા અને વંદણા કરી ચમત્કારી રીતે કોઇને દર્શન ન આપતા અદર્શ્ય

रीते पूज्यश्री आगणथी विहार करी गया ते मुनी
राजनी पछवाडे तेच्चोश्रीने वળाववा थीज्ञ यतिच्चो गया
त्यारे थेाडे सुधी साथे रह्या अने पछी अहश्य थधु
गया. हीगं भर मुनिच्चोनी आवी अन्धीतीय शक्तिनी
वात पूज्यश्री आगण आवी यतीच्चोच्चे करी त्यारे
पूज्यश्रीच्चे पणु तेच्चोनी शक्तीमां वीक्षास मुक्ये.
त्यार पछी बालापुर मुकामे श्री संघना अत्या-
यहुथी मागशर सुह ११ करी त्यांथी विहार कर्ये
भराडना गामोआ विचरता त्यांथी नागपूर वीजेरे
नाना मेटा शङ्करैमां विचरी पूना तरझ आ०यां.
महाराष्ट्रीय प्रब्लमां धर्मनो घोष वरसावता महाराष्ट्र
अने भराडमां पूज्यश्रीने गुजरात अने काढीयावाडनी
अपेक्षाचेधामींक अलीमान विशेष जणायुं हतुं.
महाराष्ट्रनो प्रवास पूर्णुं करी गुजरात तरझ पधारी
संवत १६३८ नुं चातुर्मास करवा वडोदरा मुकामे
पधार्या त्यांथी चातुर्मास पूर्णुं करी काढीयावाडनी
भुमीने करी पवीत्र करवा संवत १६३९ नुं चातुर्मास
करवा जुनागढ मुकामे पधार्या.

चातुर्मासमां वांचक सांलणवा प्रमाणे ते वभ-
तमां जुनागढ स्टेटनो कंधक केस चालतो हतो.
हिवान सांडेख बाउद्धीनलाईने पूज्यश्रीना आवा
गमननी खण्डर पडी तेथी तोषाखाना उपर उपरीपण्य

લોગવતા શેઠ કૃપારામલાઈને કણું કે તારા શુરૂ
પધાર્યા છે અને તેઓમાં ધણ્ણા પુરુષો ચમતકારી હોય
છે માટે અપણા કેસ વીષે તેમની આગળ વાત તો
કર ? મહાપુરુષની દદ્ધિથી કદાચ આપણુને લાલ મળી
જાય દિવાન સાહેખની વાત સાંલળી કૃપારામલાઈએ
સાંજના ટાઈમમાં પૂજયશ્રી પ્રતિકમણુ કરી રહ્યા પછી
એકાંતમાં હતા ત્યાં પૂજયશ્રીને કેસ સંબંધી વાત કરી.
કૃપારામલાઈ ઉપર પૂજયશ્રીની અનહદ કૃપા હતી
તેથી વાત સાંલળીને પૂજયશ્રીએ નવકાર મંત્રના
પાંચ પદ યંત્રના આકારે ગોઠવી કૃપારામલાઈને
આપ્યાં. વાંચક ! સંચમ અને તપના સાન્નિધ્યથી
જેની શક્તિ અતુલ છે અને સંચમનો પ્રલાવ અહ-
રનીશ જેની મદ્દહમાં છે એવા પૂજયશ્રીએ આપેલ
નવકાર મંત્રની વિભૂતિથી સ્ટેટના લાલમાં તત્કાલ
પરીણુામ આવ્યું. જે કેસનો નીકાલ વરસો થયા
નહોતો આવતો તે આ મહા પુરુષના પ્રલાવથી
તત્કાળ આવ્યો એમ સ્ટેટને જાણ થઈ. જુનાગઢ
સ્ટેટમાં ધણ્ણા ફકીરો મઠધારી મહાતો ખાવા અને
સાધુઓને સ્ટેટ તરફથી ગામ ગરાસ મલ્યા છે તેમ
આ મહાપુરુષને પણ રાજ્ય તરફથી ગામ આપવા
નોઈએ એમ રાજ્યે નક્કી કર્યું. અને ત્યાર પછી
રાજ્યના હુકમથી દિવાન સાહેખ બાઉદ્ધીનભાઈ પૂજય-

श्राने भगवा जुनागढ संघने टाईम क्लैवडांयो ने
टाईम जल्दांयो होतो ते टाईमे हिवान साहेब
ओक गामनो ३४्को लभी साथे लध पूज्यश्रीने लेट
धरवा उपाश्रये आववा रवाना थया.

ते वभतमां संघना अत्रेसरो उपाश्रयमां ऐठा
हुता. उपाश्रयना प्रवेश क्षारथी हिवान साहेब
दाखल थया तेज वभते पूज्यश्री उपाश्रयना थोळ
क्षारथी जंगल जवाना बहाने बहार नीकणी गया.
हिवान साहेब आव्या अने पूज्यश्री बहार गया
ओम सांखणी हिवान साहेब जरा हस्या. अने संघना
अत्रेसरोने कहुं के अमारा जेवा पामरोने ए महा-
त्माना दर्शन क्यांथी थाय ढुँक समय पूज्यश्रीनी
राह जेई पूज्यश्री न आव्या त्यारे हिवान साहेब
आव्या गया. हिवान साहेबना गया पछी पूज्यश्री
तरतज आव्या. थाडा हिवसना जवा पछी केईने
भभर आप्या वगर अचानक हिवान साहेब पूज्यश्री
आगળ आव्या नमन करी चरणुमां ओक गामनो
३४्को मुक्ये. पूज्यश्रीओ गाम लेवानी ना पाडी.
अमने ए गामनो भार सहन न थाय कारणु के
गामनो भार अमने कर्त्तव्यथी विमुख भनाव-
नारो छे. पूज्यश्रीनो जवाब सांखणी हिवान
साहेबे विचार कर्यो के महाराजश्रीने ओक गाम

આચાર્ય શ્રી કલ્યાણયંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

ઓછું પડતું હશે એટલે એ ગામ લેવા વિનંતી કરી. એટલે કરી પૂજ્યશ્રીએ કહ્યું કે મારે ગામ ગરાસ કાંધ જોઈતો જ નથી. હું ગામ સ્વીકાર્ડ તો મારી પાછળના શિષ્યો ગામની આવકથી આગસમાં પડી કર્ત્વંય ભુલી જય ગૈયરી લાવી આહાર કરવાની અમારી પ્રથા પણ આવકના જોરથી અમારા શિષ્યો ભુલી જય માટે આપ ગામ સંબંધી આચ્રહ કરશો જ નહીં. હિવાન સાહેણે પૂજ્યશ્રીની નિઃસ્પૃહ ભાવના સાંભળી ત્યાર પછી ધર્મના શફ્ફો પૂજ્યશ્રી આગળથી શ્રવણું કરી પોતાના બંગલે આંયા. આ રીતે જુનાગઢ સુકામે પૂજ્યશ્રીએ ચાતુર્માસ પૂર્ણ કરી વિહાર કર્યો. આસપાસ રહેલા ગામો ખીલખા, મેંદરડા, વીસાવહર, વીગેરે સ્થળોએ કૃતા રજવાડાના નીયમ પ્રમાણે પૂજ્યશ્રીને રાજ્યો પણ માન આપતા. ખીલખા નરેશ પણ પૂજ્યશ્રીના ધર્મદેશના સાંભળવા જ્યારે પૂજ્યશ્રી ખીલખા આંયા ત્યારે દરરોજ સભામંડપે પધારતા. થ્રાભ્યજનતામાં ધર્મનું સિંચન કરતાં કર્ત્વંયનો ષાધ આપતા શોષકાળ ગામડાએમાં રહી પૂજ્યશ્રી સંવત ૧૯૪૦ માં દીવસંઘના અતિ આચ્રહથી ચાતુર્માસ કરવા દીવ સુકામે પધાર્યા. ચાતુર્માસમાં પ્રાતઃકાળે વ્યાખ્યાનમાં આત્માનું અસ્તીત્વ સ્વીકારવાવાળા આસ્તીક મનુષ્યોને તથા

अर्धदग्ध स्थितिवाणा मनुष्योने कर्तव्यनो मार्ग समजवी जैनत्वनो ख्याल भतावता. भारतमां लिङ्ग लिङ्ग वाहो, भतो अने दर्शनोनी भूल भूलवण्ठीमां अटवाइ कयो धर्म, भत अने पंथ साच्यो ए निश्चय करवुँ व्यक्तीगत मनुष्योनी खुद्धिथी पर बन्धुँ छे. एवा आत्माओ समक्ष वितराग प्रणित जैनधर्मनी व्याख्या समजवता हिव्य दृष्टि उत्पन्न थया शिवाय सत्य शोधक वृत्ति आत्मामां आवती नथी. तेम कडेता. दश्यमान ग्रलोलनो, ए सुवर्णनी ऐडी छे. अने तेमां एक एवुँ अद्वितिय आकर्षणु छे कु ए ऐडी पहेरवानुँ कौँ न कडे छतां जगतना अज्ञान मानवीओ स्वेच्छा पूर्वक ते ऐडी पहेरे छे अने तेमां आनंद मानी आत्मविकास अटकावे छे. एम हुनियाना स्वरूपनुँ पृथ्यकरणु करी हररोज पूज्यश्री व्याख्यानमां समजवता. आवी रीते संस्कृतिनुँ रसायन आपता धर्म ज्ञवनमां अनुरक्त थवानो अहुरनीश प्रतिष्ठाध आपता. पूज्यश्रीए दीप मुकामे चातुर्मास पूर्णु कर्युँ त्यांथी मैन अग्नीयारस करी शिष्यो सहित पूज्यश्रीए विहार कयो. पाछा झरता वेरावण, जुनागढ अने राजकौट थर्ड जमनगर पधार्यूँ ज्यां आचार्यो अने थति समाज उपर जडात

આચાર્ય શ્રી કલ્યાણુચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

લેવાનો નિયમ તે વખતે ન હતો. અને સ્ટેટ પણ પૂજયશ્રી ઉપર અનુરક્ત હતું. ત્યાં એક માસ રહી જનતામા આચાર એ જીવનને વ્યવસ્થિત કરવાનું સાધન છે અને ત્યાગ એ આત્માને ઉન્નત કરવાનું સાધન છે એમ સમજલવી ત્યાંથી વિહાર કરી કાલાવડ તરફ આવતા રસ્તાઓના ગામડામાં દુંક મુદ્દત રહી કાલાવડ મુકામે પધાર્યા.

જેની ગાઢીના કર નિમીતે રાજ્ય તરફથી પછેડી અપાય છે ત્યાં પૂજયશ્રીએ આવી ભાવિક લક્ષ્ણોનાં હૃદયમાં ધર્મસિંચન કરી ત્યાંથી વિહાર કર્યો ચાતુર્માસનો કાળ આવતા બગસરા શ્રી સંધની વિનંતીને માન આપી સંવત ૧૯૪૧ નું ચાતુર્માસ કરવા બગસરા પધાર્યા. ચાતુર્માસના કાળમાં ધર્મ ઉપરેશ આપી જનતાને સમજાયું કે આત્મા અને ધર્મનો સંબંધ જ્યાંસુધી પુર્ણરીતે ન થને ત્યાંસુધી આત્માની મુક્તિ અશક્ય છે. તેમ અનેક પ્રકારે વિવિધ શૈલીથી વ્યાખ્યાન શ્રવણ કરવા આવતાર હુન્નરે મનુષ્યોને આત્મધર્મ સમજાવતા.

વાંચક ! ત્યાં પણ બગસરાના લાયાતો અને તેના કુદુંખીઓ પૂજયશ્રીના વ્યાખ્યાનનો લાલ લેવા ચુકતા નહીં. ત્યાં પણ પૂજયશ્રી ચાતુર્માસ

અન્યત્ર વિહાર.

પૂણ્ય કરી નાના તેમજ મોટા ગામોમાં વિચરી
અમરેલી, ધારી, તેમજ દામનગર વગેરે સ્થળોએ
જઈ ગોંડલ શ્રી સંધની અતી આશ્રહભરી
વિનંતીથી સંવત ૧૯૪૨ નું ચાતુર્માસ કરવા ગોંડલ
મુકામે પદ્ધાર્યો.



ગોંડલમાં ચક્રમક.

વાંચક ! પૂજયશ્રી ગોંડલમાં આવતા શ્રી સંઘે
સામૈયાની સંપુર્ણ તૈયારી સહિત પૂજયશ્રીને
ઉપાશ્રેષ્ઠ લાઠ્યાં. સંઘમાં અતુલ આનંદ વર્તાયો.
વાંચક ! ગોંડલમાં પણ પૂજયશ્રીનો વિરોધી વર્ગ
જન્મી ચુક્યો. હતો એટલે ગોંડલમાં પણ જૈન
સમાજમાં જોઈએ તેવી શાંતિ ન હુતી. વેષ પુજા
અને વ્યક્તિ પુજાની ભાવના જ્યારે જગે છે
ત્યારેજ સાંપ્રદાયિક વાડામાં આત્મા બંધાઈ જાય
છે. અને ગુણુ પુજાનું ધ્યેય ભુલાઈ જાય છે.
જ્યારે દીક્ષિતોમાં પૂજાનની ભૂખ જગે છે ત્યારે
સમાજને પોતાનો લક્તા અનાવવા કુટ પ્રયત્નો
કરે છે અને તેથીજ પ્રત્યેક સાંપ્રદાયના વ્યક્તિગત

બેધપુર સ્ટેટ તરફથી મળેલો પરવાનો નં. ૨

આજવંધરનાચણીમતઠે —————



॥મિદ્ધિશ્રીરાજરાજેશ્વરમહારાજાઘિરાજમહારાજા
શ્રીમંતમિંદ્ધીવનનાતનાપાદરખારરીહદમેંગુજરા
તીકૃદ્ગાગઠરામિરીપૂજજૈવદરામરાવગજસામરામદ
મંદરાહૈનિંદામરાવગાંતીવાંહણવંકરાવગૈરેઝાયપદ
રંણારૈઝપામરૈઝાવમીદંણાંરોમેવાપોજતાવીસાન્દેરે
માડ્રોઈમતૈષપામરોદાવણનપાવૈમબાન્ધદેરાપો
મસુદ્રોમુડ્રોમસપામતાષળાદ્જોધપુર

દીક્ષિતો આડકતરી રીતે પોતાના સંપ્રદાયનું ખંડન
અને બીજા સંપ્રદાયનું ખંડન કરતાં જ હોય છે.
વાંચક ! શરીરથી સાધુ થવાની સાથે મનથી જો
સાધુ થવાય માથાની સાથે મનને જો સુંડાવાય
તો જ સાચો ત્યાગ જીવનમાં આવી આત્માને ઉજવળ
બનાવી શકાય. જેએ સમાજને સંપનો પાઠ
શીખવવા સાધુ થયા છતાં તેઓમાંથી સંપ્રદાયનો
એરી કીડો નાશ ન થાય તો શાસનનો વિજય
કચાંથી થાય ? મૈત્રી એ ધર્મ હોય તો પરસ્પર
મૈત્રીભાવને જગાડવા સાધુએ તત્પર થવું જોઈએ
પણ કચાંથી થવાય ? જ્યાં સાધુ જીવનને પતિત
કરનારી તૃટીએ જે સંયમના આદર્શોને પ્રતિકુળ
અને નાશરૂપ બને તે દૂર કરવાને બદલે સમાજ
તેને પુષ્ટી આપે એવા સાધનોની સગવડ કરી
આપનાર પણ શ્રાવક વર્ગ પોતાના કર્તાંય પંથ
ઉપરથી સરી પડતાં શીથીલ સાધુએ ને પણ લેતા
જાય. જૈન સમાજ સાધુએ માં દિવ્યશક્તિ જીએ છે.
અને જેતો આઠ્યો છે. પ્રાચીન જૈનોની સાધુએ
ઉપર ધર્ણીજ પુન્યભાવના હતી અને તે પ્રાચીન
સાધુ વર્ગ એકાંતે પવિત્ર હતો તેથી તેઓના ગુણો
અને શક્તિનાં ચારે તરફ વર્ણન થતાં અને તેજ
સમયથી સમાજે એવું બંધારણ ઘડયું કે, જે

આચાર્ય શ્રી કલ્યાણુચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

બંધારણુના પ્રતાપે સાધુઓના અવગુણો ન જોવાય અને પૂજન્ય ભાવના ઉપર શાંકા ન લવાય. એ હૈવી હક્કની માન્યતા પરાપૂર્વથી ચાલી આવતા જૈન સમાજમાં એવા પાયા મજબુત ખનાવ્યાં છે કે વી હક્કની ખુમારીમાં સાધુ સમાજના અસહ્ય અત્યાચારો સામે આંખમીચામળ્યો કરવા પડે છે. જૈન સમાજના વર્તમાન મનોદશાના આ સ્વરૂપને જોનાર કોઈ પણ વિચારક ગભરાયા વીના ન રહે. અસ્તુ.

વાંચક ! પૂજયશ્રી ગોંડલમાં આવી ચાતુર્માસ રદ્ધા. વ્યાખ્યાનથી જૈન તેમજ જૈનેતર સેંકડોની સંખ્યામાં પૂજયશ્રીના વચનામૃતો સાંલળી સંતુષ્ટ થતાં, અને ત્યાગ, પ્રત્યાખ્યાન અને એવી ધર્મની કરણી, ચાતુર્માસમાં આવકો કરતા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાનુસાર સહુપદેશથી પૂજયશ્રી ધર્મ અને સમાજની સારી સેવા બજાવતાં. શુદ્ધ સંચયમનો પ્રભાવ જ એવો છે કે જ્યાં જ્યાં ત્યાં વિજય ધવજ ફરકે. પૂજયશ્રીએ વ્યાખ્યાન દ્વારા જનતાને સમજાયું કે ગુણુનુ રાગી થાએઓ. વૈરભાવનો ત્યાગ કરે. વાડાએનો મોહ ન રાખો. સર્વ ધર્મ પ્રત્યે સમદૃષ્ટિ રાખો. વીજેરે પક્ષપાત રહિત ઉપદેશથી જનતાને પણ આનંદ થતો બહાર ગામના મેહમાનો માટે ગોંડલ શ્રીસંઘે ખીલાએની જેમ સારી વ્યવસ્થા

રાખી હતી, પૂજયશ્રી સાથે રહેલા ઘોડા વિગેરને ખર્ચ ગોંડલ રેટ તરફથી અપાતો. આ રીતે ગોંડલમાં પૂજયશ્રીના આગમનથી અપૂર્વ આનંદ વતર્ધિ રહ્યો હતો. ગોંડલમાં પૂજયશ્રી ઉપરાંત તેમના વિક્ષાન શિષ્યરત્ન ખૂબચંદ્રજી અને હીલહીવાળા માણ્યુકચંદ્રજી એમ કુલ થાણું તેત્રીસ બિરાજમાન હતા તથા શિષ્ય વર્ગમાં મુખ્ય ઉદ્યયચંદ્રજી તથા મહારાજશ્રી છગનલાલજી બાલ્યા વસ્થામાં ખીજ શિષ્યોની અપેક્ષાએ મુખ્ય હતાં. પૂજયશ્રીને મહારાજશ્રી છગનલાલજી ઉપર અનહુદ પ્રેમ હતો. પૂજયશ્રીનું દીક્ષીત શિષ્યમંડળ હુમેશાં સંયમને મળતી કિયાએમાં જ અને સ્વાધ્યાયમાં જ તદ્વીન રહેતું પૂજયશ્રી ખીજ ગામોની સાથે પત્રવ્યવહાર રાખવામાં રાજ નહોતાં. જેને અંગે જ્ઞાન ચર્ચા સિવાય ખીજ પ્રવૃત્તિ નહોતી. અપોરના ટાઈમમાં પૂજયશ્રી પોતાના શિષ્યો તથા આવકેને જૈન અને આર્ય સંસ્કૃતિનું ભાન કરાવવા કહેતા કે શુદ્ધ જીવન ગાળી આત્મણળ ખીલવી આત્માની ઉનનતી કરવી તે આર્યના પ્રાચીન સંસ્કારેનું સત્ત્વ છે. આધિલૌતિક સિદ્ધાંતો અધ્યાત્મિક પ્રકૃતિને આડે કદ્દી આવી શકતાં નથી. શિષ્યોને જ્યારે પૂજયશ્રી તેઓની ભૂમિકાનું લાન કરાવતા ત્યારે કહેતા કે સંયમના મહાસાગરમાં તમારી જીવન

નૌકા જંપલાવતી વખતે તમારી જંદગીની હીશા ખદલતી વખતે ત્યાગનો વેષ પહેરતી વખતે કરેલી પ્રતિજ્ઞાઓ ચાહ રાખજો. એ મંગલ મૂહૂર્તમાં મળેલા મંત્રોનું સ્મરણુ કરજો. કૃતિને ખાતર આવકોના મોઢાંમાંથી પ્રશાંસાના શાખ્દો સાંલળવા માટે તમારા આત્માના અવાજને ઝંધશો નહીં. તમે તો હુનીયામાં સ્વતંત્ર છો. આધિલૌતિક સંપત્તીઓમાંથી પર હોવા છતાં શરીર તેમજ આવકોની ગુલાભી કેમ આચરી શકો. તમારુ કર્તાંય કરી પછી જ આવકો તરફ લક્ષ રાખો. વિક્રાન કહેવડાવવામાં આત્માની ઉન્નતી નથી. સમાજને બોધ આપવામાં પણ આત્માની મુક્તિ નથી પણ પોતે પોતાના અત્માને બોધ આપવામાં આત્મની મુક્તિ છે એમ પૂજયશ્રી શિષ્યોને ધર્મ સમજાવતા. અને ગોંડલમાં પ્રતિલાપૂર્ણ કાળ નિર્ગમન કરતા હતા.

વાંચક ! પૂજયશ્રીની પ્રતિલા, હિંય વાણી અને અસરકારક ઉપદેશથી જૈન સમાજના તણુ ચાર માણુસો તો બણી રહ્યા હતા પણ પૂજયશ્રીની તેજસ્વી પ્રતિલાથી વિરોધી વર્ગ ચુપ રહ્યો હતો. ચાતુર્માસમાં આવતાં પર્યૂષણુ પૂર્ણ થયા. દિપોત્સવી ગઈ. કારતક માસ શરૂ થયો. પૂજયશ્રીનું ચાતુર્માસ સહિસલામત પસાર થાય એ વિરોધી માનસથી પર હતું. નીમીતા

મળતાં, હૃદયની ઉકળાટ શક્તિ મગજને તપાવી,
કેલાહલ મચાવવા વિરોધી માનસ વાટ જોઈ રહ્યું હતુ.

સાંલળવા પ્રમાણે તેજ વખતે ગોંડલમાં
ચાતુર્માસ રહેલ શીક્ષીત મહાસતિલુ ગૌચરી લઈ
ઉપાશ્રેયે જતાં લોંકાગંછ ઉપાશ્ર્ય આગળથી નીકળતા
અચાનક ઉપરથી પાણીના છાંટા પડ્યા અને મહાસતી-
લુએ ઉપાશ્રેયે જઈ સૌભ્રય દૃષ્ટિએ આવી રીતે બનાવ
ખન્યો તેમ સંઘના માણુસો આગળ વાત કરી. સંઘે
તે વાત અનાણુતા પાણી પડી ગયું હશે તેમ જાણી
તે વાત વીસરવા પામી. ખીંચ દિવસે વાયુ વેગે વાત
ફેલાતા ત્રણું ચાર માણુસોના કાને આ વાત આવી
(નામની જરૂર નથી.) તેમનું અંતર તો પૂજ્યશ્રીની
પ્રતીલાથી બળી કલેશ કરવા ક્યારનું તૈયાર હતુ.
તેઓએ આ વાત સાંલળી અને કોધિત થઈ ગયા.
સંઘના પ્રતિષ્ઠિત મનુષ્યોના ઉપરવટ થઈ પૂજ્યશ્રી તથા
અન્ય યત્તિવર્યોને શીક્ષા કરવા તૈયાર થઈ પોતાના
વર્તુલમાં રહેલા નાની સંખ્યાના ટેણાને લઈ નીકળવા
નિશ્ચય કર્યો. મહાસતિલુએ આ વાત જાણી ત્યારે
એમ કહેવાય છે કે તેઓએ પણ ચાર પાંચ બ્યક્ઝિટ-
ઓને ધણી રીતે સમજાવી પણ તે ન સમજી
શક્યા. અને જણે વૈરવાસીત હૃદયની એમ તેઓ
પોતાના સંઘર્થી પણ અધીક થઈ એક તરફ આખો

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

સંધ નારાજ હોવા છતાં ચાર પાંચ માણુસો પોતાના નાના ટોળા એટલે બીજા ત્રણુચાર માણુસોને લઇ લાકડીએ સહીત લોંકાગંધ ઉપાશ્રીયે આવવા રવાના થયા. ગોંડલમાં પણ આ વાત પવનવેગે કરી વળી હતી. લોંકાગંધના શ્રાવકો ઉપાશ્રીયે લેગા થઈ ગયા હતા અને સૌની સ્થીતિ નિશ્ચયકારક નહોંતી થઈ. પરિણામથી સ્વા ચિત્તાતુર થએલા હેખાતા હતા. ભયનું સાચાન્ય શ્રાવકોમાં ઠથાપી ગયું હતું. આધ્યાત્મિક મૃત્યુ તો તેઓએ કરી નાખ્યું હતું. જ્યારે ઉપાશ્રીય નજીક તે વિરોધી વ્યક્તિએ આવી રહી છે તેમ જાણી શ્રાવકો પૂજ્યશ્રી આગળ આવી ભયની સ્થીતિ સમજાવી રહ્યા ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું. કે અરે લાઈએ અમારે તો વળી લય કેવો. ભય-અસ્ત મનોદશા તો તમને સોંપી. લય તેને જ હોય કે જે મૃત્યુને જીવનનો અંત સમજતા હોય અથવા મૃત્યુ પણીના જીવનને લય અને આપદાનું સ્થાન માનતા હોય તેમને મરણનો લય કંપાવે બાકી જેણું જીવાણીનું ખરેખર સત્ત્વ આત્મજ્ઞાનથી મેળગ્યું છે તેમને જીવન અને મરણ એ એમાં કશો ફેર જણ્યાતો નથી. જીવવાની આશા અને મરવાનો લય એ બન્નેનો નાશ કરી વિચારવામાં જ અમારા સંયમની કસોટી છે. આવી રીતે પ્રેરક

વાણીથી પૂજયશ્રી શ્રાવકેને સમજનવી રહ્યા છે ત્યાં
બીજાઓએ આવી કહ્યું કે આઠ દસ માણુસોનો
મોટો અવાજ પાસે સંભળાય છે. આ શિષ્યોને
કોઈ ખીજે ઠેકાણું અમને લઈ જવા ધો. પૂજયશ્રીએ
કહ્યું કે આ દ્રશ્યમાન જગતમાં કોઈ પણ એવી જડ
શક્તિ નથી કે જે આત્મશક્તિ સામે અજુમી શકે.
કોઈ પણ જડ સાધનો એવા નથી કે જે સાધનો
ક્ષારા આત્મશક્તિનો નાશ થાય.

પાઠક ! આત્મ અનુભવિએ કહે છે કે મનુ-
ષ્યની વાણી વર્તન અને દેખાવ જ વિજયની
ખાત્રી આપે છે. તે પ્રમાણે પૂજયશ્રીની વાણીમાં
અને પૂજયશ્રીના વર્તનમાં વિજયનું ચિનહે દેખાતું
હતું. સંસારીઓમાં ગલરાટ હતો. પણ પૂજયશ્રીમાં
ગલરાટ જન્મ્યો જ નહોતો. તે પૂજયશ્રીની અડગ
આત્મશક્તાનું જ પરિણામ છે. આ બનાવની વાત
દીલહીવાળા માણ્યુકચંદળુને ખખર પડી હતી. તેઓ
પણ આત્મધ્યાનથી સમજને શાંત કરવાનો વિચાર
કરી રહ્યાં હતાં.

પાઠક ! વિરોધી વ્યક્તિઓનો આવો રોષ જોવા
છતાં પૂજયશ્રીમાં તેઓ પ્રત્યે સમલાવ જ હતો.
પૂજયશ્રી આત્મજ્ઞાનીની સાથે સમયસૂચક પણ હતાં.

આચાર્ય શ્રી કલ્યાણશુદ્ધજ મહારાજનું જીવનચરિત.

તેઓની ઉચ્ચતમ બુદ્ધિ કોઈના પણ અવગુણુને
યાદ કરવા અવકાશ જ નહોતી આપતી. તેઓશ્રી
એમજ માનતા અને ભીજને મનાવતાં કે હીર્ઘદૃષ્ટિથી
શાંતિપૂર્વક સમાધાન કરી સમાજનું રક્ષણું કરવું
એ પ્રથમ ધર્મ છે. આવેશના વેગમાં કોધના
અંધકારમાં માણુસ પોતાનું ભાન ભૂલી જાય છે તેવા
મનુષ્યોની હયા ખાવી તેમાં જ તેઓનું કલ્યાણ
છે. સ્વ. સમતામાં ભીજનું રક્ષણું સમાચેલું છે
એમ તેઓ માનતા. પ્રતિપક્ષી વ્યક્તિઓ જ્યાં
આવતી સંભળાઈ તે વખતમાં પૂજયશ્રી ગાહી ઉપર
જઈ ધ્યાનસ્થ સ્થીતિમાં એદાં. તોક્ષાન કરનારી
વ્યક્તિઓ રસ્તે આવતી મહાલક્ષ્મીની દેરી આગળ
આવી અને ત્યાં સ્થંભી ગઈ. કોઈને આગળનો
રસ્તો સ્તુજ્યો જ નહીં. સૌની બહાવરા જેવી સ્થીતિ
થઈ અને જેને જેમ ફ્રાવે તેમ પાછા ફરી સિંહને
નોંધ જેમ શીયાળ ભાગે તેમ ભાગી ગયાં.

પાઠક ! કયાં ગયું તેમનું પાશવી બળ ? કહેવું
જ પડશો કે પૂજયશ્રીની આધ્યાત્મિક શક્તિની સામે
ખળીને ખાખ થઈ ગયું.

પાશવી બળનો આધ્યાત્મિક બળ સામે વિજય
થતો જ નથી, થયો નથી, અને થશો પણ નહીં.

એક આત્મશક્તિ સામે અસંખ્ય પ્રકૃતિ નેમ બળ
વગરની છે તેમ હુન્યવી બળ પણ આત્મશક્તિ સામે
નકામું છે. બધાય પોતાને ઘરે ચાલ્યા ગયા.
ગોંડલમાં આ પ્રમાણે જૈન સમાજમાં ચારે તરફ
અશાંતિનું વાતાવરણ ફરી વહ્યું. જ્યાં જુઓ ત્યાં
એજ વાત અને દિતર દર્શનમાં તો પૂજયશ્રીની
શક્તિના વખાણું પણ થવાં લાગ્યાં. ગોંડલમાં આ
રીતે ભીષણું ચકમકના પ્રતાપે અગ્નિ ઉત્પન્ન થયો.
પણ કોઈને બાજ્યો નહીં અને તે અગ્નિ ઉપર
ભયની રાખ ફરી વળી. અંદર તો સળગી રહ્યો
પણ રાખ બહાર ન ઉડી અને તેથી ફરીથી અગ્નિ
પણ બહાર ન નીકળ્યો. આમ તે સમયમાં ત્રણ ચાર
મનુષ્યોના વર્તનથી જગ્યાર વૈમનસ્ય ઉત્પન્ન થયું.
ખીંજ પણ વૈમનસ્યના કારણો અંદરખાને પહેલાથી
જન્મી ચુક્યા હતા. અને તેનાથી વર્ષોથી ખારસો
ઘરે જે લોંકાગઢના હતાં તે આવા સંકુચીત
માણુસથી અઠારસે અડતાલીસમાં જુદા થઈ ગયા.
અને ત્યારથી જ ગોંડલનો જૈન સમાજ ત્રણ પક્ષમાં
વહેંચાઈ ગયો.

વાંચક ! અત્યારના જુદા જુદા સ્થાનકવાસી
સમાજના વધુ સંધાડા અઠારસે પણી જ થયાં છે.
તે પહેલાં તો લોંકાગઢના યતિએજ હતા જ્યારે

બાદશાહેઠા તરફથી છડી, ચમર, છત્ર, અણાગીરી વિગેરે સાધનો ભષ્યા અને કંધક એ સાધનોનો ઉપયોગ થવા માંડયો એટલે લગભગ ૧૬૯૨ માં આચાર્યની આજા લઈ લવળ ઇથિ વિગેરે કુમે કરી ત્રણુ મહાપુરુષોએ કિયા ઉદ્ઘાર કરી લેંકાગંધીમાં એ માર્ગ કર્યાં. એક સાધુ માર્ગ અને બીજે થતિ માર્ગ પણ તે લેંકાગંધીનાં જ સાધુએ કહેવાતા ત્યાર પણી કાળે કરીને કિયાએ. લિન્જ કરી સ્થાનકવાસી નામ પ્રગટ કરી લગભગ સતરસોમાં શરૂઆત થઈ. લેંકાગંધીથી સાવ લિન્જ પડી ગયાં. લેંકાશાહનાં અનુયાયી ગણુવા છતાં લિન્જતા દેખાવા લાગી અને તે લિન્જતાને અંગે જ ગોંડલમાં પૂજ્યશ્રી ઉપર આફભણુ કરવા ત્રણ ચાર માણુસો આંદ્રા હતા અને ઉપર મુજબ પાછા ફરી ગયાં. દિવસો થયા કલહ દખાઈ ગયો. પૂજ્યશ્રીને પણ આ લિન્જતાથી ધાણું ખરાખ લાગ્યું. ચાતુર્માસ પૂર્ણ થયું એટલે પોતે વિહાર કરવાના હતાં ત્યારે સમાધાન માટે તે અગ્રેસરોને બોલાંદ્રા પણ તેએ ન આંદ્રા. સમાધાન અને સંપની આશા સંકુચીત માનસમાં રાખવી વ્યર્થ છે. શક્ય એટલા મ્રયત્નો સમાધાનને માટે જ્યારે નિષ્ઠળ નીવડચા એટલે પૂજ્યશ્રીએ ગોંડલનો ત્યાગ કર્યો અને ફરી ન

ગોંડલમાં ચકમક.

આવવા સંબંધમાં પણ સંકદ્ય કર્યો. ત્યાંથી વિહાર કરી સુલતાનપુર આવ્યા. ત્યાં ગાઢીનું સ્થાપન કરી દુંક મુદ્દત ત્યાં રોકાધને ત્યાંથી પણ વિહાર કર્યો: કમસર ગામડાઓમાં વસવાટ કરતાં વિચરવા લાગ્યા, ઉપરની હુકીકત નાનાથી મોટા પર્યાત ગોંડલમાં પ્રસિદ્ધ છે.



ગાદી ત્યાગ.

વાંચક ! પૂજયશ્રી સુલતાનપુરથી વિહાર કરી
જેતપુર ધોરાળ વગેરે સ્થળોએ જઈ કાઠીયાવાડના
ખાકી રહેલા ગામડાઓમાં ચેતન રેડતા સાધુધર્મ
અને આવકધર્મ બંને સમજવતા મનુષ્ય જીવનની
તૃટીઓને પૂર્ણત્વ કરી મનુષ્યના હૃદયને અડગ રહેવાનું
સૂચવતાં આચાર્યપદ માટે પોતાના વિક્રાન શિષ્યરત્ન
શ્રી ખુબચંદ્રલુમાં લાયકાત આવી ગઈ છે એમ
મનમાં વિચારી સુંખાઈ તરફ પ્રયાણુ કર્યું. અને
રસ્તામાં કાઠીયાવાડ અને ત્યાર પછી ગુજરાતને
ભેદી સુંખાઈ સુકામે પદ્ધાર્યી. ત્યાં લક્ષ્ણ હૃદયો
ઉપર ધર્મસર્વીચન કરતાં એક માસ રહ્યા. પૂજયશ્રીને
અંગ્રેજ જ્ઞાન નહોનું છતાં અનેક વકીલો, ઐરીસ્ટરો

તથા અન્ય અધિકારીવર્ગ ઉપર પૂજયશ્રીની પ્રતિભા પડી ચુકી હતી. અને તેના પ્રતાપે પૂજયશ્રીનો ઉપદેશ સાંલળવા હરરોજ પધારતાં. ત્યાંથી પૂજયશ્રી ઉરણું જે એક એટ જેવું છે, જ્યાં વૈશ્વવ સમાજ વધારે પ્રમાણુમાં છે. પૂર્વે કોઈપણ જૈન ધર્મને પાળનારા ત્યાં નહતાં તે વખતમાં પૂજયશ્રીએ ત્યાં જઈ ગાઢીનું સ્થાપન કર્યું હતું. અને વૈશ્વવ ધર્મને પાળનારા દશાશ્રીમાળી વણીકોને સત્ય ધર્મની પ્રાપ્તી કરાવી. જૈન ધર્મો વધુ પ્રમાણુમાં બનાવ્યા હતા. ત્યાં પૂજયશ્રી શ્રીસંઘની વિનંતીને માન્ય રાખી ૧૯૪૩માં ચાતુર્મસ કરવા ઉરણું પધાર્યાં જેનું આમ્ય વાતાવરણું પ્રત્યક્ષ આયુનો ખ્યાલ કરાવે એવા ચારે તરફ લીલા રણીયામણ્ણા કુંગરા ઉલા હતા. ઘનઘોર જાડી આવું કુદરતી સૈંહર્ય જ્યાં વિષેશ પ્રમાણુમાં છે ત્યાં પૂજયશ્રી ચાતુર્મસ રહ્યા. પૂજયશ્રીના દર્શનાથે તથા ધર્મઓધ સાંલળવા મુંબદ્ધથી અને ઈતર ગામોથી અનેક કુટુંબો આવવા લાગ્યા. ચાલીસ ઘરની જૈનની કુંક વસ્તી હોવા છતાં લક્ષ્ણિના મહાસાગરથી આવેલ સાધમી લાઇઓની લક્ષ્ણિ કરી પોતાના આત્માને ધન્ય માનતા. ખીણ ગામોની સરખામણીમાં પૂજયશ્રીને ઉરણુના હવા પાણી પણ ધણ્ણા જ અનુકૂળ હતા.

આચાર્ય શ્રો કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

અને તેથી ભક્તિવાન શ્રાવકેના અત્યાગ્રહથી પોતે
ત્યાં જ હવે સ્થીરવાસ રહી જાગૃત જીવન ગાળ-
વાનાં વીચાર કરી રહ્યા હતાં. અને તેને અંગે
ગંધનો તમામ કારખાર વિદ્ધાન શિષ્યરત્ન શ્રી
ખુબચંદ્રજીને આચાર્યપદ આપી ગાઠી ઉપર સ્થાપન
કરી બાકી રહેલું જીવન ઉરણુમાં રહી ધ્યાન અને
જ્ઞાનની ભૂમિકામાં પસાર કરવા વિચાર કરી રહ્યા
હતાં. વિચારેની પરીપક્વ દશા કરી ચાતુર્માસ
પુર કરીને પછી આચાર્યપદ શ્રી ખુબચંદ્રજીને
આપવાને શ્રીસંઘમાં પોતાનો નિષ્ઠા જહેર કર્યો.
સંઘમાં આનંદની તો સીમા જ રહી નહીં. આચાર્ય
પદાર્પણનો મહોત્સવ કયારે વળી આપણા ગામમાં
થાય. આ તો આપણા અહોલાગ્ય કે જેથી પૂજયશ્રીએ
ખુબચંદ્રજીને આચાર્યપદ અહીં આપવાનો નિશ્ચય
કર્યો. સંઘની આગેવાન વ્યક્તિઓ તથા અન્ય
મનુષ્યો પરસ્પર આવી વાતો કરી રહ્યા હતા.
ગ્રામેજામ જ્યાં લોંકાગંધના ધરે છે એવા કાઠી-
યાવાડ, ગુજરાત, મારવાડ, મેવાડ, માલવા, પંનખ
વિગેરે પ્રત્યેક સ્થળોએ ઉરણ શ્રીસંઘ તરફથી
આમંત્રણ પત્રિકાએ મોકલવામાં આવી. પૂજયશ્રીના
કાઠીયાવાડમાં વધારે વખતના પ્રવાસથી કાઠીયાવાડના
સંજગનો પૂજયશ્રીના અનન્ય લક્ષ્ણ બન્યા હતા. અને

પૂજયશ્રીને પણુ કાઠીયાવાડમાં અપવાદ શીવાય દરેક
ક્ષેત્રોથી તેમને સંતોષ થયો હતો. કાઠીયાવાડની
ધાર્મિક શ્રદ્ધા જોઈ પોતે બહુજ ખુશી થયા હતા.
જીવદ્યાનો સાચો સિદ્ધાંત કાઠીયાવાડમાં બહુ સારી
રીતે પળાતો હતો. જીવ દ્યાની ધગશ પાંજરા-
પોળોને પોષણુ આપવાની તમજા કાઠીયાવાડના
નૈનોમાં સારી છે. એમ પૂજયશ્રી પોતાના શિષ્યોને
કોઈ વાર કહેતા. કિયાવાદ જેટલો કાઠીયાવાડમાં છે
તેટલો ગુજરાતમાં નથી. અને કિયા પ્રત્યે અલિર્દ્યી
પણ ગુજરાતમાં નથી એમ પૂજયશ્રી ધર્માચ્છે
વાર બોલતા. દરેક દેશોમાંથી પૂજયશ્રીનો અનુરાગી વર્ગ
અને લોંકાગંધિના અનુયાયીઓ આચાર્યપદાર્પણના
મહોત્સવમાં ભાગ લેવા ઉરણુ મુકામે આવવા લાગ્યા.
મુંબદ્ધથી પણ સેંકડો જી પુરુષો આ મહોત્સવમાં
ભાગ લેવા આવ્યા હતા. સમય જતા ૧૯૪૩ના માગ-
શર શુદ્ધ ૧૩ ને દિવસે પ્રાતઃકાળે મંગલ મુહુર્તે
પૂજયશ્રીએ પોતાના વિક્રાન શિષ્યરત્નશ્રી ખુબ-
ચંદ્રલુને વિધિ સહિત આચાર્યપદવી આપી, ગંધિની
પરંપરા પ્રમાણે ગાદી ઉપર ઘેસાડ્યા. સર્વ સમા-
જને કહ્યું કે આજથી તમારે વર્તમાન આચાર્યશ્રી
ખુબચંદ્રલુની આજા પ્રમાણે ચાલવાતું છે. ઢીક્ષી-
તોને પણ તેજ પ્રમાણે કહ્યું. ખુબચંદ્રલુને પણ

આચાર્ય શ્રી કલ્યાણુચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

શાસનની ઉજ્જ્વલી માટે યોગ્ય પ્રયત્નો કરવાની આચાર્ય તરીકેની ફરજ સંભળાવી. પૂજ્યશ્રી બોલી રહ્યા પછી તરતજ શ્રીસંઘે હાથ નોડી પૂજ્યશ્રીને કહ્યું કે આજથી અમારા આચાર્ય ગણ્ધાધિપતી પૂજ્યશ્રી ખુખ્યચંદ્રજી મહારાજની આજાને જીનેશ્વરની આજા માની તે આજાનું યથાર્થ પાલન કરશું. શ્રીસંઘે પૂજ્યશ્રીને આ પ્રમાણે ખાત્રી આપી તેના ગગન લેદી પોકારો થયા અને આનંદનો ઉત્સવ સમાપ્ત થયો. સવેં પુરુષો વિખરાવા લાગ્યા પોતપોતાના ગામોં તરફ સૌ રવાના થયા. ૧૫ દિવસ રહી કાઠીયાવાડના પ્રહેશમાં વિચરવાની આચાર્યશ્રી ખુખ્યચંદ્રજીએ પૂજ્યશ્રી આગળ ઝડચા જણ્ણાવી. પૂજ્યશ્રીએ કહ્યું કે રાંધ્યામાં શું રાંધવું તે તો મારો ફરૈલો દેશ છે. ત્યાં ઘરનો ધર્મ છે અને કાઠીયાવાડ તે તો માલિકીનો તીજેરી છે. તે જ્યારે ઉધાડશો ત્યારે ઉધાડશો માટે ત્યાં જાઓ કે જ્યાં હું ન ફર્યો હોઉ. ત્યાં જ તમારી વિદ્ધતાને દીપાવો. અને સંયમને કસોટીએ ચઢાવો. પૂજ્યશ્રીના વચનો સંભળી આચાર્યશ્રી ખુખ્યચંદ્રજીએ કાઠીયાવાડ જવાનો વિચાર મુલાંની રાખ્યો. અને ૧૯૪૪ નું આચાર્યપદ મહ્યા પછી પ્રથમ ચાતુર્માસ એ વીર જલણા સુકામે પધાર્યો અને પૂજ્યશ્રીએ હું નિવૃત્ત જીવનમાં જગૃત જીવન

शिरोही स्टेट तरक्ष्या भणेद्वा परवाने।

॥श्रीमारणेश्वरजी॥४॥



॥प्राहारावजीश्रीमावग्निवनाया
ताप्यादरबाररीहृषेकुंकागछराश्रीपु
त्रश्रीजिवद्वीरोसामिक्तीगाजावानाठि
यदामदहृषेखीएमाइहृषवांशावभी
श्रीरग्नरोजतीश्रावङ्गपामैरेदैवरो
ऐगावरत्रागिवाऽतांत्रमडवीक्षरण
तपविक्षान्त्रोगामोवलावदेन्द्रेन्द्रेन्

જીવી સ્થીર વાસો રહેવાનો નિશ્ચય કર્યો હતો. એટલે ઉરણુ મુકામે જ રહ્યા. શ્રાવકો તો દર્શનાર્થી બહાર ગામથી ચાલુ જ હતા. કોઈ દિવસ બહાર ગામથી શ્રાવકો આંધ્રા વગર રહેતા જ નહીં. ઉરણુ બંદરમાં પૂજયશ્રીના રહેવાથી આનંદ ઉત્સવ વતર્દિશ્યો હતો. અને પૂજયશ્રીએ ૧૯૪૩ થી ૧૯૪૭ સુધીના ચાર વર્ષ એક સાથે વસવાટ કરી પસાર કર્યા. તે સમયમાં મુખ્ય શ્રીસંઘ તરફથી મુખ્યદંના ઉપાશ્રયનો જગ્યા જીજું થદ ગાંધી છે. અને તને નવો કરાવવા વાસ્તે મદદને અંગે શું નિર્ણય કરવો તેની સલાહ લેવા મુખ્ય શ્રીસંઘના અંત્રેસરો ઉરણુ મુકામે પૂજયશ્રી આગળ આવ્યા. તે વખતમાં સ્વર્ગસ્થ શોઠ રામજી ભાઈ માધવજીભાઈ કે જેએ પોતાની હૃદાતીમાં પોતાની પૂત્રી બાઈ નંદકુંવરભાઈના લાલમાં એક લાખ રૂપીયાનું દુસ્ત કરી ગયા હતા જેના દસ્ટીએ મુખ્ય નિવાસી શોઠ સોરાખજી શાપુરજી બંગાલી સી. આઈ. ઈ. અને શોઠ ત્રીલોલનદાસ વરજીલનદાસ જે. પી. હતા. આ મોટી રકમનો લાલ લેવા બાઈ નંદકુંવર વધુ વખત ન જીવી શક્યા. કાળના સપાઠામાં અનાદિકાળના નિયમ પ્રમાણે કર્મવશાતું તે બાઈ સપડાઈ ગયા અને સંવત ૧૯૪૭ ના વૈશાખ

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

શુદ્ધ ૬ ને શુરૂવાર તા. ૧૩ મી.મે. ને દિવસે તે ખાઈ ભૃત્યું પામ્યા. ધર્મિષ્ટ નંદકુંવર ખાઈએ પોતાના મરણ અગાઉ એક જ દિવસે :પોતાનું વસીયતનામું કર્યું હતું અને તેમાં પણ ઉપરના ટ્રસ્ટીએ હતા. તેના વસીયતનામામાં રૂ. ૪૦૦૦૦ અંકે ચાલીસ હજાર ધર્મના મકાન ખાંધવા સંખાંધમાં ખરચવાનું ખાઈ લખી ગઈ હતી અને તે લખાણુને અંગે ટ્રસ્ટીએ આ રકમ કયાં ખરચવી તેને વિચાર કરી રહ્યા હતા. તે વખતમાં પૂજયશ્રી ઉરણ બંદરેથી મુંખદ મુકામે આવ્યા અને ટ્રસ્ટીએ આગળ ઉપાશ્રય ખાંધવાની વાત કરી કે તરત જ રૂપીએ પચીસ હજારની મોટી રકમ તેઓએ સંધમાં ઉપાશ્રય ખાંધવા માટે આપી. અને ખુટ્ટી રકમ માટે સંધમાં ફ્રાળો થતા પૂજયશ્રીના ઉપરેશ અનુસાર મોટી રકમ લેગી થઈ અને પૂજયશ્રીના ઉપરેશથી મોટો વિશાળ ઉપાશ્રય એના જેવો મોખ્યા ઉપર મુંખદમાં કોઈ પણ સ્થળો નથી. તેવો ખાંધવામાં આવ્યો. કામની શરૂઆત થતા પૂજયશ્રી પાછા તરત જ ઉરણ મુકામે ચાલ્યા ગયા હતા. સંપૂર્ણ ઉપાશ્રય ખાંધાઈ રહેતા તેને ખુલ્લો મુકવાની કિયા સંવત ૧૯૫૦ ના વૈશાખ શુદ્ધ ૧૧ ને ખુખ્ખવારે મોટા મેળાવડા સહીત કરવામાં આવી હતી. તે વખતમાં પૂજયશ્રી તથા આચાર્યદેવ

શ્રી ખુબચંદ્રજી તથા અન્ય વિક્રાન ચતિએ પણ હાજર હતા. તથા બીજા ગામોના આવકો પણ હતા. તે સર્વની સમક્ષ પૂજયશ્રીએ ઉપાશ્રી ખુલ્લો મુક્યો. અને તે વખતે પૂજયશ્રી આચાર્યશ્રીને વ્યાખ્યાન કરવાની સૂચના કરી કે તરત જ ઉપાશ્રીમાં પૂજયશ્રી સાથે પાટ ઉપર જેમની બેઠક હતી એવા આચાર્યશ્રી ખુબચંદ્રજીએ વ્યાખ્યાન કર્યું. ટાઇમ પૂર્ણ થતા સર્વો વિભરાયા. હિવસો જતા પૂજયશ્રી પણ પાછા ઉરણુ મુકામે પધાર્યો. અને હવે પછી કોઈ પણ ઠેકાણે જવું નથી એમ નક્કી કરી ઉરણુમાં રહ્યા. પૂજયશ્રી ગાઢી ત્યાગ કરી ઉરણુમાં જાયત જીવન જીવતાં પાંચ વર્ષ પસાર કર્યા એટલે સંવત ૧૯૫૦ માં મુંબઈનો ઉપાશ્રી ખુલ્લો મુક્યા પછી ઉરણુમાં ૧૯૫૫ ની સાલ સુંધી આત્માનું ધ્યાન ધરતાં પાંચ વર્ષ પૂર્ણ કર્યા.

પૂજયશ્રીનો સ્વર્ગ વાસ અને હિંદુ અગિનસંસ્કાર.

વાંચક ! પૂજયશ્રી કલ્યાણુચંદ્રલુએ સંવત
 ૧૯૪૩ થી ૧૯૫૫ સુધી ઉરણુ મુકામે કાળ વીતાંયાં
 પછી, ૧૯૫૬ ની સાલ બેઠી. વાંચક ! તે સાલનું
 વર્ષનાં બહુ કૂર છે. ભારતમાં તે વર્ષમાં સંકટોનો
 પાર નહોતો. હૃદકાળના કારણે અનેક કુદુંઓ બુખમરો
 વેઠી સ્વધામ પહોંચી ગયાં હતાં. ગરીબોની લથાનક
 યાતના અને બુખની કીકીયારીઓની સાલ તે ૧૯૫૬
 ની સાલ, તે સાલમાં બુખના અગિનને શાંત કરવા
 પીતાએ પુત્રને વેચી પેટનું પોષણ કર્યું. માતાએ
 પુત્રીને વેચી પેટનું પોષણ કર્યું. કેટલાએ કુદુંઓ
 નિર્દોષ ખાળકોને ઘરમાં મુકી ચાલ્યાં ગયાં. ભાઈ-
 ઓએ બેનને વેચી પેટનો ખાડો પુરો. સંતાન

પૂજયશ્રીનો સ્વર્ગવાસ અને હિંબુ અભિસંસ્કાર.

વગરની માતાઓએ શરીરને વેચી ઉદર નિર્વાહ કર્યો, અને કેટલીક બળવાન વિરાંગનાઓએ શરીર વેચી પેટ ભરવા કરતા મરણુને લેટવું એજ શ્રેયસ્કર લાગતા શીયળને સાચવી લુખના હુઃખમાં રીણાતી કંઈક ખાળાઓએ જીવન ખલાસ કર્યું. કેટલાક હીંચકારા મનુષ્યોએ અજ્ઞ અને પાણીની લાલચ આપી કેટલીએ ઝીંઘોના શિયળ ભષ કર્યા. દાને-ક્ષરી શ્રીમંતોએ પોતાની શક્તિ અનુસાર મદ્દના સાધનો ઉલા કર્યા. પણ કુદરત જ્યાં વિરુદ્ધ હોય ત્યાં માનવી શું કરે ? હુંકાળના સપાઠમાં અનેક ઐડુત કુદુંબો પાયમાલ થયાં કંઈક ઐડુતોએ પોતાના જીવન ગુમાંયાં કદ્યક ઐડુતોએ આત્મધાત કર્યા. જે ઐડુતો કુદુંબો સહીત, સ્વી પુત્રો અને નાના નિર્દેખ બચ્ચાઓ પણ હુનીયાને અજ પુરુ પાડવા હળે જોડાય કારમી યાતના વેરી અજને ઉત્પન્ન કરવા મળુરી કરે અને તે સમયમાં હુંકાળ પડે તો વાચક શી સ્થીતી થાય ? જે હુનીયાને અજ આપવા એ જગતનો તાત પોતાના કુદુંબને સમર્પણ કરે તે ઐડુત જ્યારે કુદરતથી દંડાય ત્યારે હુનીયા તરફથી મદ્દ ન મળે તો જીવનની સમાઝી કર્યા વગર બીજું શું કરે ? અને તંજ પ્રમાણે છુપનીયમાં હુનીયા તરફથી મદ્દના અલાવે કંઈક

એડુતોએ પોતાના જીવનથાત્રા સમાસ કરી. અને છપનની સાલમાં તે ગોઆરા વર્ષ ઉપર માનવી સંહારનું કલાંક ચોંટયું. તે છતાં વાંચક! ભારતમાં તો દર વર્ષ એડુતોની વિષમ સ્થીતિ જ હેણાય છે. દર વર્ષ માંડમાંડ પોતાનું પેટ લરી શકે. સોળ આની વર્ષ તો નજરે જોયું જ ન હોય વરસે થાડા ધણા પૈસા વધે તે હેવા પેટે વ્યાજમાં લરવાના હોય, અને વ્યાજના ખ્રેપરમાં દર વરસે ચુસાતો જ જાય, એના માથા ઉપરથી હેવું તો ઓછું થાય જ નહીં, પછી કયાંથી ભારત સુખી થાય. “ ભારતને જીવાડનાર એડુત જો ભરશે તો ભારત કયાં સુધી જીવશે ” ભારતનું જીવન એતી ઉપર છે. હિંકુસ્તાન એતીપ્રધાન દેશ છે. એતી અને ગૌસેવા એ પ્રત્યેક હિંદ્વાસીનું પૂર્વે ધ્યેય હતું. સમય પલટાતા જૈનોમાં કેટલાંક એવાં મુનીરાને થયા કે જૈઓએ તે ધ્યેય જૈનોમાંથી નાથ કરાવી નાખ્યું. અને જૈનોએ તે થડુણ કરી કાળ જતાં ગૌસેવા અને એતીને દેશવટો આપ્યો. સ્વાશ્રયી જીવન પરાધિન બન્યા. શરીરની મજબુતાઈ ગઈ અને માયકાંગળાપણું આવ્યું. ધર્મ ગયો અને રૂઢી રહી. વૈતન્ય ગયું અને જડ રહ્યું. પૃથ્વીની અંદરથી રસ પણ ગયો. કુદરત તરફથી ફુકાળીયા વરસો આવવા

લાગ્યાં, અને છપનીયામાં અનેક કુદુંબો એ હાલ થયા. છપનની સાલ તે ગરીબોની લયાનક સાલ પાણીના ત્રાસથી કંઈક પશુઓ, કંઈક મનુષ્યો મરણું પામી માનવી સંહારના આંકડામાં વધારે કર્યો. કુર એવા છટપનીયાએ દેશમાં હાહાકાર વરતાવી હીધે! પણ ભાગ્યવાન પુરુષો આવા દેશની કુર હુદ્દશા નથી જેતા. જેમ ભગવાન મહાવીર જ્યારે ભારતવર્ષ ઉપર એ હળવ વર્ષની સ્થીતીને ભસ્મગૃહ એસવાનો હતો તે પહેલા મોક્ષમાં પહોંચ્યો ગયા. તેમ દેશની ખરાબ સ્થીતી અને લયાનક હુદ્કાળ પૂજયશ્રીને પણ નહોતો જેવો. અને તેને માટે કુદરત પણ અનુકૂળ થઈ જેથી ૧૬૫૬ ની સાલ એઠી અને પૂજયશ્રીની તખીયત નરમ થવા લાગી પણ તે વખતે તો સામાન્ય તખીયત નરમ હતી. માગશર મહીને થોડી તખીયત નરમ રહી અને પાછી સારી થઈ. થોડો થોડો છાતીનો ફુખાવો રહ્યો. ત્યાં તો દિવસો અને મહીનાએ ગયા. ૧૬૫૬ નું ચાતુર્માસ એકું થતિએ પણ પોત પોતાના નીમાએલા ચોમાસે ચાલ્યાં ગયાં. રહ્યા ક્રક્તા એક થતિ તથા શિષ્ય અવસ્થામાં પૂજય છગનલાલજી અને નોકરવર્ગ અશાડ વઢી ૧ થી પૂજયશ્રીને છાતીનો ફુખાવા સાથે તાવની શરૂઆત થઈ. અશાડ વદ ૮

પછી હીન પર હીન વ્યાધી વધવા લાગો પૂજયશ્રીને ચાતવામાં પણ અડયણ આવવા લાગો. શરીર અને મોઢો ઉપર થોથર જેવું જણાવા લાગ્યું અને તેથી પોતાથી ઉઠી પણ શકાતુ નહોતુ. ગામોગામ પુજયશ્રીની નરમ તખીયતના સમાચાર પહોંચી ગયા. જેથી શાતા પૂછવા અને દર્શન કરવા ગામોગામથી શ્રાવકો આવવા લાગ્યા. મુંબાંધના શ્રીસંઘને જણું થતાં તરતજ વિદ્યાયતી દવા પૂજયશ્રી નહોતા લેતા જેથી પ્રભ્યાત વૈહને લઈ પુજયશ્રી પાસે આવ્યા. ઉરણું શ્રીસંઘ તરફથી પણ દવાના ચોગ્ય પ્રભાંધો કરવામાં આવતાં હતાં. ખીળ પણ સારા પ્રભ્યાત વૈહને લઈ અન્ય સંઘ પણ ત્યાં આવ્યાં હતાં. દવાના પ્રયત્નોમાં જરાચે ખામી ન રહી. મુંબાંધથી પૂજયશ્રીની સુશ્રષા કરવા ચોમાસુ રહેલ યતિઓ પણ પૂજયશ્રીની સેવા કરવા આવ્યા. માંદગીની પ્રત્યેક સ્થળે ખણર મળતા ગામોગામથી શાતા પૂછવા સેંકડોની સંખ્યામાં સ્ક્રી-પુરુષો આવવા લાગ્યા. ચોગ્ય ઉપચારો તો ચાલુજ હતાં. પણ કર્મની અનુકૂળતા ન હોય ત્યાં માનવી લાચાર છે. આવી ને આવી તખીયતમાં અશાડ માસ પુરો થયો. શ્રાવણુની શરૂઆત થઈ તો પણ વ્યાધિ શાંત પામ્યો નહીં. અને તેજ સ્થીતીમાં શ્રાવણુ શુદ્ધ ના ૧૫ દિવસ પણ પસાર

પૂજયશ્રીનો સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસંસ્કાર.

થઈ ગયા. આવકો રાત અને દિવસ અહનિશા સેવામાં તૈયારજ રહેતાં. સૌ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે ઉપચાર બતાવતાં ત્યારે પૂજયશ્રી કહેતા કે હવે બાધ્ય ઉપચારની જરૂરીઆત નથી. હવે તો અંતરના ઉપચાર મને કરવા દઈ શાંતિ લેવા ધો. આવણું વહના દિવસો શરૂ થયા અને પૂજયશ્રીની વેદનાના દિવસો પણું શરૂ થયાં. જ્યારે પૂજયશ્રીએ બાધ્ય ઉપચારની ના પાડી ત્યારે મુનીમંડળ અને શિષ્યવર્ગ ગલરાઈ ઢીકો થઈ ગયો. પૂજયશ્રીએ જ્યારે જાણ્યું ત્યારે પૂજયશ્રી શિષ્યવર્ગને હીમતપૂર્વક કહેતા કે જે નિયમને તિર્થંકરો પણ તાણે થયા છે તે નિયમ બધાયને લાગુ પડે છે. જન્મ પામનારને ભરણું તે નક્કી છે. એમાં કોઈનું કંઈ ચાલતું નથી. માટે આ પ્રસંગે તો તમારે ધર્મના સુત્રો સંલળાવવા એજ તમારું કર્તાંય છે. મારા પ્રત્યે મોહ હોય તો ધર્મના શખ્ફો સંલળાવો તોજ તમારી સાચી લક્ષ્ણ છે એમ મને લાગશે.

વાંચક ! આવણું વહીના પણું ૬ દિવસ ગયા. આધિએ એકદમ જોર કર્યું. જરા વધારે સોઙ્લ શરીર ઉપર દેખાવા લાગ્યા. એકી સાથે જાણે વેદનીય કર્મ ઉમજ થયું હોય તે પ્રમાણે પૂજયશ્રીની સ્થીતી દેખાવા લાગી. શરીરમાં તીવ્ર વેદના થતી

હતી રોગનું જેર વીજળીનો વેગે પવનની જેમ શરીરમાં વધતું હતું પરંતુ ત્યાં રહેલા યતિએ, શિષ્યો અને શ્રાવકો રોગનું પ્રમાણું પૂજ્યશ્રીની અનહદ સહન શીલતાથી જાણી શક્યા નહોતા. જેમ દર્દ વધતું ગયું તેમ તેમ પૂજ્યશ્રી આત્મ સમાધીમાં સ્થીત થતા ગયા. આવી રોગથ્રસ્ત સ્થીતીમાં પણ પૂજ્યશ્રીની શાંતિ અને ધૈર્ય અદૌકીક હતા. વેદના વધુ પ્રમાણુમાં છે તેમ ખતાવનારે એક પણ શાખદ પૂજ્યશ્રીના મુખમાંથી નહોતો નીકળતો. લક્ષ્ણિતવાન શ્રાવકો રાત દિવસ ઉંલગરા કરી સેવા કરવા લાગ્યા. સર્વે યતિએ અને શિષ્યોમાંથી શિષ્ય અવસ્થામાં રહેલા પૂજ્યશ્રી છગનલાલજીએ અને શ્રાવકવર્ગમાંથી ઉરણું શ્રી સંધના ત્રણું ચાર કાર્યવાહકોએ બ્યવહારિક તમામ કામકાજ છોડીને પૂજ્યશ્રીની સેવા કરવા ઉપાશ્રે જ રહેવા લાગ્યા. પૂજ્યશ્રીની તથીયત વધુ પ્રમાણુમાં નરમ ધવાથી વડોદરા સુકામે ચાતુર્માસ રહેલ આચાર્ય શ્રી ખુખ્યચંદ્રજીને તાર કરી ઓલાવવામાં આવ્યાં. ૧૬૫૬ ની શ્રાવણ વદ ૯ આવી, ઘણી જ વેદનામાં પણ પૂજ્યશ્રી પોતાનું નિત્ય કર્મ નહોતા ચુક્તાં. શિષ્યોને અને શ્રાવકોને કહ્યું હતું કે જ્યારે મારાથી નિત્ય કર્મ ન થાય ત્યારે જાણુંને કે પૂજ્ય-

પૂજયશ્રીનો સ્વર્ગવાસ અને દિવ્ય અર્ગનસંરકાર.

શ્રી હવે હેઠ છોડી જશે. તે કથન અનુસાર શ્રાવણ
વદી ૮ ને દીવસે વ્યાધિએ લયંકર રૂપ લીધું અને
નિત્ય કર્મ પણું પૂજયશ્રીથી ન ધઈ શક્યા. એટલે
સમાજમાં ભારે ચીંતા પ્રસરી ગઈ. સૌના સુખ
ઉપર ગલાની ફરી વળી. શિષ્યોનાં સુખ ઉપરથી
તેજ ઉડી ગયું જાણી પૂજય શ્રી શિષ્યોને હીંમત
આપતાં. જ્યારે પૂજયશ્રીની વ્યાધિ વધવા લાગી
ત્યારે ગામમાં તપશ્ચર્યાએ ચાલુ થઈ. ઉપવાસ
સહીત પ્રાર્થનાએ થવા લાગી દાન પુન્ય દેવાયાં
ખાધાએ લેવાઈ, જેને જેમ ઝાવે તેમ યથાશક્તિ
પ્રમાણે સૈએ પોતાના પ્રયત્નો પૂજયશ્રીની શાંતિ
માટે કરવા લાગ્યાં. આયુષ્યની હોરી પરિપૂર્ણ થઈ
ગઈ હતી ત્યાં શું થાય? પૂજયશ્રી પણ પોતાનો
અંત સમય નજીક જાણી જેના ઉપર નજર પડે
તેને પોતાની પાસે એસવાનું સુચવતા. કર્માથી ઉમજ
થએલ અને વેહનીય કર્મના જેરે વ્યાધિમાં કોઈ
ઘટાડો કરી શકે એમ નહતું. છતાં પૂજયશ્રીને
શાંતિ આપવા ખાતર પ્રયત્નો ચાલુ હતાં. પૂજયશ્રી
પણ આ ધ્યાત્મ જ્ઞાનમાં તરણોદ બની નાહી રહ્યા
હતાં. આવી વ્યાધિમાં પણ પૂજયશ્રીમાં અપૂર્વ
શાંતિ ફેખાતી હતી. વિશાળ માનવ સમુદ્ધાય ચારે
તરફ બેઠો હતો. થતિએ અને શિષ્યોને પોતાની

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જ્ઞવનચરિત્ર.

શાસ્યા પાસે બોલાવી બધાના મસ્તકો ઉપર હૃથ
ફેરવતાં જણે પોતે છેવટની રજા લેવાની ઈચ્છા
પ્રદર્શિત કરતા હોય તે પ્રમાણે બોલ્યા “ મુનિરાજો !
તમારા શાસનને હીપાવજો, કલહનો નાશ કરી,
એકયતાને કેળવજો. આચાર્ય શ્રી ખુણચંદ્રજીની
આજામાં રહેજો. તેઓ આત્મધર્મિ સંયમમાં એક
નિષ અને મારા કરતા પણ તમારી વધુ સંભાળ
રાખે એવા છે. હું અને તે દેહથી જુદા છતાં
એક જ ઇપ છીએ. એમ માની આજામાં રહી
તેમની સેવા કરજો. તમારા વેષને અજવાળજો.
શાસનની શોલા વધારજો. ક્ષ....મા....ક....ર....જો.”
પૂજયશ્રી બોલતાં થાકી ગયાં. વિશાળ સમાજના
એક એક આત્માને ઉપરનો શબ્દ સાંલળી આંખમાં
પાણી ભરાઈ આવ્યાં. તે દ્વાય જ કરુણાથી ભરપૂર
હતું. યતિએ અને શિષ્યમંડળની પણ આંસુ-
એથી આંખી છવકાવા લાગી, ત્યાં શિષ્ય અવ-
સ્થામાં રહેલા અત્યારના પુજય છગનલાલજીએ
હૃદયને મજબુત બનાવી, પૂજયશ્રીને કહ્યું કે શુરૂહેવ
આપની આશાનું યથાર્થ પાલન કરીશું. વેપ પરિ-
ધાન કરી મરણુના લોગે પણ શાસનની ઉન્નત
દશા કરી હીપાવશું. આપ નિશ્ચિંત રહેા ! અમો
ખાળકોને આપ ખમાવી અમને ભારે કરો છો. ખરુ

પૂજયશ્રીને સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસરકાર.

ખમાવવું અમારા જેવા પામરોને ના હોય કે આપના ઉપકારથી અમે જ્ઞાન સંપાદન કર્યું અને જીવનનો મર્મ સમજાયાં. તે ઉપકારનાં પ્રમાણુમાં અમે આપની સેવાનો લાલ ઉઠાવી શક્યા નથી.”

વાંચક ! અશ્રુપૂર્ણ હૈયુ હવે વધુ લરાઈ ગયું જેથી વધુ એલી શકાયુ નહીં. સમયના પરીક્ષક એવા પૂજયશ્રીએ સમય જાણીને પોતે આત્મજ્ઞાનની વાતો શરૂ કરી. પોતાનો આધ્યાત્મિક અનુભવ કહી શોકના પ્રસંગને શાંતિના રૂપમાં ફેરવી નાંખ્યો. શિષ્યો પણ તે સાંલળવા તદ્વાન થયા. શ્રાવણ વદ ૬ ની રાત્રી પડી. પૂજયશ્રીના દેહને ટકાવવા સકળ સંઘ પોતાનો દેહ ગણી સેવા કરી રહ્યો હતો. મોટા ચક્વર્તિની પણ જે સેવા ન થાય તે સેવાં મોટા લક્ષાધિપતી શ્રીમંતો પોતાના હાથે પૂજયશ્રીની કરી રહ્યાં હતાં. પરંતુ તે વંદનીય આત્માને સ્વર્ગનું આમંત્રણ મલ્યું હતું તેથી કોણ અટકાવી શકે ? રાતના દસ વાગેથી શ્વાસનું પ્રમાણ વધવા લાગ્યું છતાં. પૂજયશ્રીને તો અપૂર્વ શાંતિ હતી. એમને એમ રાત્રી બ્યતિત થદ પૂજય શુરૂહેવ સન્મુખ દ્રષ્ટિ રાખી સર્વ એસી રહ્યાં હતાં. શ્રાવણ વદ ૧૦ ની સવારે લગભગ દસ વાગતા સકળ સંઘને શોક-સાગરમાં મુકી ઉદારીક શરીરનો ત્યાગ કરી પૂજય-

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.

શ્રીનો અમર આત્મા સ્વર્ગો સીધાંયો. જૈન શાસનનો એ પ્રકાશતો સ્તુર્ય તે દિવસે અસ્ત થયો. ચતુર્વિધ સંધનો મહાન સ્થંભ અને પ્રાણુ તુટી પડ્યો.

વાંચક ! કર્મની સ્થીતિ અલોકિક અને આશ્ર્ય પૂર્ણ છે. જેના આયુષ્યની હોરી તુટી તેને સંધનાર કોઈ નથી. જૈન સમાજને સુશોલિત ખનાવનાર ગૌરવશાળી એ હેઠીઘ્યમાન આત્મા અનેક પરાક્રમો કરી ઉડી ગયો. અસાધારણ ચમકાર કરતો લોંકાગચ્છ રૂપી આકાશનો એ ચમકતો સીતારો અસીમ ચમકાર કરી ચાદ્યો ગયો. શાસન સેવામાં અનેક વીધનો અનેક જ્ઞાનો સહન કરી હીન અને ગરીણ મનુષ્યોનો સંહેશ સંલગ્નાવવા જીનહેવ સમક્ષ રણુ કરવા સ્વર્ગો સંચર્યો. મારવાડનું એ રતન અને ગુજરાતનો મણી ઉરણુમાં વીલય પામ્યો. લોંકાગચ્છનો એ કોહીનુર નીસ્તેજ થધ રથ્યો. કદ કલમ આ સ્વર્ગવાસનું વણુંન કરવા શક્તિવાન છે ? દ્વિષ્યમાન જગતમાં કદુ એવું હૃદય હુશે કે આવા સમયમાં નહી રડે ? જેને છેલા ચાતુર્માસ સુધી પણ પોતે કસોટી રૂપ અસદ્ય પરિસરો સહન કરવાં પડ્યાં તેઓશ્રીની પવિત્ર કૃતિને ઝાંખી પાડવા સાદડી રાણુપુર અને ગોંડલ તથા અન્ય સ્થળોએ ખુબ પ્રયાસો થયા હતા. પણ સુર્યની સામે ધુળ ઊડાડનારની જે દશા થાય

તેવી જ દશા વિરોધીએની થએલી. આવા પ્રતાપી પૂજયશ્રી શિષ્ય અને સમાજને મુકી, માયા મમતાને છોડી રાત્રી દિવસ ને સેવા કરનારાએ હતાં તેઓને પણું પડતા મુકી પૂજયશ્રીના આત્માએ માર્ગ લીધો. પૂજયશ્રીના સ્વર્ગવાસના આ ઐદ્ધકારક સમાચાર ઉરણું અને મુંખદમાં ફરી વળ્યાં. શ્રાવકોમાં તો હાહાકાર વર્તાય પણું એક વાર જેણું પૂજયશ્રીના દર્શન કરેલ હતાં તેવા મનુષ્યો પણું પૂજયશ્રીનો સ્વર્ગવાસ સાંલળી ધણ્ણા દીલગીર થયાં હતા. દેશાવરોમાં ઉરણું તરફથી પૂજયશ્રીના અવસાનના ઐદ્ધકારક સમાચાર મોકલવામાં આવ્યા. ઉરણું શ્રીસંધ તથા અન્ય ગામોના સેંકડોની સંખ્યામાં શ્રાવકો આવેલ હતા. તેઓ ગુરુભક્તિની તજવીજ કરવા લાગ્યા. આખા ગામમાં હડતાળ પડી ગઈ તથા મુંખદ અને લોંકાગઢના પ્રત્યેક સ્થળોએ ખબર પડતા શ્રાવકોએ પોત પોતાની કુકાનો બંધ કરી ખપેરના તમામ શ્રાવક વર્ગ ઉપરાંત ગામના પ્રતિષ્ઠિત મનુષ્યો હિંદુ મુસલમાન અને કિશ્કીયન જેવી કોમ પણું પૂજયશ્રીની સમશાન યાત્રામાં ઉપાશ્રેયે આવી અભિન સંસ્કારનું ધી ઓલાઈ રહ્યા પછી ઉત્તમ શીખીકામાં પૂજયશ્રીના દેહને સ્થાપન કરી “જ્ય જ્ય નંદા, જ્ય જ્ય

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત.

ભદ્રા, ” એ શાખદો બોલતાં લગભગ સાતથી આડ હળવર માણુસો સાથે પૂજયશ્રીના દેહને ઉપાડ્યો અને નિયત કરેલો જગ્યા ઉપર કે જે ગામથી એક માઈલ ફુર છે ત્યાં દેહને લાવ્યાં. પૂજયશ્રીના દેહને સુખડનાં લાકડામાં ગોઠવતાં હતાં ત્યાં સુંખડના બાકી રહેલા શેઠીઆએ આવ્યા અને પૂજયશ્રીના દેહને અમે અભિન સંસ્કાર કરશું એમ સુંખડ અને ઉરણું બંને શ્રીસંઘ વચ્ચે રસાકસી ચાલી. પરસપર અમે જ અભિન સંસ્કાર કરીએ એવી હઠ ઉપર આવતા સાંજ પડવા આવી. રાત્રીએ પૂજયશ્રીનો દેહ બહાર ન રહે પણ જયાં હઠાચહ શરૂ થયો ત્યાં ધીજું શું થાય ? બંને પક્ષો ધી બોલવામાં હતા. હળવો મણ ધી થયું કોઈ પાછું પડતું નથી. અને કોઈ હઠ મુક્તું નથી. તે વખતમાં દિવ્ય રીતે પૂજયશ્રીના જમણા અંગુઠામાંથી અભિન પ્રગટ થઈ સ્વયં અભિન સંસ્કાર પામી ગયા. હળવો મનુષ્યો સ્તખધ થઈ ગયા અને સર્વને આશ્ર્યમાં ગરકાવ કરી નાખ્યા ! ! !

ત્યાર પછી સર્વે પાછાં ફર્યા. રસ્તામાં શોકા-
ચિનમાં કુલભતા લક્ષ્યતવાન આત્માએ પૂજયશ્રીના
વિરહથી હૃદયમાં ફુઃખ ધરતાં. આવા શુરૂ હવે નહીં
મળે. આપણું ને પૂજયશ્રી વગાર સત્ય ધર્મની, નિર

બની, કોણું હંકલ કરશે ? શાંકાઓના સચોટ જવાએં હવે પૂજયશ્રી વગર કોણું આપશે ? હૃદયનો ભાર હવે કોની આગળ ખાલી કરશું ? આપણું જીવનની અપૂર્ણતાએ હવે આપણુંને કોણું કહેશે ? પૂજય આચાર્યશ્રી ખુબચંદ્રજી વિક્રાન છે તો પણ પૂજયશ્રીના વિરહથી હૃદયમાં પડેલો ધા તેએ નહીં રૂજાવી શકે. ગુણુના આગાર જેવા અતિ ઉત્તમ પ્રલાવશાળી પૂજયશ્રી હવે કુરી આપણુંને કોઈ દિવસ દર્શાન નહીં દીએ. અરે કાળ તારી ગતિ અજખ છે તારી સત્તા આગળ જગતની ખંડી શક્તિ નકામી છે. આવાં સંચમધર આત્માને તારે શરણું થયું પડયું તો અમારી રી વીસાંત. પણ આવાં મહાપુરુષને આ પૃથ્વી ઉપરથી ઉપાડી જવાથી અમને તો ધાણું જ નુકશાન થયું છે. તેમ તેનાથી તને કાંઈ લાલ થયો નથી. પણ તેમાં તારે શો વાંક તેમાં તો અમારા મંદ લાગ્યનો જ ગુંડો છે. એમ શોકયુક્ત ઉદ્ગારો કાઢતાં શાંતિ નહીં મળે. પોતાનો વિરહ ઓછો કરવા ઉપાશ્રેયે આવી ઉપદેશ સાંલળી પોતાને ઠેકાણું ગયા. સ્થળે સ્થળેથી શોક પ્રદર્શિત કરતા તારે અને ટપાલો થોક બંધ આવવા લાગી. જાહેર સલાઓ ભરી ગામે ગામથી શોક પ્રદર્શિત કરતાં ઠરાવો

આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત.

આધ્યા. આપા સમાજને આવી રીતે પૂજયશ્રીની અમુલ્ય ખામી જણાવા લાગી.

વાંચક ! પૂજયશ્રી ૧૦૦૮ શ્રી લોંકાગચ્છાધીપતિ શ્રી કલ્યાણચંદ્રજી ૬૬ વરસની ઉંમરે ૪૬ વરસ સુધી દીક્ષા પાળી, ૨૫ વરસ આચાર્ય પદવી ઉપર ગીરાજમાન થઈ શાસન સેવા કરી અનેક આત્મા-ઓના હૃદયમાં ધર્મ સિંચન કરી, પૂજયશ્રીએ પોતાનું જીવન સાર્થક કર્યું. પૂજયશ્રીમાં જન્મથી જ પરોપકાર વૃત્તિ, સાહાય્ય, સાહાધ, વિગેરે શુણોણી શુથણી હતી અને તેથી જ તેમનું જીવન, તેમની દીક્ષા તેમની આચાર્ય પદવી, તે સર્વ ખીજના કલ્યાણ અર્થે જ હતું. પૂજયશ્રીનું ચરિત્ર પ્રારંભથી અંત સુધી અદ્વિતીય અને અકથનિય છે. તે વર્ણન કરવાની મારામાં શક્તિ નથી. મોટા બુદ્ધિશાળીએ જીવન પર્યાંત પૂજયશ્રીના જીવન ચરિત્રનું વર્ણન લખે તો પણ યથાર્થ વર્ણન ન થઈ શકે. પૂજયશ્રીના સમયમાં તેમની શક્તિની સામે મુકાણલો કરી શકે એવી વ્યક્તિ મળવી તે હુલ્લાલ છે. તેમના સ્વર્ગ-વાસ ણાદ પૂજય સ્વ. આચાર્યશ્રી ખુખ્યચંદ્રજીના હાથે તેમની અદણુ પાહુકા સવાંત ૧૬૫૭ માગશર શુદ્ધ ૧૦ ના દિવસે સ્થાપન કરવામાં આધ્યા.

પૂજયકી કલ્યાણુચંદ્રલ મહારાજનુ



સમાધિમંહીર-ઉરણુ અંદર

પૂજયશ્રીનો સ્વર્ગવાસ અને દિવ્ય અભિનસંસ્કાર.

તેમનું આત્મજ્ઞાન અદ્વિતીય ગુણો અનહૃદ
આકર્ષણું અલોકીક શક્તિ અત્યુત્તમ તોજ અને
અપાર શાંતિ અનોડ ગાંભિર્ય તેઓશ્રીની પાટે
બિરાજમાન થચેલા પૂજયાચાર્યશ્રી ખુણચંદળમાં
પણું થોડે ધણે અંશે હેખાતી હતી. તેઓશ્રી પણ
શાસનની અને સમાજની સેવા ખજનવી પછે વરસ
દીક્ષા પાળી ઉદ્ઘ વર્ષ આચાર્ય પદવી લોગવી
સવંત ૧૯૮૨ ના માગશર શુદ્ધ દ ને મંગળવારે
તેઓશ્રી પણ સ્વર્ગવાસી થયા. વાંચક ! ત્યાર પછી
તેમની પાટે તેઓશ્રીના વિક્રાન શિષ્ય તે વર્તમાન
આચાર્યશ્રી ન્યાયચંદળને સવંત ૧૯૮૨ ના ફાગણ
વદ ૧૨ ને ગુરુવારે વિધી સહીત ગાહી આપવામાં આવી.

તેઓ પણ વિવિધ ચાતુર્મસ કરી થાડી થાડી
જગૃતી લાવી સમયાનુકુળ વતી શાસનને દીપાવલા
પ્રયત્ન કરી રહ્યા છે. પૂર્વની જેમ શાસનનો વિજય
ધવજ ફરકે એમ દુર્ઘટી વિરમુ છું.

શાંતિ.....શાંતિશાંતિ

સમાઝ

દીનહીના ખાદશાહ તરફથી મળેલો પરવાનો

دیکشنری



سازمان اسلامی شهرداری

وَمِنْهُ يَعْلَمُ الْكُفَّارُ
فَإِنَّمَا يَعْلَمُ قُلُوبُ



四百

M
marked by a dot
at end of line

Reported on the 10th day of the month of
February 1900 by the Comptroller General
of the United States of America.

Argyropelecus *gigas*

TRANSLATION OF THE PERSIAN FIRMAN.

(Translation of a Firman in Persian which appears to be a copy itself from the drawn seals and a certificate in English endorsed thereon certifying it to be a true copy)

a (This is an impressed seal without ink partly covered by a piece of paper pasted across the seal in the right corner at the top of the Firman to prevent it from further being torn, as a part of it was already torn, which appears to be the stamp vendor's seal)

b (This is an impressed seal without ink, containing inscriptions in four languages as follows:-

1. English
2. Arabic
3. Balbod
4. Gujrati

c (This small piece is written in red ink and in the writing of “Toghra” meaning the Chief law Officer’s signature or the Royal titles of a Sovereign prefixed to letters, diplomas or other public deeds, which are written in a fine ornamented hand.


In this there are some letters which are illegible).

God is most great

A seal drawn in black ink as follows.

d The most victorious (and) brave King Shahaboddin Mohammad Shah Jahan...

STAMP OF NINE COINS.



At this time (our) Firman of exalted dignity, (and) marked with the emblems of happiness meets the honor of being emanated and the glory of being cited. That whereas Sari Puj Jesvant of Gujrat of Louk Gachh is, (in religious matters) a well disciplined and an abstentious man, and appeared in our Majesty's presence, the Hozur's (i. e. our) most holy (and)

exalted

(LITERALLY " TEMPERAMENT "
OR " CONSTITUTION ")

Exalted mind has been pleased by the above mentioned (gentleman's) interview, (therefore) brought out the whole empire, in the same manner as from the ancient times the tribes of Us-walan saravak have been giving loaves and sheets (of cloth) and dresses to the above mentioned (Sari Puj Jesvant according to the custom of their religion and the of the Muktab of

their Dharam (or religion), they should, according to the said ancient custom, continue to give to him, and the said rule should remain continued in favour of the offsprings and children of the above mentioned (Sari Puj Jesvant.) and none of the Sravaks and Jatis of other Gachhs can quarrel and hold any alterations with them and their Sravaks on any reason of reasons and on any cause of causes. It is necessary that (our) famous children of high dignity, and the Grand Rulers, and the officers performing the important affairs of the Courts, and the executors of the Royal affairs, and the Jagirdars, and the Millionaires of the present and the future should exert (themselves) for keeping the continuation and preservation of this firm, honorable, (and) most holy order, and should not neglect the least possible regard in favour of the above mentioned (Sri, pooj Jesvant), and should not differ and deviate from this order. Written on the 5th fifth of

the auspicious month of Ramazan in the 22nd year from the august accession (to the throne) corresponding to the year 1058 of Hijri (corresponding to the end, from 20th to 30th of September in the year of Christ 1648)

(The text of what follows is written on the back of the Firman.)

At the Resalab of the true son and the most sincere child Mohammad Dara Shekuh.

(A drawn seal in black ink as follows:-)

According to the attestation of Bakhshial-molk Resalatkhan this firman of exalted glory is written.

(The text of the following passage is written in English.)

No. 7.

Surat Court of Adalat

25th March 1844

∴ 169 ∴

Registered in the 10th Page of the
first volume of the General Register
kept for the Zilla of Surat for the year
1844, having been presented at 12 o'
clock of the 23rd day of March of the
said year. (Signed) C. I. Erskine

Suprintt.

True copy

C. L. Gubuy

Superintendant.

(The text of the following lines
is written in English.)

(SOME LETTERS IN THE TEXT
ARE ILLEGIBLE)

e 2 No. 21329.....the year 1842
given to Gordhanji Savchand himself.
Gopi Pura, dated seventeenth March 1844.

Received Rupees 2 for 247 Words

No. 7th at page 10th.

A true translation.

Persian Translator & interpreter.
Bombay 3rd June 1878.



શાસન સમ્માટ આ.ભ.

શ્રી વિજય નેમિસૂરિશ્વરજી મ.સા. નાં શિષ્યરત્ન
પ.પૂ.આ.ભ. શ્રી પદ્મસૂરિ ત્રંથાલય
દાદા સાહેબ, ભાવનગર

| | | |
|--|--|--|
| | | |
| | | |
| | | |
| | | |

